


હુણા કુ અંતરનો અવાજ



લેખક :

મુહુદ્વા નીસારહુસૈન રાજપાટ

પ્રકાશક : ગુલામ અબ્દુસ્ રાહુસૈન

હું આ કે અંતરનો અવાજ

લેખક :

મુલ્લા નીસારહુસૈન રાજપાર

પ્રકાશક: ગુલામ અબ્બાસ રજાહુસેન

અ ૫ ણ

અહ્લાહ રખ્ખુલ આલમીન, હ૦ ચઉદ માઅસુમીન અ૦મ૦ ના સદકામાં,
 મારા પિતાજ ગુલામહુસૈન દામજ રાજપાર,
 મારી માતાજ ફીજાબાઈ મોહમ્મદઅલી ખમીસ,
 મારી માતા તૂલ્ય ફર્હબા રૂક્યાબાઈ,
 મારા બન્ને ભાઈઓ મુસલીમ અને મોહમ્મદ ની
 મગફેરત કરે અને તેમને હ૦ મોહમ્મદો આલે મોહમ્મદ સ૦ ના મહેલ સમીપ ઉચ્ચ સ્થાન અતા
 કરે, એજ હુઆ સહિત, મારા મહુમોને આ પુસ્તક અર્પણ કરું છું, જેમાં સહકાર બદલ અહ્લાજ
 ગુલામઅબ્બાસબાઈ હાજ રજાહુસૈનબાઈનો આભારી છું.

મુલ્લા નીસારહુસૈન રાજપાર
 સેંધેની લારેયુનિયન
 ફંસ

મુસીબત નાખૂં કરવાનો બહુજ અક્સીર અમલ

તહારત સાથે અને વળું કર્યા બાદ, ડિબ્લા સામે બેસી, સઉ પ્રથમ ચર્ચા વખત સલવાત પડીને એકસો તેંશીસ વખત (૧૩૩) નિચે જણાવેલો ઝીકર અદા કરવો અને આખીરમાં ફરી ચર્ચા વખત સલવાત પડી, અલ્લાહ પાસે, હિન્દુ મોહમ્મદો આલે મોહમ્મદ સું નો વાસ્તો આપીને પોતાની દુઆ માંગવી:-

યા કાશેફલ કબે ' અલા અખીકલ હુસ્યન , ઈકશીફ કબી ' , બેહક્કે અખીકલ હુસ્યન અલયહિસ્સલામ

(અય તે કે જે પોતાના ભાઈ હુસ્યનની મુસીબતને હઠાવી દીધી, મારી તકલીફને પણ, તમારા ભાઈ હુસ્યન અલયહિસ્સલામના વાસ્તાથી, દુર કરી આપો)

આ અમલ, અલમદારે હુસ્યની, સકકાએ સકીના, મૌલા અબુલ ફ઼લીલ અખ્બાસ અલયહિસ્સલામનો છે અને દરેક પ્રકારની ઘાસ - તરસ મટાડવા માટે: ઈલમની ઘાસ, માલની ઘાસ, ઔલાંની ઘાસ..., તેમજ પ્રત્યેક નેક હાજત અર્થે બહુજ અસરકારક અને અજમાવેલ છે.

કરજથી છુટકારો કેમ મળે ?

એક માણસે, આપણા નવમા ઈમામ, હિન્દુ મોહમ્મદ તકી અલયહિસ્સલામની ખીદમતે બા બરકતમાં, લખીને અરજ કરી કે: મૌલા! હું કરજમાં બહુજ હુબેલો છું, માટે તેમાંથી મને છુટવાનો ઉપાય બતાવશો.

ઇમામે જવાબમાં ફરમાવ્યું કે: વધુ ઈસ્તેગફાર કર્યા કરો

(અસ્તગફેરુલ્લાહ રજ્બી વ અતુબો એલયહે ની તરખીદ પડતા રહો)

અને સુરએ કહ્યું (ઈન્ના અન્જલનાહો) ની તિલાવત બહુજ કરો.

જરૂરી હાજત પૂરી થવાનો ચમત્કાર જોવો છે ?

મર્હુમ અલ્લામા હાજ નાજ ગુલામઅલી સાહેબ અ.મ. પોતાની પુસ્તિકા નામે કંઈ મજફીમાં ફરમાવે છે કે: લોઆલીએ મખ્જુનામાં લખે છે કે અગર કોઈને અલ્લાહ તઆલાની દરગાહમાં હાજત હોય, જેમકે માલ, ઈજ્ઝત, ઈલ્મ, અમલ મેળવ્યાની ખાહિશ હોય, અથવા બલામાં ફસાયો હોય અને તેથી મુક્ત થવા ચાહતો હોય, યા ફરીરી અને નાદારીના કારણે ફાક થતા હોય, અથવા શારિરીક યા રૂહાની બીમારીમાં સપડાયો હોય, મતલબ કે એના જેવી હાજત પુરી થવા નિયે મુજબ અમલ કરે :-

અમલ : બરાબર ઉપરાઉપર નણ જુમાહની રાਸીએ, અર્ધી રાત પછી, રાતના બે ભાગ વિતી ગયા બાદ, વજુ કરે, હાજત પુરી થવાની નીયતથી કુરબતન એલલ્હાહ બે રકાત નમાઝ અદા કરે, જેમાં અલ્હમદના સુરા બાદ, ચાહે તે સુરો પડે અને નમાઝ ખત્મ થયા પછી એકસ્થો વખત સલવાતની તસ્બીહ કાઢે.
તેજ હાલતમાં પોતાની જગ્યાપર કીબ્લા સામે રહીને, એક હજાર અને એક વખત (૧૦૦૧) પડે:

બિસમલ્લાહિર રહમાનિર રહીમ, બેહક્કે બિસમલ્લાહીર રહમાનિર રહીમ

આખીરમાં ફરી એકસ્થો વખત સલવાત પડી પોતાની હાજત અલ્લાહની બારગાહમાં પેશ કરે, ઈન્શાઅલ્લાહ પુરી થશે.

એજ મુજબ બીજા અને ત્રીજા જુમાહના અમલ કરે અને ખુદા ઉપર ભરોસો રાખે,
અલ્લાહ દરેક વસ્તુપર કુદરત રાખેછે, કદી નિરાશ થવું નહીં.

શું આખો દિવસ આનંદમાં પસાર કરવો છે ?

જુલ્દ્દિકાર બુક ડીપો તરફથી પ્રગટ થયેલી પુસ્તિકા તોહફાએ નજીતમાં લખે છે કે અગર કોઈ શખ્ષા, આખો દિવસ, દરેક જાતના રંજ, ગમ અને બલાથી હિંફાજતમાં રહેવા ચાહે તો સવારના આંખ ઉઘડે કે તરત, કોઈની સાથે વાત કરવાની પહેલાં, નીચે જજાવેલી દુઆ દસ વખત પડે :-

બિસમલ્લાહીર રહમાનિર રહીમ

વલા હવ્લ વલા કુપ્વતા ઈલ્મા બિલ્હાહિલ અલિથ્યિલ અજીમ

(અને નથી કોઈ શક્તિ અને તાકત સિવાય જે મહાન અને બુલંદ અલ્લાહ પાસેથી મળે છે)

અજબ - ગજબનું તાવીજ

હાજી બરકતઅલ્લીભાઈ નાયાણી - કરાચીના સૌજન્યથી, ઈસ્નાઅશારી માસીક સપેમ્બર ૨૦૦૩ માં પ્રગટ થયેલો, મૌલાના સાદીક હસન સાહેબ તરફથી બતાવેલો અમલ :- દરેક જાતની તકલીફ વખતે અને ખાસ કરી બીમારી માટે અક્સીર છે :

પહેલા નીચ્યત કરે કે: હું જીયારતે વારેસા પડું છું, ઈમામે ઝમાનાની માતાજી, જનાબે નરજીસખાતુનની નીયાબતથી, કુરબતન એલલ્વાહ અને તે બાદ પુરી જીયારત પડે.

જીયારત ખત્મ થતાંની સાથે કહે કે: હું આ જીયારતે વારેસાનો સવાબ જનાબે નરજીસખાતુન સલામુલ્લાહે અલયહાને હદ્દીયો કરું છું.

આખીરમાં ફરમાવે કે: અય મારા ઝમાનાના ઈમામ અને મારા મૌલા, મારા આડા અને મારા સરદાર! હું આપને આપની માતાજી જનાબે નરજીસખાતુન બીબીનો વાસ્તો આપું છું કે મારી આ હાજત તમે અલ્લાહ પાસે પુરી કરાવી આપો (અથ્યાં પોતાની જે હાજત હોય તે પેશ કરે)

યાદ રહે કે દરેક અમલ પુરી તહારત અને યકીનની સાથે, વજુ બજાવી, કીબ્લા સામે રહીને કરવું અને બાદમાં નમાઝ પડતાં કદી ભૂલવું નહીં.

આખા મહિનાની સલામતી કેમ લેવી?

દરેક ઈસ્લામી મહીનાની પહેલી તારીખે, બે રકાત નમાઝ આ રીતે પડવી :-

પહેલી રકાતમાં સુરએ અલ્હમદ બાદ નીસ (૩૦) વખત સુરએ ઈખલાસ (કુલ હોવલ્લાહો અહદ) પડવો અને બીજી રકાતમાં સુરએ અલ્હમદ બાદ નીસ (૩૦) વખત સુરએ કહ (ઇન્ના અન્ગલનાહો) પડવો. નમાઝ ખત્મ થયા પછી આ આયતો પડવી:-

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વમા મીન દાબ્બતીન ફીલ અર્જે' ઈલ્લા અલલ્લાહે રિઝકોહા, વ યઅલમો મુસ્તકરરહા વ મુસ્તાફ-
અહા, કુલ્લુન ફી કિતાબિમ મોબીન. (સુરા: ૧૧ - આ: ૬).

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વ ઈન યમ્સસ્કલ્લાહો બે ઝુરરીન ફ્લા કાશેફા લહુ ઈલ્લા હું; વ ઈન યોરીદકા બે ખયરીન ફ્લા
રાદદા લે ફ્ઝલેહી; યોસીબો બેહી મંઘશાઓ મીન એબાદેહી; વ હોવલ ગફુર રહીમ. (સુરા:
૧૦ - આ: ૧૦૭).

બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

સયજ-અલુલ્લાહો બાઅદા ઉસરીં ન્યયુસરા. (સુરા: ૬૫ - આ: ૭).

બિસ્મલ્લાહિર રહમાનિર રહીમ

માશા-અલ્લાહો લા કુવ્યતા ઈલ્લા બીલ્લાહે. હસ્બોનલ્લાહો વ નેઅમલ- વકીલ.

(સુરા: ૩ - આ: ૧૭૩).

બિસ્મલ્લાહિર રહમાનિર રહીમ

વ ઓફ્વ્યેઝો અખ્રી એલલ્લાહે; ઈન્નલ્લાહા બસીરુમ બિલ એબાદ (સુરા:૪૦- આ: ૪૪)

લાએલાહા ઈલ્લા અન્તા સુખાનકા, ઈન્ની કુન્તો મેનજાલેમીન. (સુરા: ૨૧- આ:૮૭).

રજ્જે ઈન્ની લે મા અન્જલા એલયા મિન ખ્યરિન ફ્કીર. (સુરા: ૨૮ - આ:૨૪).

રજ્જે લા તજરની ફ્ર્દ'ન્વ વ અન્તા ખ્યરૂલ વારેસીન. (સુરા: ૨૧ - આ: ૮૮).

ત્યાર બાદ થોડો સદકો આપવો.

૪૦ ફાતેમા જહેરા સલામુલ્લાહે અલયહાની તરબીહની બરકત

આપણા છઠા ઈમામ, હ૦ સાદિકે આલે મોહમ્મદ અ૦ થી મનકુલ છે કે: અમે અમારા નાના બચ્ચાઓને ૪૦ ફાતેમા જહેરા અ૦ ની તરબીહનો હુકમ એજ પ્રમાણે કરીએ છીએ, જેવી રીતે અમે તમને નમાઝનો હુકમ આપીએ છીએ. આને તજી દેશો નહીં કારણકે જે આ તરબીહને હમેશાં પડતો રહેશે તે કદી કમનસીબ બનશે નહીં એક વધુ મોઅતબર હદ્દીસમાં છે કે: આપે ફરમાવ્યું કે મારી નજીદીક, દરેક નમાઝ પછી, ૪૦ ફાતેમા જહેરા અ૦ની તરબીહ, દરરોજ હજાર રકાત સુન્નત નમાઝ પડવા કરતાં બેહતર છે. એજ ઈમામના પિતાજી અને આપણા પાંચમા ઈમામ, હ૦ મોહમ્મદ બાકીર અ૦ થી રિવાયત છે કે: જે શાખા ૪૦ ફાતેમા અ૦ ની તરબીહ પડ્યા પછી ઈસ્તેગફાર કરશે તેને અલ્લાહ બક્ષી આપશે. જબાનપર તો તે તરબીહ ફક્ત સો વાર બોલવાની છે, પણ અમલના નાજ્વામાં તે હજારની સંખ્યા રાખે છે. તે શયતાનને દુર અને અલ્લાહને ખુશ કરે છે. રીત આ મુજબ છે: ૩૪ વખત અલ્લાહો અકબર, ઉત્ત વખત અલ્હમ્દોલીલ્લાહ, ઉત્ત વખત સુખાનલ્લાહ.

તરબીહાતે અરબાઅ ની ફ્રીલિટ

હો અમીરુલ મોઅમેનીન, અલી ઈજ્ઞે અબી તાલીબ અંમે જો બરાબ બિન આજિબને ફરમાવ્યું કે: શું તું ઈચ્છે છે કે તને કોઈ એવી ચીજ બતાવું કે જેને અદા કરવાથી તું ખરેખર અલ્લાહનો દોસ્ત બની જાય?

એડો કહ્યું : હા, મૌલા.

આપે ફરમાવ્યું કે: દરેક નમાઝ પછી, તસ્બીહાતે અરબાબ દસ વખત પડ્યા કર:

સુષ્ઠાનલ્લાહે વલ હમ્દો લિલ્લાહે વ લાએલાહ ઈલ્લલ્લાહો વલ્લાહો અકબર

જો તું એવું કરશે તો દુનિયામાં હજાર મુસીબતો તારાથી દુર રહેશે, જેમાંની એક છે દીનથી મુરતદ થઈ જવું અને આખેરતમાં તારા માટે હજાર દરજજાઓ તૈયાર હશે, જેમાંનો એક છે હો રસુલે ખુદા સ૦ ની પાડોશમાં રહેવાનું નસીબ થવું.

સુરએ ઈખલાસની શક્તિ

હો રસુલે ખુદા સ૦ ની એક હદ્દીસ મળે છે જેમાં આપ સ૦ ફરમાવે છે કે: જે શાખા દરરોજ સુષ્ઠના સમયે સુરએ ઈખલાસ << કુલ હુ વલ્લાહ અહદ >> ની દસ વખત તિલાવત કરે, તે દિવસે, શયતાનની ગમે તેટલી કોશીશ થકી પણ, તે ગુનાહ લખાવી શકશે નહીં યાને કે અલ્લાહની તવફીકથી તે માણસ કોઈ ગુનાહ કરવા પામશે નહીં.

સિત્તેર પ્રકારની બલાઓથી બચવાનું તાવીજ

હો રસુલે અકરમ, મોહમ્મદ મુસ્તાફા સ૦ થી રિવાયત છે કે: જે માણસ દરરોજ દસ વખતા:

બિસ્મિલ્લાહિર રહ્માનિર રહીમ

લા હૃદ વલા કુપ્તા ઈલ્લા બિલ્લાહિલ અલીયયીલ અજીમ

પડશે તો તે ગુનાહોથી એવી રીતે બહાર આવશે, જેવી રીતે પોતાની માતાની પેટમાંથી જન્મ્યો હોય. ખુદાવંદે આલમ તેનાથી સિત્તેર કિસમની બલાઓને દુર કરી દેશે, જેમાંની દીવાનગી, કોઢ,, રક્તપિતા, લડકો, વિઠ અને સિત્તેર હજાર ફરિશતા તેના માટે મુકર્રર કરશે જેઓ ઈસ્તેગફાર કરતાં રહેશે.

અને હો ઈં જાબફરે સાંદ્રક અંથી મનકુલ છે કે જે શાખા દરરોજ એકસો વખતઃ

લા હૃદ વલા કુપ્તા ઈલ્લા બિલ્લાહે

પડશે, તેને કદી તંગદસ્તી, મોહતાજ લાગુ નહીં પડે.

અને જે શાખા દરરોજ એકસો વખત :

સુષ્ણાનલાહે વલ હમદો લિલાહે વ લાયેલાહે ઈલલાહો વલાહો અકબર

પડશે, તેના જિસમપર ખુદાવંદે આલમ જહન્નમની આગ હરામ કરી દેશે.

દુઅા કે અંતરનો અવાજ

દુઅા એટલે શું ?

અમ્મંચ્યોળબુલ મુખ્યતરરા એઝા દાખાહો વ યક્ષેફુસ્સુઅ : ભલા તે કોણ છે કે જ્યારે ગભરાએલો તેને પોકારે છે ત્યારે તે તેની દુઅા કબૂલ કરે છે અને તેની મુસીબતને દૂર હઠાવી આપે છે ? (સુરએ અન્નામલ, આયત: ૬૨).

દુઅા એક માનભરી માંગણી છે, અરજી પેશ કરવાની એક પ્રાર્થના છે, અલ્લાહ પાસે બંદાની નમૃતા અને તાબેદારીપૂર્વક એક વિનંતી છે કે જેથી માઅબુદ્ધ તેમની જરૂરીયાતોને પૂરી કરી આપે, તેમનાપર પોતાની રહેમત વરસાવે, તેમના ગુનાહોને માફ કરી દીએ, તકલીફોને હઠાવી આપે, મુસીબતોને દૂર કરે, મુંજવણોને આસાન કરી આપે, બુરી આદતોને સુધારવાની તૌફીક બક્ષે, પોતાની નજીદીકી હાંસીલ કરાવે, સીધો માર્ગ બતાવી હીદાયત કરે, દિલને શાંતિ અર્પણ કરે...વગેરે.....

હો અલી અહો ફરમાવે છે કે: અદુઅાઓ સીલાહુલ મોઅમીનનું હથિયાર છે, યાને દુઅા એક એવું હથિયાર છે કે જેનો તમામ અંબીયાઓએ, ઈમામોએ, અલ્લાહના અવલિયાઓ અને તેના ખાસ મુત્તકી-પરહેજગાર બંદાઓએ ઉઘોગ કર્યો છે. ભારે મુશકીલોને ઉઠાવ્યા અને સખ્ત મુસીબતોને તોડવા, દુઅા એક શક્તિની ગરજ સારી હતી.

જેથી કરીને ઈસ્લામ, મોઅમીનને, તકલીફના સમયે, ગભરાઈ ન જતાં, પોતાના પરવરદિગારથી, દુઅા માઅરફત, સંપર્ક સાંધવા ભલામણ કરે છે અને દુઅાની મહાનતા તેમજ ઈન્સાન અને તેના રબ વચ્ચેના આ વહેવારીક ઈબાદતને સમજાવે છે.

દુઅા ઈમાનને મજબુત બનાવે છે કારણકે ઈન્સાનનું ઈમાન વ્યથ છે અગર તેને પૂરેપૂરું યકીન નથી કે ફક્ત અલ્લાહજ બુલંદ અને મહાન છે, જે દરેક વસ્તુ ઉપર તાકત રાખે છે અને જેની સામે આ ઈન્સાન બીલકુલ એક હકીર, લાયાર અને લાઈલાજ, ઈજાત વગરનો, કીમત વિનાનો, નબળો પ્રાણી છે, રેતીના એક રજકણ સમાન છે અને તેની મરજની સામે પોતાનું મસ્તક નમાવ્યા વગર રહેતો નથી. હદીસમાં છે કે: દુઅા ઈબાદત માટે એજ ગરજ સારે છે જે રીતે ઈન્સાનના શરીર માટે તેનું મગજ છે.

બસ, એમ સમજો કે જ્યાં પોતાને બળવાન સમજનાર આ માટીનું પૂતળું, આ પામર ઈન્સાન, પોતાની શક્તિ અને તાકત ગુમાવી દીએ, ત્યાં દુઅાનું સ્થાન છે. જ્યારે માણસ હયરાન અને બેભાન બની જાય, તેના બધા પ્રયાસો અને પ્રયત્નો નાકામ નીવડે, ધોડા દિવસે કોઈ રસ્તો સુજે નહીં, અથવા જ્યાં પહોંચવું તેની શક્તિ મર્યાદાથી બહાર હોય, ત્યારે દુઅા, તેના મનના અંધારા ભોયડામાંથી, તેને બહાર પ્રકાશમાં લાવે છે.

માઅસુમ અઠ નો કોલ છે કે: જો બંદો એમ ઈચ્છે કે અલ્લાહ તેની સાથે વાતો કરે તો તેણે કુરઆને શરીર સમજને પડવું અને જો એમ ચાહે કે પોતે પોતાના માલિક સાથે કલામ કરે તો તેણે હાથ ઉચ્ચા કરી અલ્લાહ પાસે આજીપૂર્વક હુઅા માંગવી.

હુઅા પડતી વખતે દિલમાં ઘ્યાલ રહેવો જોઈએ કે બંદો પોતાના ખાલિક (સર્જનહારથી) વાતો કરી રહ્યો છે અને તે બરાબર તેને સાંભળી રહ્યો છે. અલ્લાહ ઈન્સાનની હુઅાનો શબ્દોથી જવાબ આપતો નથી, પણ તેની માંગણીને કબૂલ કરીને તેનો જવાબ દીએ છે. કદાચ, બલે તેની હુઅા મંજૂર ન થાય, તે છતાં પણ, બંદાને ખુશ થવું જોઈએ બલકે ગવ' કરવો જોઈએ કે તેણે બધી હુનીયાઓનો પયદા કરનાર, અલ્લાહને કલામ દર્શાવ્યા છે કે જે સઉથી વધુ સાંભળનાર છે. જેવી રીતે દેશના મહાન હોદેદાર, રાજના પ્રધાન અથવા વર્જિર સાથે અગર કોઈને બે શબ્દો ઉચ્ચારવાનો મૌકો મળી જાય તો તે કેટલો ગવ' જાહેર કરશે!

હુઅા ઈન્સાનના એકલાપણામાં સાથી છે, ગભરાટને દુર કરે છે, ગમને ઘટાડે છે, મનને હળવું બનાવે છે, દિલને આશ્વાસન બક્ષે છે.

હુઅા ઈન્સાન માટે એક અગત્યની વસ્તુ છે. તે માણસને બીજા સાથે વાતુ કરવા પ્રેરે છે અને તે બીજી હસ્તી કોઈ નથી, પણ તે તેનો પયદા કરનાર, કાએનાતનો માલિક, ખુદા છે.

ઈન્સાન પોતાની ઝીદગી દરમીયાન હમેશાં સુખની તલાશમાં ભટકે છે અને દુખ-દર્દ થી બચવા ચાહે છે. આ કોશીશનો નતીજો હરવખત સફળ બનતો નથી, બલકે નિષ્ફળતા પણ સાંપળે છે. હુનીયા ભલે સુખ-દુખથી બનેલી હોય, પણ કોઈ માણસ દુખને શોધશે નહીં, બલકે સુખ અને આરામની તલાશમાં ગોથા ખાશે. તે વખતે પોતે સમજશે કે કોઈ તેની ઉમેદ અને આશાને પુરી કરી શકતો નથી, સિવાય અલ્લાહ કે જે દરેક વસ્તુ ઉપર સંપૂર્ણ તાકત અને કુદરત રાખે છે, જ્યારે કે હુનીયાની તમામ મખ્લુક તેની મોહતાજ છે.

હુઅા ફક્ત આ હુનીયાની હાજતો પરિપૂર્ણ થવા માટેજ બસ નથી, બલકે અને ખાસ કરી મૌત પછીની ઝીદગી માટે બહુજ આવશ્યક છે. આ હુનીયાની હયાતી તો થોડા વરસો રહેવાની છે, જ્યારે કે આખેરત તો હમેશાં બાકી રહેનાર છે.

જેમ જેમ ઈમાન વધતું જરો, અલ્લાહની ઓળખાજા-માઅરેફત પ્રગતિ કરશે, તેમ તેમ બંદાને હુઅાની અંદર રસ લાગશે.

હુઅાની શી જરૂરત છે ?

પયગમ્બરો, રસુલો અને ઈમામો જેવી શાખ્સીયત કે જેઓ ઈન્સાનિયતના પર્વતની ટોચ ઉપર હતા, જેમને અલ્લાહની નજીદીકી પ્રાપ્ત થઈ હતી અને તેના તરફથી આવતી વહીના તેઓ માલિક હતા, છતાં પણ, તેઓ હુઅાનો સહારો લીધો હતો.

હો પયગમ્બર સો ની હદ્દીસ છે કે: કુરઆન ની તિલાવત પછી, હુઅા અલ્લાહની ઉત્તમ ઈબાદત છે.

હુઅા એક રસમ નથી, સંજોગાનુસાર એક રીત બજાવ્યાની ક્રીયા નથી, એક આદતરૂપી અમલ નથી કે જે સમજ્યા-વિચાર્યા વિના અંજમ આપવામાં આવે, બલકે તે દિલના ઉડાણમાંથી ઉત્પન

થતો એક અવાજ છે, માઅબુદ્ધ અને બંદા વચ્ચેનો રોજનો એક અટુટ સંબંધ છે કે જેના થકી ઈન્સાન પોતાના પાલણહારને તેમની બધી ખાનગી વાતોથી વાકેફ કરી પોતાની લાચારી બતાવે છે. ઉપરાંત, પોતાની મોહબ્બતનો ઈકરાર કરી તેનાથી સંપૂર્ણ આશા રાખે છે.

હુઆમાં ફક્ત આખેરતની ભલાઈ સમાએલી નથી, બલકે તેમાં આ હુનીયાના ફાયદાઓ પણ મળેલાં છે. હુઆ એક એવી ઈબાદત છે કે જેના સહારે ઈન્સાન પોતાને તેમના પયદા કરનારની સામે બીલકુલ તુચ્છ બતાવે છે, તેના ઘમંડ - હુંપદને નાબુદ કરે છે અને પોતાની જતને અલ્લાહના અજાબથી બચાવી લીએ છે. હુઆ, ઈમાન અને કુંફ, જન્મત અને જહન્નમ, આગ અને બાગ વચ્ચેની એક સરહદ છે.

૧ કાલા રખ્ખોકોમુદ-ઉની અસ્તજીબ્લકુમ; ઈન્નલ્લાજીના યસ્તકબેરુના અન એબાદતી સયદ્ખોલુના જહન્નમા દાખેરીનઃ અને તમારો પરવરદિગારે કહું છે કે તમે મને પોકારો (મારાથી હુઆ માંગો) તો હું (તમારી હુઆ) કબૂલ કરીશ; ખરેખર જે લોકો મારી ઈબાદતથી અહંકાર-તકબુર કરે છે તેઓ નજીકમાં બેઇજીત થઈને જહન્નમમાં દાખલ થશે. (સુરએ મોઅમ્રિન, આયત: ૬૦).

આપણા છઠા ઈમામ, ૬૦ જાઝીર સાદીક અઠ ને પુછવામાં આવ્યું કે: આપ તે બે વ્યક્તિઓ વિશે શું ફરમાવો છો કે જે બન્ને મસજીદમાં દાખલ થયા, એક હુઆમાં મશગુલ રહે છે અને બીજો સુન્નત નમાજો અદા કરે છે? માસુમે જવાબ આય્યો કે: બન્ને નેક છે. સવાલ કરનારે અરજ કરી કે મૌલા! તે બેમાંથી અફ્જલ કોણ છે? ઈમામે ઉત્તર આય્યો કે: જે હુઆ ચાહે છે. અને તે પછી આપે આ આયતની તિલાવત કરી.

મૌલા અમીરુલ મોઅમેનીન, ૬૦ અલી અઠ ની એક રીવાયતથી સાબીત થાય છે કે અગર અલ્લાહની મસલેહતથી હુઆ કરનારની છાજત પુરી ન થાય તો તે હુઆ તેના ગુનાહોનો કફ્ફારો બની જશે.

નબીએ કરીમ સ૦મે ફરમાવ્યું છે કે: જ્યારે મોઅમીન કોઈ એવી વસ્તુ માટે હુઆ કરે છે જે શરીરાત વિરુદ્ધ ન હોય અને તેમાં કોઈ પ્રત્યે નિર્દ્યતા-બેરહેમી દેખાડવાની માંગણી ન હોય તો તેના પરિણામમાં, તેને આ જણ વાતોમાંથી કોઈ એક વાત જરૂર મળે છે:

- તેની તે માંગણીનો સ્વીકાર કરી લેવામાં આવે જે તેણે આ હુઆમાં કરી છે;
- તે હુઆને આખેરત માટે હીન્દીતમાં રાખી દેવામાં આવે;
- તે હુઆના બદલામાં તેની કોઈ બુરાઈને હુર કરી આપવામાં આવે.

આની અગાઉ, એજ સુરાની ૧૪ નંબરની આયતમાં અલ્લાહનો ઈરશાદ થઈ રહ્યો છે:

ફદ-ઉલ્લાહ મુખલેસીના લહુદદીન વલવ કરેહલ કાફેરુન: બસ, તમે અલ્લાહના માટેજ ધમ' રાખી, ખાલીસ (ચોખા અને સાફ) મનથી, તેનેજ પોકારો, ભલે કાફીરો તેને બુરું માનો.

આ પહેલાંના ઉપરોક્ત ફરમાનથી ચાર આયતો છોડી, આગળ જતાં મજકુર સુરાની ૬૫ નંબરની આયતમાં આપણને અલ્લાહનો ઈરશાદ મળશે:

હોવલ હથ્યો લાઅલાહ ઈલ્લાહ હોવ, ફદ-ઉહો મુખલેસીના લહુદદીન; અલહમ્દો લીલ્લાહે રખ્ખીલ આલમીન: તે (હમેશાં) જીવતો છે અને તેના સિવાય કોઈ માઅબુદ્ધ નથી; બસ, ખાલીસ

(સ્વર્ચ - પવિત્ર) મનથી તેનીજ ઈબાદત કરીને તેનેજ પોકારો (તેનાથીજ દુઆ માંગો); તમામ વખાણ ફક્ત અલ્લાહનેજ લાયક છે કે જે બધી દુનીયાઓનો પાલણહાર છે.

મુસીબતમાં જે ઈન્સાન પોતાના રબને પાડારતો નથી, તે અલ્લાહને બીલકુલ નાપસંદ છે, બલકે તે પોતાના બંદાને ઉત્તેજે છે કે તેની પાસે દુઆ માંગે કારણકે તેની મદદ કરવા તેણે વાયદો આય્યો છે.

હદીસે કુદસીમાં રખ્ખુલ ઈજાતનો ઈરશાદ છે કે: મેં ખલ્કને એટલા માટે પૈદા કરી છે કે તે મારાથી ફાયદો ઊઠાવે, એટલા માટે પૈદા નથી કરી કે હું તેઓથી કંઈ ફાયદો મેળવું.

દુઆ માંગવી બંદગીની શાન છે. દુઆ બંદાઓને અલ્લાહની નજીક લાવે છે અને તેના રાજ્યપાનું કારણ બને છે. અલ્લાહ પાસે દરેકનું એક સ્થાન છે, જે દુઆ વગર હાંસીલ થઈ શકતું નથી. જેવી રીતે કે હદીસથી સાબીત છે કે: દુઆ માંગવાથી કદી કંટાળતો નહીં કારણકે અલ્લાહ પાસે તેનો ઊંચો દરજાઓ છે.

હદીસમાં એમ પણ મળે છે કે: બે માણસો, બરાબર ઉમરના, એક સરખી નેકી અને ઈબાદતો ધરાવનાર, સાથે જન્મતમાં દાખલ થશે. પરંતુ, જે વખતે એક જોશે કે તેનો મોઅમીન ભાઈ તેનાથી આગળ જઈ રહ્યો છે ત્યારે તે અલ્લાહને પુછશે કે: જ્યારે અમો બન્નેના અયમાલ સરખાં છે તો પછી પેલાંનો મરતબો મારાથી કેમ વધી ગયો? તે સમયે, તેને જવાબ મળશે કે: તેણે મારી પાસે માંગ્યું, મેં તેને આય્યું; તેંબુદ્દી દુઆથી હાથો રોકી લીધા, કંઈ માંગ્યું નહીં!

હદીસે કુદસીમાં અલ્લાહ ફરમાવેછે કે: હે મુસા! તારા ઘેટાઓ માટે તને ઘાસની જરૂર હોય, તો મારી પાસે માંગ; ખાવા માટે નિમકની જરૂર હોય તો મારી પાસે સવાલ કર.

આથી નક્કી થયું કે આપણી નાનામાં નાની જરૂરત પણ અલ્લાહ પાસે માંગવી જોઈએ, જે થકી, તેની સમક્ષ, આપણી લાચારી અને મોહતાજ જાહેર થાય અને અલ્લાહની ભવ્યતા!

શું આ દુનિયામાં બધી હાજતો પૂરી થવી શક્ય છે ?

આ જગત દુખનું ઘર છે. બધાં સુખ ફક્ત આખેરતમાં મળવાનાં છે. આ દુનિયામાં કોઈ એવો માનવી નથી કે જેને નાની યા મોટી, થોડી યા વધુ તકલીફોનો સામનો કરવો ન પડતો હોય. ઈન્સાન જન્મે છે તો કષ્ટ સાથે! આ જમીન તો ફક્ત એક મુસાફરખાનું છે. આ દુનિયાનું જીવન આખેરતની સદા રહેવાવાળી જીંદગી સુધી પહોંચવાનું એક પૂલ છે. મુસીબતો તે ઈમ્તેહાન કહેતાં પરિક્ષા છે અને દરેકનું ઈમાન તેમના ઈમ્તેહાનથી માપવામાં આવે છે. સાચો મોઅમીન-મુત્તકી-પરહેઝગાર કદી દુઆ થકી સંપૂર્ણ સુખની તલાશ આ દુનિયામાં કરતો નથી, પણ કેવી રીતે અલ્લાહના હુકમોનું ખરું પાલન કરી શકે તે માટે મન અને શરીરની શક્તિ તેમજ સમજદારીની યાચના પોતાના માઅબુદ્ધ પાસે કરે છે.

આ જગ્યાએ બે સવાલો જન્મે છે: -

પહેલું કે: જ્યારે આ ભૂમી ઈમ્તેહાનનું સ્થળ છે તો પછી શા માટે મોઅમીન પોતાની દરેક ઈચ્છા અહીં પૂરી થવા અલ્લાહ પાસે માંગણી કરે છે?

બીજું કે: જ્યારે તમામે તમામ ઉમેદોનું આ સંસારમાં પૂરું થવું મુશકેલ છે કારણકે તે દ્વિતીય-સૃષ્ટિથી વિરુધ હોય, તો ઈસલામ શા માટે મોઅમીનને અલ્લાહ પાસે દુઆ માંગવા પ્રોત્સાહન આપે છે?

જવાબમાં કહેવાનું કે: જેવી રીતે આ પૂસ્તકમાં વારંવાર ઉલ્લેખવામાં આવ્યું છે તે મુજબ, દુઆ એક એવું સાધન છે કે જે મોઅમીનને આ દુનિયાના પકડમાંથી બહાર કાઢી પોતાના ખાલિક સાથે વાતું કરવા પ્રેરે છે. ભલે ટુંક સમય માટે, પણ આ મિલાપ જરૂર અને ફાયદામંદ છે, તેને કદી નકામો સમજવો નહીં, તે ક્યારે પણ ટુટવો ન જોઈએ બલકે તે હમેશાં જારી રહેવો જોઈએ. આના માટે તો અલ્લાહના ઘ્યારા અને માઅસુમ બંદાઓ તો તડપતા હતા!

ઉપરાંતમાં, આપણી જંદગી, રોજુ, સલામતી, હીન્ફલત અને સવે' જરૂરીયાતો અલ્લાહના હાથમાં છે. દુઆ એક એવી સામગ્રી છે કે જે આપણને ગફલતની ઘેરી નીદમાંથી જાણત કરી હમેશાં યાદ અપાવે છે કે આ સઘણું વિશ્વ અલ્લાહના આધારે ચાલી રહ્યું છે અને સવે' મખલુક તેની મોહતાજ છે. દુઆ થકી બંદો અલ્લાહની ભવ્ય કુદરત અને તાકતનું ભાન લાવે કે અલ્લાહ ચાહે તો ઈન્સાનની તકદીરને શું, બલકે આખા વિશ્વ મંડળની ચાલને બદલી શકે છે!

હાજત પૂરી થાય યા નહીં, પરંતુ યાદ રહે કે દુઆ ઈન્સાનની એક રૂહાની કસરત છે, જે તેના મનને શાંતિ, તેના દિલને રાહત, તેના ઈમાનને કુપ્યત, તેના દેહને સમતોલપણું બક્ષે છે, હીમ્મત હારી જવાથી બચાવે છે, આકુળવ્યાકુળ થવાથી રોકે છે.

બીજું કે: ઈન્સાન આ દુનિયામાં જે મુસીબતોનો શીકાર બને છે, એથી તેનો હેતુ એમ નથી કે તે તેનો ખોરાક બની જઈ, હાથ જોડીને બેઠો રહે, બલકે તેમાંથી છુટવાની બનતી કોશીશો કરે અને સંભ્રાની સાથ તે પોતાના માઅબુદ્ધને પણ પોકારે, એટલે એક તરફ તેને સંભ્રાની ધરવાનો સવાબ મળે અને બીજી તરફ આ દુનિયાથી અલગ થઈ પોતાના પરવરદિગાર પાસે હાથો ઉંચા કરી દુઆ માંગવાનો પણ સવાબ ખોઈ બેસે નહીં.

જેટલી પરિક્ષા મુશકેલ હશે એટલું સંભ્રાની કઠીન હશે, એટલોજ સવાબ વધારે હશે. બંદાને ઘટે છે કે તે પોતાના માલિકને મુસીબતોના સમયે પોકારે કે અલ્લાહ તેને આ ઈમ્તેહાન પસાર કરવાની તેમજ સંભ્રાની વધુ તાકત ઈનાયત કરે અગાર તે કણ્ઠિઓ તેમના ફાયદામાં હોય, નહીં તો પછી તેમાંથી તેને જલદી છુટકારો અર્પણ કરે.

ખલીલે ખુદા, ૯૦ ઈંબ્રાહીમ અઠને આગમાં બાળી નાખવા નમરૂદે ઝુકમ આપ્યો. ચાર મોટી દિવાલો તૈયાર કરવામાં આવી. લાકડાઓનો મોટો ઢગ ખડકાયો. તેને સળગાવવામાં આવ્યા. ગગનચુંબીત જવાડાઓ ઉઠવા લાગ્યા. તેના ભડક એટલા ઉંચા જતા હતા કે કોઈ જાનવર ત્યાંથી પસાર થતું તો બળી જતું હતું. ગોફણાની અંદર ૪૦ ઈંબ્રાહીમ નબી અઠને રાખી આગમાં ફેંકવાની તૈયારીઓ થઈ. આસમાન અને જમીનમાં શોર મચ્યો કે: બારે ઈલાહા! દુનિયામાં એકજ તારો માનવાવાળો છે અને તેનાપર તેં નમરૂદને તાકત દીધી છે! અમને રજા આપ કે જેથી અમે તેમની મદદે પહોંચીએ. ખુદાએ જલ્દ જલાલોહુ તરફથી જવાબ મળ્યો કે: જાઓ અગાર ઈંબ્રાહીમ કબુલ કરે.

બધાંની પહેલાં તે ફરિશતો હાજર થયો કે જે હવા ઉપર હુકમ રાખતો હતો. આવીને સલામ કરી અને કહ્યું કે: અય અલ્લાહના નબી! અગર તમે કહો તો આ આગને એવી રીતે ફેલાવી આપું કે કોઈ ઘર તેના રહેવાસીઓ સાથે સલામત ન રહે. ૪૦ ઈષ્ટાહીમ અ૦મે સલામનો જવાબ આપી કહી દીધું કે: હું અલ્લાહ સિવાય કોઈની મદદ ચાહતો નથી.

પછી તે ફરિશતો આવ્યો જે વાદળ ઉપર મુક્રર હતો. સલામ કરી ફરમાવ્યું કે: અય પયગમ્બરે ખુદા! અગર તમારી રજા હોય તો હું એવો વરસાદ વરસાવું કે પલવારમાં આ આગ બીલકુલ હંડી થઈ જાય. હ૦ ખલીલુલ્લાહે સલામની સાથે એક૯ જવાબ આપ્યો કે: હું અલ્લાહ સિવાય કોઈથી મદદ ચાહતો નથી.

આખીર વખતે જીષ્ટાહલે અમીન ફરિશતા પધાર્યા, સલામ કરીને પુછ્યું કે: અય ઈષ્ટાહીમ નબી! કોઈ હાજત હોય તો બયાન કરો. સલામની સાથે જવાબ મળ્યો કે: અય જીષ્ટાહલ! તમારાથી કોઈ હાજત નથી. મલાએકાના સરદારે પાછું કહ્યું કે: અય પયગમ્બરે ખુદા! જેનાથી હાજત છે તેની પાસે કેમ બયાન કરતા નથી? જવાબમાં ફરમાવ્યું કે: તે મારા હાલથી ખુબજ વાકિફ છે, સવાલ કરવાની શું જરૂરત છે? જ્યારે દોસ્ત દોસ્તનું સળગી જવું પસંદ કરે ત્યારે ઝીદગી બેકાર છે!

રજ્બુલ ઈજ્જત તરફથી અવાજ આવ્યો કે: યા નારો કુની બરદંવ વ સલામન અલા ઈષ્ટાહીમ!

અય આગ! ઈષ્ટાહીમ ઉપર સલામતીની સાથે હંડી થઈ જા!(સુરાએ અંબીયાઅ, આયત:૬૮)

જ્યારે ઈષ્ટાહીમ દોસ્તની ખુશી ચાહે છે તો તેને સળગાવવા મુનાસીબ નથી. ૪૦ ઈષ્ટાહીમ અ૦ આગમાં પહોંચ્યા, એક બાલ પણ સળગ્યો નહીં. કહે છે કે તે વખતે આપની વય સોળ વરસની હતી.(મર્હૂમ અલ્લામા હાજ નાજ અ૦મ૦ની કિતાબ અહવાલે કરબલામાંથી થોડા ફેરફાર સાથે). રિવાયત છે કે: હ૦ મુસા પયગમ્બર અ૦ને વહી થઈ કે: જ્યારે હું મારા બંદાને દોસ્ત રાખું છું ત્યારે પહાડ પણ ન ઉપાડી શકે એવી બલાઓમાં એને ગીરફ્તાર કરું છું અને આ રીતે મારા પ્રત્યેની તેની મોહબ્બત સાચી છે કે નહીં તેની કસોટી કરું છું. જો એ મને સાચા દિલથી મોહબ્બત કરતો હશે તો સભ્ર કરનાર હશે અને એને એવો જોઉ છું ત્યારે તેને મારો વલી અને હબીબ ઠેરાવું છું. પણ તેઓમાંના જેમને બેસભ્રો અને શિકાયત કરનારા જોઉ છું તેમને ઉતારી પાડું છું અને મારી પાસે એની જરા પણ ઈજ્જત નથી.(મેઅરાજુસસાદાહ, હાજ નાજ અ.મ)

હ૦ હ૦ જાઅફ્રે સાટિક અ૦થી રિવાયત છે કે: પરવરદિગારે આલમે જનાબે દાઉદ નબી અ૦ને વહી ફરમાવી કે: હે દાઉદ! મારા બંદાઓમાં જે બંદો અન્ય લોકોનો દામન છોડી દઈ મારા ઉપર ભરોસો કરે અને જો તે પોતાની નિયતમાં સાચો હશે તો તમામ આસમાનવાળા અને જમીનવાળા તેની સામે મક્કર અને ફરેબની જાળ બીછાવશે તો પણ હું તેને એમનાં મક્કર અને ફરેબથી સલામત બચાવી લઈશ.(મેઅરાજુસસાદાહ, અલ્લામા હાજ નાજ મર્હૂમ).

એક રાતના અંધારામાં, મૌલા અમીરુલ મોઅમેનીન, હ૦ અલી અ૦, ઘરથી બહાર નીકળ્યા. જનાબે કમ્બર, આપના સહાબી, છુપાઈને ઈમામની પાછળ પાછળ ચાલવા લાગ્યા. મૌલાએ પુછ્યું કે: કમ્બર, કેમ આવ્યા છો? સહાબીએ જવાબ આપ્યો કે: હું તમારી હીફાજત માટે આવ્યો છું, આપના દુશમનો મોટી સંખ્યામાં છે. ઈમામે પાછો સવાલ કર્યો કે: કમ્બર, તમે મને જમીનવાળાઓથી બચાવશો કે આસમાનવાળાથી? ૪૦ કમ્બર ગભરાઈ ગયા. ઉત્તર આપ્યો કે: મૌલા! હું તમને જમીનવાળાઓથી તો બચાવી શકું છું પણ આસમાનવાળા ખુદાથી હું તમને કેમ બચાવી શકું? હજરતે ફરમાવ્યું કે: કમ્બર, ચાલ્યા જાઓ! મને હીફાજતની જરૂર નથી.

ઝમીનવાળાઓ કદી નુકસાન પહોંચાડી શકતા નથી જ્યાં સુધી કે આસમાનવાળાની રજા ન હોય! (મૌલાના જાનઅલી શાહ કાર્યમી સાહેબની મજલિસમાંથી).

જેવી રીતે ઘરવાળાઓ પોતાના ખાસ મહેમાનોની જુદા જુદા પ્રકારની વાનગી ખવડાવીને મહેમાનગતી કરે છે, તેવી રીતે ખુદાવંદે તથાલા પોતાના મોઅમીન બંદાઓની જુદી જુદી બલાઓ મારફતે અજમાઈશ કરે છે. (હો ઈ જાનઅફર સાદિક અ૦)

મોઅમીનનું ઉદાહરણ માજવાના બે પ્રત્યાંસો સમાન છે. જેમ જેમ ઈમાનમાં વધારો થતો જાય છે તેમ તેમ તેની અજમાઈશમાં પણ વધારો થતો જાય છે જેથી ખુદાવંદે તથાલાની બારગાહમાં એ હાલતમાં પહોંચે કે તેની ઉપર કોઈ ગુનાહ બાકી ન હોય. (હો ઈ મુસા કાજીમ અ૦)

કોઈ માણસે હો ઈ મોહમ્મદે બાકિર અ૦ ને કહ્યું: ખુદાની કસમ! હું આપના એહેલેબયત અ૦ ને દોસ્ત રાખ્યું છું.

ઈમામે ફરમાવ્યું: તો પછી તમારા માટે અજમાઈશની ચાદર પણ તૈયાર કરી લો. કેમકે ખુદાની કસમ આ અજમાઈશ અમારી તરફ અને અમારા શીયાઓની તરફ વાદી...તરફથી આવનારા પૂરથી પણ વધારે તેજ ગતીએ આવે છે. તેની શરૂઆત અમારાથી અને પછી તમારાથી થાય છે. એવીજ રીતે સરળતાની શરૂઆત પણ પહેલા અમારાથી અને પછી તમારાથી થાય છે.

(હો ઈ મોહમ્મદે બાકિર અ૦)

આ અહાદીસ આયતુલ્લાહ મોહમ્મદ રય શેહરી ની કિતાબ મિજાનુલ હીકમત, ભાગ ૧લા માંથી લેવામાં આવી છે: નંબર: ૧૮૨૬, ૧૮૫૫ અને ૧૮૫૪.-

દુઃખ પડવી કે માંગવી ? કેમ પડવી અને કેમ માંગવી ?

એક વેળા, ઉમ્મુલ મોઅમેનીન, ૪૦ ઉભે સલમા, રાતના જાગી ગયા. અધી' રાત વિતી ચુકી હતી. જોયું તો હો રસૂલે ખુદા સ૦ પોતાના બીધાનાપર નથી. ઘરના એક ખુણામાં ઈબાદતની અંદર મશગુલ છે. અલ્લાહની બારગાહમાં દુઃખ માંગી રહ્યા છે. ૪૦ ઉભે સલેમાના કાનોથી આ શબ્દો અથરાણા: હે અલ્લાહ! તું મને એવો ન બનાવજે કે હું મારા ઉપરજ બધો આધાર રાખ્યું, પણ મને એવો રાખજે કે બધી બાબાતોમાં હું તારોજ મોહતાજ રહ્યું.

જ્યારે ઉમ્મુલ મોઅમેનીને પુછ્યું કે: યા રસૂલલ્લાહ! આપ શા માટે અલ્લાહની જતપર નિર્ભર રહેવા માંગો છો? તો આપે જવાબ આખ્યો કે: મને એજ શોભે છે. મારા ભાઈ યુનુસે માત્ર એક પળ માટે પોતાની જત પર ભરોસો રાખ્યો તો કેટલી મુસીબતોમાં ફસાઈ ગયા!

જ્યારે દુનિયા મીઠી નીંદ ની અંદર આરામ કરી રહી હોય ત્યારે અંબીયાઓ અને રસૂલોના સરદાર પોતાની નીંદને છોડી, કેવી આજ્જી, કેવી લાચારીથી દુઃખ ગુજરે છે કે જેની કશી હું નથી. હવે મુન્તખબ મજલિસ નામના પુસ્તકમાંથી મૌલાના સય્યદ મોહમ્મદ સાદિક હસન સાહેબ લખનવીની મજલિસમાંથી એક રિવાયતના આધારે વસીઓના સરદારને જોઈએ કે તેઓ માલિકની જનાબમાં કેવા દિલ હચમચાવી નાખે એવા શબ્દોમાં યાચના કરે છે:-

અબુ દરદા અનસારી નકલ કરે છે કે: એક વખત, પાછલી રાતના, હું મરણુદે નબવીની બાજુમાંથી પસાર થયો તો રાતના અંધારામાં મેં શું જોયું કે અંદરમાં એક નાનો દીવો સણગી રહ્યો છે અને મારા મૌલા અલી ઈન્ને અભીતાલીબ મુનાજાતમાં મશગુલ છે. ઈમામ બેઠા છે, બન્ને હાથો

આસમાન તરફ બુલંદ કરી અલ્લાહની બારગાહમાં રોઈ રોઈને અરજ કરી રહ્યા છે: ઈલાહી! કેટલી એવી મુસીબતો છે કે જે મારા તરફ આવી રહી હતી, પરંતુ તેં તારી રહેમતથી તેને મારાથી દુર કરી દીધી! અય અલ્લાહ! કેટલા ગુનાહ એવા છે કે જેની અંદર હું મશગુલ થઈ જાત, પરંતુ તારા કરમના કારણે હું તેનાથી બચી ગયો! ઈલાહી! હું કબૂલ કરું છું કે મેં મારી ઉત્ત્રને તારી નાફરમાનીમાં ગુજારી અને હું કબૂલ કરું છું કે મારું અમલનામું ગુનાહોથી ભરપુર છે, પરંતુ બારે ઈલાહા! હું મારા ગુનાહોની બક્ષિશ ચાહું છું અને તારી રજામંદી અને તારી ખુશી સિવાય હું તારાથી કાંઈ ચાહતો નથી.

અબુ દરદા કહે છે કે તે બાદ મારા મૌલા ઉભા થયા અને બે રકાત નમાજ પડી, નમાજ ખત્મ થઈ અને આપની આંખ્યો આંસુઓથી ભરાઈ ગઈ. હાથોને ઉચ્ચા કરી ફરમાવવા લાગ્યા: અય અલ્લાહ! જ્યારે હું તારી બક્ષિશ અને રહેમતને જોઉં છું તો મારા ગુનાહો મને બીલકુલ હકીર અને નાચીજ નજર પડે છે; પણ યા અલ્લાહ! જ્યારે હું તારા અજાબને, તારી પકડને, તારા હિસાબો-કિતાબને જોઉં છું તો મારા ગુનાહો મને બેહદ મોટા દેખાઈ છે!

અબુ દરદાનું કહેવું છે કે તે બાદ મેં જોયું કે મારા મૌલાએ પોતાની દાઢી મુખારકને પોતાના હાથોથી પકડી અને આસમાન તરફ જોઈને કહેવા લાગ્યા: યા અલ્લાહ! મેં આસમાની કિતાબોની અંદર વાંચ્યું છે કે તું દરેક ગુનેહગારને પકડીશ. અફ્સોસ છે તે માણસની હાલત ઉપર કે જેને તું પકડે કારણકે જે તારી ગીરફ્ફતારીમાં આવી જાય, તેને ન તો તેનું ખાનદાન બચાવી શકે છે, ન તો તેનો કબીલો! ચોતરફ તેના માટે મુસીબતોજ હશે!

અબુ દરદાનું બયાન છે કે તે બાદ મેં જોયું કે મારા મૌલાએ, એમ કહીને, પોતાના ગાલોને પોતાના હાથોથી પીટવા લાગ્યા કે: ખુદાવંદા! આહ! આહ! તે આગથી કે જે કલેજા અને ગુરદાને બાળી નાંખશે! ખુદાવંદા! તું મને તારી પનાહમાં રાખ તે આગથી કે જે ચહેરાને સળગાવી દેશે! અને તે પછી મારા મૌલા ઝીનિનપર પડી ગયા! મેં જ્યારે ઈમામને પડતા જોયા ત્યારે હું તરત તેમની બાજુમાં આવ્યો અને તપાસતાં માઅલુમ પડ્યું કે મૌલાના હાથ-પગ બીલકુલ અકડાઈ ગયા છે.

હું તરત ૪૦ ફાટેમા સલાઠ ના ઘર તરફ દાડ્યો કે જેથી માઅસુમાને તેમના શવહરની વફાતના સમાચાર આપું. જ્યારે હું ઘર નજીદીક પહોંચ્યો તો અંદરથી મને ૪૦ફાટેમા સલાઠની મુનાજાત અને રડવાનો અવાજ આવ્યો. બહાર એકદમ ઠંડી પડી રહી હતી. મેં દરવાજો ખટખટાવ્યો અને ૪૦ માઅસુમાએ પુછ્યું કે કોણ છે? મેં મારી ઓળખાણ આપી. આપે આવવાનું કારણ પુછ્યું તો મેં બતાવ્યું કે: અય બીજાને રસૂલ! આપના શવહર મસજીદે નબવીમાં ઈન્જેકલ કરી ગયા છે. હું તેમને એ હાલતમાં છોડીને આવું છું કે તેમના હાથ-પગ બીલકુલ અકડાઈ ચુક્યા છે. અંદરથી અવાજ આવ્યો કે: અય અબુ દરદા અનસારી! ગભરાવાની કોઈ વાત નથી. ખોડે ઈલાહીમાં અબુલ હસનની દરરોજ આ હાલત બને છે. તમારા મૌલા દુનિયાથી સીધાવી ગયા નથી. તેઓ ઈબાદતમાં મશગુલ છે.

અબુ દરદા ફરમાવે છે કે: હું પાછો મસજીદમાં પહોંચ્યો. મૌલાને મેં તેજ હાલતમાં જોયા. હવે નમાજે સુષ્ણનો ટાઈમ બાજુમાં હતો. મેં ઈમામના ચહેરાપર પાણી છાંટ્યું અને તેમને હોશમાં લાવ્યા. જાગવાની સાથેજ આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. તેમને રોતા જોઈ હું પણ રોવા માંડ્યો. હવે મૌલાના કલામ સાંભળો. આપે ફરમાવ્યું કે: અય અબુ દરદા અનસારી! તમે મને

જોઈને રડો છો અને અજબ થાઓ છો. તમને ખબર નથી કે: એક દિવસ મને મારા ખુદાની સામે જાવું પડશે. હિસાબો-કિતાબ માટે તે દિવસ બહુજ સખ્ત હશે. ચોતરફથી જહન્નમની આગ મને ઘેરી રાખી હશે અને મહાન ખુદાએ જબ્બાર અને કહહારની સામે મને એક એક પાઈનો હિસાબ દેવાનો રહેશે.

દુઅા બે પ્રકારની છે: એક દુઅા જે આયતના સ્વરૂપમાં કુરાનનની અંદર આપણને મળશે અથવા આપણા માઅસુમીનો અઠમુઠી વારિદ થયેલી જે આમ કિતાબોમાં હાંસીલ થશે અને બીજી દુઅા જે આપણી ખાસ દિલી હાજત છે કે જેના શબ્દો આપણી પોતાની જબાનમાં બયાન થઈ રહ્યા હોય. પડવાની સાથે દુઅા માંગવાની પણ હોય છે.

ટુંકી હોય અથવા લાંબી, ઈમામો અઠમુઠે આપણને જે દુઅા શીખવી છે અને જે આપણે પડીએ છીએ તેમાં અલ્લાહ સમક્ષ કેવા વિવેક અને અદબથી હાજર થવું, માઅરેફતના કેવા કલામો ઉચારવા, કેવી રીતે કરગરવું, કેવી દલીલો પેશકરવી, ગુનાહોની કેમ માઝી માંગવી, શરૂઆત અને ખત્મ કેમ કરવું, આ બધું એવી ફબ અને રચના, એવા કથન અને વાક્યોથી શાણગારેલું કે તે પડવામાં ન કંટાળો ઉપજે, ન થાક જણાય!

તેની સામે આપણી પોતાની જબાનથી બયાન કરવામાં આવતી આપણી પોતાની અંગત હાજત છે કે જેમાં આપણે એકજ વસ્તુપર વધારે ભાર આપશું કે: માઅબુદ! તું મારી આ દુઅાને જલદી કબૂલ કર! જેના શબ્દો ચુંટેલા ન હોય, દરરોજના ઘરમાં વપરાતી પોતાની ચાલુ બોલી હોય, પેલી કિતાબી દુઅા વધુ યા થોડા આવાજથી પડવામાં આવતી હોય, જ્યારે કે આપણી ખાનગી હાજત બીલકુલ આહીસ્તે જેમ કાનમાં ગુસપુસ, અથવા હોઠ હલાવ્યા વિના મનમાંજ કરવામાં આવતી હોય.

દુઅા કોઈ પોલિટિકલ અથવા રાજકીય પ્રવચન નથી, કોઈ પ્રોપેગેન્ડા અથવા પ્રચાર કરવાનું ભાષણ નથી, પણ પોતાના દુખતા દિલની પોકાર છે, પોતાના ચીતા ભરેલા મનની બાદ છે. જ્યારે ઈન્સાન ભારે મુશકેલીમાં ફસાઈ જતાં, પોતાની બધી તાકત વડે કોઈને મદદ માટે પોકારે ત્યારે તે ડિક્શેન્ટરીમાં શબ્દોની તલાશ નહીં કરે, પરંતુ તેની રોજની ચાલુ જબાનના કલામમાં આવાજ આપશે. તે શબ્દો અંતરના ઉડાણમાંથી નીકળેલાં હશે કે જે બીજાઓના રહેદયને પીગડાવી દીએ, ચાલતા કદમને રોકી આપે, માનવીના મનને ડગમગાવી આપે.

શું દુઅામાં રડવું જરૂરી છે ?

ઉપરોક્ત ઉદાહરણમાં તો મખલુક સાથેની વાત થઈ, પણ જ્યારે ઈન્સાન પોતાના ખાલિક અને માલિકને પોકારે અને તે એવા સમયે કે જ્યારે તેણે અલ્લાહની નાફરમાની કરી હોય, નાપાક જબાનથી ગુનાહોની ગંધ આવતી હોય, ઈબાદતો બજાવવામાં આળસ દેખાડી હોય, ખુદાથી હમેશાં મોહું ફેરફું હોય, તો અજબ નથી કે ત્યારે પોતે પોતાને, સાંકળમાં જકડાએલા એક અપરાધીની જેમ, શરમીદો સમજી રોવા લાગે!

મૌલા અલી અમીરુલ મોઅમેનીનના અઠ ના કલામ દુઅાએ કોમયલની અંદર બીલકુલ સ્પષ્ટ છે: (ખુદાયા!) તે બંદાપર રહેમ કર કે જેની પુંજ ફક્ત આશા અને ઉમેદ છે, અને જેનું હથીયાર ફક્ત રોવું છે.

પોતાની દુન્યવી દોલત છીનવાઈ જવાથી અથવા પોતાના આપ્તજન યા દોસ્તના મોતથી અગર માણસની આંખ્યોમાંથી આંસુઓ સરવા લાગે તો એમાં નવાઈ પામવાની કોઈ વાત નથી, ઈન્સાનની ફીન્સત છે. પણ દુઆમાં શા માટે રડવું? બસ, એટલા માટે રડવું કે અલ્લાહની નાફરમાની કરી અને ગુનાહો આચરી, અલ્લાહની અમાનત તરીકે આપેલી તેના શરીરની બીલકુલ સાફ અને સ્વચ્છ રૂહને નાપાક બનાવી, બંદો પોતાની આખેરતને બરબાદ કરે છે, અલ્લાહની કુરબત-નજીકી ખોઈ બેસે છે, જન્તતના માર્ગ થી હઠી જાય છે, આનાથી વધારે કઈ મુસીબત છે કે દુઆ કરતી વખતે તેનું દિલ તડપે નહીં અને આંખ્યોથી ચોધાર આંસુઓ વહે નહીં! દુનિયાનું જીવન તો ટુંક મુદ્દતનું છે જ્યારે કે આખેરત ની ઝીંગી તો અનંત છે! આમ રૂદ્ધન પણ ઈન્સાનની સૂષ્ટિ - ફીન્સત મુજબ છે.

જેવી રીતે દોસ્તની મુલાકાત વેળા ચહેરો મુશકુરાઈ છે અને તેના મોતથી ચહેરાનો રંગ બદલી જઈ આંખ્યોમાંથી એકાએક આંસુઓ ખડવા લાગે છે એવીજ રીતે અપરાધી બની, હાથો ઉચ્ચા કરી, અલ્લાહ પાસે દુઆ માંગતી વખતે આંખ્યો ભીની થઈ જવી પણ બીલકુલ સૂષ્ટિ મુતાબીક છે કારણકે જેવી અસર દિલ ઉપર પડશે એવીજ અસર જાહેર થયા વિના રહેશે નહીં.

એજા તુતલા અલયહિમ આયાતુર રહમાને ખરરૂ સુજજદંવ વ બોકિયાઃ (તે એવા લોકો હતા કે) જ્યારે પણ તેમની સામે અલ્લાહની આયતો પડવામાં આવતી ત્યારે તેઓ સજદામાં પડી જતા અને રૂદ્ધન કરતા હતા. (સુરાએ મરયમ, આયત: ૫૮).

મજફુર આયતથી સાબીત થાય છે કે રોવું અંબીયાઓની સુન્નત છે અને અલ્લાહ પોતે, વખાણની સાથે, તેની ગવાહી આપી રહ્યો છે, કોઈ ઉપજવી કાઢેલી વાર્તા કે કહાણી નથી.

વ યખિરરૂના લીલ અગ્રકાને યબકૂના વ યજીદોહુમ ખોશુઆઃ અને તે લોકો (સજદા માટે) મોઢાભર પડી જાય છે અને રોતા જાય છે અને (આ કુરાન) તેમની નમ્રતા-ખાકસારીને વધુ વધારતો જાય છે. (સુરાએ બની ઈસરાઈલ, આયત: ૧૦૮).

આ આયતમાં તે લોકો તરફ ઈશારો છે કે જેઓને આસમાની ડિતાબોનું ઈલ્મ મળી ચુક્યું છે, જ્યારે તેમની સામે આ કુરાન પડવામાં આવે છે ત્યારે ઝટ તેમનું કપાડ અહીં માટી ઉપર પડે છે અને વહાં તેમની શાન મેઅરાજપર પહોંચે છે, આ તરફ ઝમીન આંસુઓથી ભીની થતી જાય છે અને તે તરફ ખુદા પોતે તેમના વખાણ કરતો જાય છે!

રિવાયતોમાં મળે છે કે: ૬૦ શોઅયબ પયગમ્બર અ૦, ખોઝે ખુદા અને મોહબ્બતે ઈલાહીમાં એટલું રહતા હતા કે તેમની આંખ્યોની રોશની ચાલી ગઈ. અલ્લાહે તેમની આંખ્યોને ઢીક કરી આપી. પાછું રોવાનું શરૂ કર્યું અને ફરી એવીજ હાલત થઈ. ખુદાએ તેમને શફા બક્ષી. અનેકવાર એવું બન્યુ એટલે આખીરમાં હક સુભ્દ્રાનહુ વ તાલાલા તરફથી વહી આવી કે: અય મારા નબી! આટલું બધું શા માટે અને કેના માટે રૂદ્ધન કરો છો? અગર તમે જહન્નમની બીકમાં રડો છો તો જાઓ, અમે તમને જહન્નમથી મુક્ત કરી દીધા અને અગર તમે જન્તતના શોખમાં આંસુઓ સારો છો તો સાંભળો કે અમે જન્તતને તમારાપર હલાલ કરી આપી. જનાબે શોઅયબ નબીએ અરજ કરી કે: અય મારા માઅબુદ! ન હું જહન્નમના ડરથી રું છું, ન જન્તતના શોખમાં, બલકે હું તો ફક્ત તારી મોહબ્બતમાં રોયા કરું છું!

જનાબે મુસા અ૦, અલ્લાહના બહુજ માનવંત અને ઉલુલ અગ્રમ પયગમ્બરને એક દિવસ વહી આવી કે: અય મારા નબી! જે મારી મોહબ્બતનો દાવો કરે અને રાતના સુઈ જાય તે પોતાના

દાવામાં જુડો છે. શું એમ બની શકે છે કે હબીબ પોતાના મોહબુબની મોહબ્બતથી બેપરવા હોય! અય મુસા! અગર તમે તમારી દોસ્તીમાં સાચા છો તો રાતના અંધારામાં મારાથી દિલ લગાડો, ઈબાદત કરો અને આંખ્યોથી આંસુઓ વહાવો તો હું સમજું કે તમને મારાથી જરૂર મોહબ્બત છે! અલ્લાહ, ન ઈબાદતનો મોહતાજ છે, ન આંસુઓનો. અલ્લાહ પોતાના ખાસ બંદાઓને ઈબાદતનો તરીકો અને મોહબ્બતનો કાનૂન બતાવે છે કે જે આપણા માટે એક સબક છે.

આવા કિસાઓથી ઈતિહાસ ચુપ નથી. હું ઈબ્રાહીમ નબી અઠ, ખલીલુર રહેમાન હોવા છતાં, જ્યારે તેઓ નમાજ પડતા હતા ત્યારે ખુદાના ખોફ્થી આપના અંતરમાંથી ઉઠતો કરુણ આવાજ દૂરદૂર સુધી સંભળાતો હતો!

હું દાઉિદ પયગમ્બર અઠ, ફક્ત એક સારું કામ તર્ક કરવાના કારણે, જીવનના છેલ્લા શ્વાસ સુધી રહતાજ રહ્યા! આપનો વિલાપ અને આહોઝારી સાંભળી જંગલના મુંગા પશુ-પક્ષીઓ અને વિઝાળ પ્રાણીઓ આપની અતરાફ એકઠાં થઈ જતાં હતાં!

હું યહયા પયગમ્બર અઠના રૂદ્ધન અને વિલાપ પણ મશહૂર છે. નમાજમાં અલ્લાહના ખોફ્થી આપની એ સ્થિતિ થતી હતી કે આંસુઓની તો જાણોજ વર્ષાજ વહેતી હતી. સુકા ગાલો અને હોઠો ચીરાઈ જતાં હતાં. તેમની માતા, જખોમાં આંસુના કારણે પીડા ન થાય, એ માટે રુના પોલ મુક્તાં હતાં.

હદીસોથી જણાય છે કે: આ આંસુઓ ફક્ત આંખ્યોનું પાણી નથી, બલકે અલ્લાહની રહેમતની ચાવીઓમાંથી એક કુંચી છે, દિલને રોશન કરે છે અને ગુનાહોમાં પાણી રુબી જવાથી બચાવે છે.

ઇઢા ઈમામ, હું જાચફરે સાદીક અઠ ફરમાવે છે કે: દુનિયાની તમામ ચીજોની એક હદ મુકર્રર છે, સિવાય આંસુઓ, કારણકે ફક્ત તેનું એક ટીપું આગના સમંદરને બુઝાવી શકે છે!

યાને કે: ઈલાહી ગુસ્સાનો દરીયો, ખોફે ખુદાના એક આંસુના ટીપાથી ઠંડો બની જાય છે. આંસુઓ ઈન્સાનની બેઈજાતીના રજને સાફ કરી તેને ઈજાત બક્ષે છે. અલ્લાહ એવા ચહેરાઓને જહન્નમની આગથી બચાવે છે કે જેનાપર આંખ્યોમાંથી મુશળધાર છુટતા આંસુઓની વધા ચાલી હોય! એવું પણ બને છે કે અલ્લાહની રહેમત તે કોમ ઉપર ઉત્તરે કે જેની અંદર એક માણસ ખુદાના ખોફ્થમાં રડી રહ્યો હોય.

જનાબે યુનુસ પયગમ્બર અઠ ની ઉભ્મતનો દાખલો આપણી સમક્ષ મવજુદ છે: પાંન્તીસ વરસની છિદાયત પછી પણ બે માણસો સિવાય કોઈ આપની ઉપર ઈમાન લાવ્યું નહીં. આભિરકાર, તેમને બદદુઆ કરી. રાબિલ નામનો આલિમ કે જે આપનો મોઅમીન હતો તેણે પહાડ ઉપર ચડી પોતાની કોમને અવાજ આપ્યો કે: તમે શું બેપરવા થઈને બેઠા છો! તમારાપર ફ્લાણા દિવસે આસમાની અઝાબ ઉત્તરવાનો છે! માટે જલદી કરો, અલ્લાહ અને તેના નબી યુનુસ બીન મતા ઉપર ઈમાન લઈ આવો. આ અઝાબથી બચવાનો એક ઉપાય તમને બતાવું છું: તમારા બચ્યાઓને તેમની માંથી અને તમારા બુઢાઓને જવાનોંથી જુદા કરી શહેરથી બહાર મયદાનમાં ચાલ્યા જાઓ અને રોઈ-રોઈને અલ્લાહની બારગાહમાં આજીજીની સાથ કરગરો અને દુઆ કરો કે અલ્લાહ તે નાશકારક આફિતને હઠાવી આપે. એક લાખથી વધુ માણસોએ તેમની વાતને સ્વીકારી લઈ એમજ કર્યું. અઝાબે ઈલાહી નક્કી દિવસે આવ્યો. ઈમાનનો ચળકાટ, તૌબાની ખુશબુ, દુઆની પોકાર અને આંખ્યોમાંથી વરસાદના ટીપાંની જેમ વરસતા આંસુઓના બિંદુઓએ તે અઝાબને ધકેલી દીધો.

દુઅા શા માટે માંગવી જોઈએ ?

દરેક ઈબાદત વખતે એકજ નીયત રહે છે: અલ્લાહની કુરબત - નજીદીકી હાંસીલ કરવી. જેમ ઈન્સાન પોતાના રબની વધુનેવધુ બાજુમાં આવતો જાય છે તેમ તેની મહેરબાની અને રહેમતનો વધુનેવધુ ફાયદો ઉઠાવતો રહે છે. તો દુઅા ઈન્સાનને પોતાના ખુદા તરફ લઈ જવાનો એક માર્ગ છે. તેના થકી ઈન્સાનના તકદીરમાં પલટો આવે છે, નસીબ બદલે છે, બલા દૂર થાય છે, ગમ ખુશીમાં ફેરવાય છે, દુખના આંસુ હર્ષ ના ટીપાં બને છે.

૧ લક્ષ ખલકનલ ઈન્સાના વ નઅલમો માતો-વસવેસો બેહી નફ્સોહુ, વ નહનો અકરબો એલયહે મિન હબલીલ વરીદ: અને બેશક, ઈન્સાનને અમોએ પૈદા કર્યો છે અને તેનું મન જે તેને સુચવે છે તે અમે જાણીએ છીએ અને અમે તો તેના જીવન રગથી પણ વધુ નિકટ છીએ. (સુરએ કાદ્ય, આયત: ૧૬).

પરંતુ, ઈન્સાન આ દુનીયાની મોહજાળ - લાલચમાં ફસાઈ જતાં, પોતાને અલ્લાહથી દૂર સમજે છે અને આ નજીકીને ભુલી જાય છે. જેથી કરીને, ખાલીક અને મખલુક વચ્ચેનો આ સંબંધ ટુટે નહીં અને ઈન્સાન પોતાના રબની મરજને આધીન રહે, તે માટે થઈને આપણા માઅસુમીનો અઠમુંમે આપણને દુઅાઓનો એક ખજાનો પેશ કર્યો છે.

આ સુરો છોડીને જો આગળ વધશું તો સુરએ અન્ફાલની રૂઢ મી આયતની અંદર મળશે કે:

વઅલમુ અન્નલ્લાહા યહૃલો બયનલ મરએ વ કલ્બેહી: અને જાણી લ્યો કે અલ્લાહ ઈન્સાન અને તેના દિલના વચ્ચે આડો આવી જાય છે (રૂકાવટ થઈ જાય છે).

મનુષ્ય અને તેના દિલના વચ્ચે ખુદાનું આવી જવું, તેનો મતલબ એ છે કે ઈન્સાનના ઈરાદાનો અંજામ પરવરદિગારના હાથમાં છે, જો તે ચાહે તો તેને ફેરવી નાખે છે. માનવ ગમે તેવા પ્રયત્નો કરશે, પણ સફળ થશે નહીં. એટલેજ તો ઈમામુલ કલામ નો કલામુલ ઈમામ છે, મૌલા અલી અઠ ફરમાવે છે કે: મેં મારા રબને મારા ઈરાદાના ટુટી જવાથી ઓળખ્યો.

દુઅા ફક્ત પોતાના બે હોઠો વચ્ચે નીકળતાં શાખદો નથી, બલકે પોતાના દિલની અંદર છુપેલા ઈમાનની જાહેરાત અને પોકાર છે. આ માંગણીનો નાદ માત્ર ઈન્સાનની જીબથી બહાર ન આવે, બલકે તેના શરીરના રોમેરોમથી નીકળે, અંગના પ્રત્યેક છીદ્ર થી ઉઠે, જલ તો ફક્ત આ સંબંધમાં બધા અંગ-ઉપાંગો તરફથી બોલતાં એક પ્રતિનિધિનું કામ કરે છે.

૨ એજા સઅલક એબાદી અન્ની ઈ ઈન્ની કરીબુન ઓજબો દ-અવતદદાએ એજા દઆને; ફલ યસ-તજ્જબુ લી વલ યુઅમેનુ બી લઅલ્લહુમ યરશોહુન: અને જ્યારે મારા બંદાઓ તારાથી મારા વિષે સવાલ કરે તો (તું તેઓને કહી દે કે) હું નજીદીક છું, પોકારવાવાળાની પોકાર (સાંભળું છું અને) હું તેને જવાબ આપું છું; એટલે તેઓ મારા આમંત્રણ અને મારી પોકારને કબૂલ કરે અને મારાપર ઈમાન લઈ આવે જેથી કરીને તેઓને રસ્તો મળી શકે. (સુરએ બકરહ, આયત: ૧૮૬).

દુઅા માલિક ઉપર ઈન્સાનનો ભરોસો બતાવે છે, યકીનને તાજગી બક્ષે છે, ઈમાનને શક્તિવાન બનાવે છે અને કમજોરીના પંથ ઉપર ફ્સળી જવાથી બચાવે છે.

દુઅા વગરની ઈબાદતો તે રૂહ વગરના શરીર સમાન છે, તે ફક્ત હાડકાનું ખાલી ખોખું છે. દુઅા માંગવી તે પોતાને અલ્લાહનો બંદો બતાડવાની એક ખુલ્લી જાહેરાત છે.

જેમ પાણીનું એક બીદુ સમંદરમાં ભળી જાય છે તેમ ઈન્સાન, હુઆ થકી, પોતાના દિલ, મન અને આચરણથી કુદરત સાથે એક સંબંધ જોડી લે છે.

હદીસમાં છે કે: જયારે કોઈ શાખસ નમાઝ બાદ હુઆ માંગતો નથી ત્યારે અલ્લાહ ફરીશતાઓને ફરમાવે છે કે આ માણસની નમાઝને તેના મોઢા ઉપર ફેંકો કારણકે તેણે મને હુઆ માંગવાને લાયક પણ સમજ્યો નથી.

વલીલ્લાહીલ અસ્માઉલ હુસ્ના ફદ-ઉહો બેહા વળુલ્લાહીના યુલ્હેદુના ફી અસ્માએહી સ-યુજ-જવના માઝાનું યઅમલુનઃઅને સઘણા સારા સારા નામો ફક્ત અલ્લાહનાજ ખાસ છે, માટે તેને તે (નામો) થીજ પોકારો અને જે લોકો તેના નામોમાં કુદ્દ કરે છે તેનો ત્યાગ કરો અને તેઓ બહુજ જલ્દી પોતાની કરણીની સજા ભોગવશે.

(સુરાએ અઅરાફ, આયત: ૧૮૦).

આપણા આઠમા ઈમામ, હો અલી ઈજ્ઞે મુસા અરરજા અઠ મે ફરમાવ્યું છે કે: જયારે તમે કોઈ મુસીબતમાં મુખ્યલા થઈ જાઓ ત્યારે અમારા થકી ખુદાથી મદદ ચાહો કારણકે ખુદાનો ઈરશાદ છે કે સારા નામો અલ્લાહના માટેજ છે અને તે થકી તેને યાદ કરવાનું છે. ખુદાની કસમ! એ અસ્માએ હુસ્ના અમો છીએ જેની માઅરેફત - ઓળખાણ વિના કોઈ નેકી કબૂલ થતી નથી. હો સાદીકે આલે મોહમ્મદ, આપણા છઢા ઈમામ અઠ થી પણ આ કલામ વારીદ થયા છે.

આપણા પાંચમા ઈમામ, હો મોહમ્મદે બાકીર અઠ નું બયાન છે કે: જાઅબીર ઈજ્ઞે અબ્દુલ્લાહે અન્સારી, હો રસૂલે ખુદા સ૦ ના મહાન સહાબી કે જેમને પાંચ ઈમામોના જમાનાઓ જોવા નસીબ થયા હતા અને જે કરબલાના કરુણ બનાવ પછી સઉથી પહેલા જવારે કષે ઈમામે હુસ્યન અઠ છે, તે આ રીવાયતના રાવી છે કે: મેં હો રસૂલ સંથી હો અલી અઠ વિશે પુછ્યું તો આપે ફરમાવ્યું કે: અલી મારો નફસ છે, હસનો-હુસ્યન અઠમુઠ મારી રૂહ છે અને ફાતેમાહ અઠ મારી શેહઝાદી છે. જેણે તેમને તકલીફ આપી તેણે જાણો મને તકલીફ આપવા બરાબર છે અને જેણે તેમને ખુશ કર્યા જાણો મને ખુશ કર્યા સમાન છે. તેઓનો હુશમન તે મારો હુશમન છે અને તેઓનો દોસ્ત તે મારો દાસ્ત છે. અય જાઅબીર! અગર તમે ચાહો કે અલ્લાહ તમારી હુઆ કબૂલ ફરમાવે તો તેમના નામોના વસીલાથી તમે હુઆ માંગશો કારણકે તેઓ અલ્લાહના ખ્યારા બંદાઓ છે.

હો અબા અબ્દીલ્લાહ, જાઅફર ઈજ્ઞે મોહમ્મદ, આપણા છઢા ઈમામ અઠ થી મનકુલ છે કે: જે કોઈ ખુદાથી પોતાની હાજત ચાહે તો પહેલે હો મોહમ્મદો આલે મોહમ્મદ સ૦ ઉપર દોર્દ મોકલે અને ત્યાર પછી હુઆ માંગો અને છેવટે ફરી દોર્દ પડે તો ખુદા કરીમ છે કોઅવ્યલ અને આખરને કબૂલ કરશો અને દરમિયાનને છોડશો નહીં કારણકે હો મોહમ્મદો આલે માહેમ્મદ સંની ઉપર સલવાત જરૂર કબૂલ થશે અને તેના સંકામાં હુઆ પણ માન્ય રખાશે.

હુઆ એકલી પુરતી નથી, બલકે ઈન્સાનને પોતાના આત્મા સાથે જહાદ કરવાની પણ જરૂર છે, સંગૃષો પ્રાપ્ત કરવા અને બુરાઈઓથી બચવું જોઈએ. દાખલા તરીકે અલ્લાહના નવાણું નામોમાંથી એક નામ સાદિક (સાચો) છે. પણ સાદિક, સાદિકની જપ લગાડવાથી, તસ્બીહ કાઢવાથી કંઈ ઈન્સાન સાચો બની જતો નથી. સત્યને પહેલાં પોતાના મન અને તનમાં ઉતારવું જોઈએ, પગથી માથા સુધી એ ગુણ પોતામાં હોવો જોઈએ. આંખમાં, કાનમાં, જીબમાં, શરીરના

દરેક અવ્યવમાં આ સચ્ચાઈ પેશી જવી જોઈએ: આંખની સામે કોઈ અસત્ય ફરકે નહીં, કાનમાં કોઈ જુઠ ગુજે નહીં, જીબ કોઈ ખોટી ગવાહી ઉચારે નહીં...

રહમાન અને રહીમ અલ્લાહને પોકારવા પહેલાં પોતાની અંદર દ્યાનું ગુણ છે કે નહીં તે તપાસવું ઘટે છે. એક બેરહેમ, ખુની અને આલિમ ઈન્સાનની પોકારની દ્યાળુ - કૃપાળુ ખુદાથી શું નિસ્બત હોય શકે? બેહદ ઉદાર માઅબુદ્ધનો દરવાજો ખટખટાવવાની અગાઉ પોતાના દામનને ચીરીને નિરખી લેવું જરૂર છે કે પોતામાં આ સીફ્ફત છે કે નહીં? એક સ્વાથી,

મતલબી અને કંજુસ માણસ કરીમ અલ્લાહનું નામ કેમ કરી પોતાની જીભપર લાવી શકે છે?

એક આલિમનું દિલ કદ્દી એક જાહીલ તરફ ખેંચાશે નહીં, એક અત્તર વેંચનાર કોઈ પણ કાળે ગોદકીવાળી જગ્યાને પોતાના વેપારનું સ્થાન બનાવશે નહીં, એક મુત્તકી-પરહેજગાર ગુનાહોની મજલિસમાં જઈને બેસશે નહીં, એક બેહદ સખી-રહેમદિલ માનવી જુલ્મો-સિતમના વાતાવરણમાં જવી શકતો નથી.

જો આટલી જહાદ પોતાના આત્મા - નફ્સ સાથે કરી શકે તોજ ઈન્સાનના કલામમાં દુઆની કબૂલાતની અસર પૈદા થઈ શકે છે.

દુઅા દિલમાં અલ્લાહનો ડર પૈદા કરે છે, ગુનાહો આચરવાથી રોકે છે, નફ્સને સફાઈ દીએ છે, બીજાઓના દુખની યાદ અપાવે છે.

શું બીજાઓ માટે પણ દુઅા માંગવી?

સુન્નતે રસૂલ સર્ઠ અને અહાદીસે માઅસુમીન અઠમુઠ મોઅમીનને પોતાના ઈમાની ભાઈઓ માટે દુઅા કરવાની ખાસ ભલામણ કરે છે. આ પ્રમાણે વરતતાં, માંગનારને ઉભલ ફાયદો ઉપજે છે, જગ્યારે કે ફક્ત પોતાનાજ માટે માંગેલી દુઅા તેને એવો લાભ આપતી નથી. ઉપરાંત, પોતાની જરૂરીયાતો ઉપર પડદો નાખી તેમના મોઅમીન ભાઈની હાજતને અધીક્તા આપવાથી તેના દિલમાં તેમના પ્રત્યે હમદર્દી પૈદા થાય છે.

આપણા ચોથા ઈમામ, હી અલી જયનુલ આબેદીન અઠ ફરમાવે છે કે: જગ્યારે એક મોઅમીન પોતાના બીજા મોઅમીન ભાઈ વાસ્તે દુઅા કરે છે અથવા તેના હકમાં સારું ઈચ્છે છે ત્યારે આસમાનના ફરીશતાઓ કહે છે કે: અય બંદે ખુદા! તું તારા ભાઈ માટે કેવો સારો ભાઈ છો! તેની ગેરહાજરીમાં તેની ખાતીર તું અલ્લાહ પાસે તેની ભલાઈ ચાહે છે! તેના વાસ્તે તે જે માર્ગું છે, અલ્લાહ તને તેનાથી વધુ અતા કરશે.

દલીલ રૂપે, માઅસુમાઝે કૌનયન, ખાતુને જન્મનાત, જનાબે ફાતેમા ઝહેરા સલામુલ્લાહે અલયહાનો દાખલો એક સવો 'તમ નમુનો' છે: તેમનાજ દીકરા અને આપણા બીજા ઈમામ, હી હસને મુજતબા અઠ ફરમાવે છે કે શબે જુમ્માહ, મેં જોયું કે મારી મા આખી રાત અલ્લાહની ઈબાદતમાં અને પાડોશીઓના હકમાં દુઅા કરવામાં વિતાવે છે. તે વખતે મેં સવાલ કર્યો 'કે: અય માદરે ગીરામી! આખી રાત મેં તમને બીજાઓની દુઅા કરતાં જોયા, પણ તમારા પોતા માટે દુઅા કરતાં મેં તમને સાંભળ્યા નહીં: જનાબે સચ્ચા અઠમે જવાબ આપ્યો કે: પહેલા પાડોશી અને પછી આપણે!

માનવ નેક સીફતો-સારા ગુણોમાંથી આ પણ એક ઉત્તમ ચારિત્ર છે કે માણસ પોતાના દુખ-દર્દ અને ગમ ઉપર બીજાની તકલીફીને અગત્યતા આપે. આવી વર્તણુક મનની સફાઈ પયદા કરે છે, પોતાના ભાઈ માટે મોહબ્બત જન્માવે છે અને આજ ઈન્સાનીયતનો સાચો અર્થ છે કારણકે તેવું વર્તન ફક્ત દુઓ પુરતુંજ નથી બલકે જીન્દગીમાં મદદરૂપ થવા પ્રેરે છે.

આપણા આઠમા ઈમામ, હો અલી રજા અઠ ફરમાવે છે કે: એવો કોઈ મુસ્લિમાન નથી કે જે પોતાના ઈસલામી ભાઈઓ-બહેનો માટે દુઓ કરે, જીવતા હોય અથવા ગુજરી ગયા હોય, અને અલ્લાહ તેને દરેક ઈમાની ભાઈ અને બહેનનો સવાબ રૂપે બદલો ન આપે, હો આદમથી લઈને કયામતની સવાર સુધી.

આથી માલુમ થયું કે દુઓમાં જેટલી મોઅમીનોની સંખ્યા વધશે એટલોજ તેના ફળમાં વધારો થશે, એટલોજ માનવ લાગણી વિશાળ બનશે અને એટલોજ અખલાકી સફાઈ પ્રગટ થશે.

હદીસમાં એમ પણ મળે છે કે: પોતાના ભાઈ માટે કરેલી દુઓ રોજ્ઘમાં બરકત આપે છે, બલાને દુર હટાવે છે અને નેકીઓમાં વધારો કરે છે.

મજફુર કોલથી પ્રકાશ પડે છે કે પોતાના મોઅમીન ભાઈ અથવા બહેન માટે કરેલી દુઓ ફક્ત આખેરતની ભલાઈ નથી આપતી, બલકે આ દુનિયાના ફાયદાઓ પણ અતા કરે છે.

અગર દરેક મોઅમીન આ નેક આદત અપનાવે તો કોમની અંદર જરૂર પરિવર્તન આવે અને સંગઈન મજબૂત બને.

આપણા છઢા ઈમામ, હો સાદીકે આલે મોહમ્મદ અઠ ફરમાવે છે કે: કોઈ એવી જમાત નથી કે જ્યાં ચાલીસ મોઅમીનો ભેગા થઈ એક-બીજા માટે દુઓ કરે અને અલ્લાહ તેમની દુઓને સ્વીકારે નહીં.

ઈસલામ વ્યક્તિગત જીવન ઉપર સામાજિક જીવનને અગત્યતા આપે છે. એક તરફ ચાલીસ માણસોની સાથે મળીને હાજત પુરી થઈ જાય અને બીજી તરફ એક દોરડીથી બંધાએલી એવી નાની ટુકડી જન્મે કે જેની અંદર દરેકના દિલ એક-બીજા પ્રત્યે હેત અને લાગણીથી ભર્યા હોય.

એજ એક કારણ છે કે સાથે મળીને દુઓ પડવી અથવા માંગવી, યા તો એક પડે અને બીજાઓ „આમીન,, કહેતાં આવે, સંખ્યા ભલે વધારે હોય, માણસો જુદા જુદા હોય, દિલ અલગ અલગ હોય, પણ દરેક દિલમાંથી એકજ સરખી પુકાર નીકળતી હોય!

હદીસ તો એનાથી આગળ જઈને ફરમાવે છે કે: અગર તમે ચાહો કે તમારી દુઓ કબૂલ થાય તો અમૃત મોઅમીનોને તમારા ઘરે જમવા બોલાવો અને તેમનાથી દરખાસ્ત કરો કે નિયાતના સુફરા ઉપર તમારા હકમાં દુઓ કરે.

સવાલ ઉત્પન થાય છે કે: શું ખુદા પોતાના બંદાઓની હાલતથી અજાણ છે કે તેમના માટે આપણે દુઓ કરીએ, જ્યારે કે આપણી પોતાની ઘણી હાજતો છે? શા માટે ખુદા પોતાના બંદાઓની ડાયરેક્ટ મદદ કરતો નથી અને આપણાથી તેમના વાસ્તે માંગણી કરાવે છે?

મજફુર સવાલનો ઉત્તર ઉપરોક્ત ખુલાસામાં લંબાણપૂર્વક આવી ગયો છે, તે છતાં વધુમાં અરજ કરવાનું કે: બેશક, મોઅમીનો આપસમાં એકજ તસબીહના દાણા અને એકજ સાંકળની કળીઓ હોય, ઈસલામ, દીને ફીનત, મોઅમીનના દિલમાં પોતાના ઈમાની ભાઈ પ્રત્યેની હમદર્રી અને મોહબ્બતની લાગણીને વિસ્તારવા ઉપરાંત તેના મૂળને ઊડા અને વધુ સજ્જડ બનાવવા ચાહે છે. તે

લાગણી ઈન્સાનના અંતકરણમાંથી જગ્રત થવી જોઈએ, બલકે માત્ર એક દેખાવ અને એક નકશા સમાન ન હોવી જોઈએ.

જીવતાઓ ઉપરાંત, ગુજરી ગાંધેલા મોઅમીનો માટે દુઅાએ ઐર અને બક્ષિશ ચાહવાની મજહબમાં ઘણી ફ્રીલિટ વારિદ થઈ છે. એનાથી વધારે કઈ વાત સારી હોય શકે કે જે બીરાદરાને મોઅમેનીન ખાક નીચે સુતા છે, જેમના માટે હવે ઈબાદત કરવાના રસ્તાઓ બંધ છે, મગફેરતના મોહતાજ છે, તેમના વાસ્તે આપણને હદિયાના થાળ મોકલવાનું નસીબ થાય! તેમની રૂહ કેટલી સાંત્વન પામતી હશે!

હો રસુલે ખુદા સું થી હદીસ વારિદ થઈ છે કે: કબરમાં મથ્યતની એ હાલત રહે છે, જે હાલત દરિયામાં પડી ગાંધેલા ઈન્સાનની હોય છે. એવો માણસ, જે કાંઈ હાથમાં આવે, તે પકડી, તેના સહારે બચવા ચાહે છે. એજ પ્રમાણે, માટી તરે સુતેલો શખ્શ નેક દુઅા, સદકા, ફાતેહા, ઈસ્તિગફાર, વગેરેનો ઈન્નોઝાર કરે છે અને તે મળવાથી બહુજ ખુશ થાય છે.

(મહુમ અલ્લામા હાજ નાજ અઠમું સાહેબની કિતાબ: મેઅરાજુસાદાહ)

માઅસુમીનો અઠમું આપણને કબરવાસીઓની સલામી વાસ્તે કેટલી ઉત્સાહપૂર્વક ભલામણ કરે છે તે તપાસીએ. હદીસમાં છે કે: જે માણસ જુમ્માહના દિવસે પોતાના માં-બાપની કંઈઓની ઝીયારત કરવા જાય તેના માટે એક કબૂલ થયેલી હજનો સવાબ લખાય છે. અને માં-બાપની ઝીયારત તથા તેમના હકમાં દુઅા કરવા બાદ, જે હાજત પોતે દિલમાં રાખતો હોય તે અલ્લાહને પેશ કરે તો ઈન્સાઅલ્લાહ પૂરી થશે.

(કિતાબ નામે ઝયનુલ મુત્તકીનમાં, હુજ્જતુલ ઈસલામ મૌલાના મસરૂર હસન સાહેબ કીબલા મુખારકપુરીના હવાલાથી)

શયતાન જ્યારે આસમાનપર હતો ત્યારે ફરિશતાઓએ સાંભળ્યું કે અલ્લાહે જાહેર કયું¹ છે કે: મારા એક બંદાપર મારો અજાબ ઉત્તરવાનો છે. આ ફક્ત જાહેરાત છે, કોઈનું નામ લેવામાં આવ્યું નથી. એક ફરિશતાએ સાંભળ્યું, તેનાથી મોટા ફરિશતા પાસે ગયો. આ પછી તેનાથી જે મોટો હતો તેના પાસે ગયો. એમ કરતાં કરતાં સર્વ મળીને મલેકુલ મોત પાસે ગયા કે અમારા માટે દુઅા કરો. તે ગભરાઈ ગયો કે કયાંક તે અજાબ મારા પોતા માટેજ ન હોય! ચાલો ઈસરાઝીલ પાસે. હવે લોકો વાસ્તે શું તે દુઅા કરે? તે પોતે પોતા માટે હયરાન થઈ ગયો. તો ચાલો મીકાઈલ પાસે. તેણે કહ્યું: ચાલો જીબું ઈલ પાસે. જીબું ઈલ જેવા સચ્ચદુલ મલાએકા -ફરિશતાઓનો સરદાર પણ ગભરાઈ ગયો. આ અજાબ કયાંક મારા માટેજ તો નથીને! એણે પોતાની ફીકર થવા લાગી.. કહ્યું કે ચાલો મારા એક દોસ્ત પાસે, જે ફરિશતો નથી, એક જીન છે, બેહતરીન જીન કે જેણે ખુદાએ આસમાનપર બોલાવ્યો છે. નાનામાં નાનો ફરિશતાથી લઈને જીબું ઈલ જેવા મહાન ફરિશતા સુધી, સર્વ મળીને અજાઝીલ પાસે પહોંચ્યા. આવી મોટી જમાત જોઈને તે પણ એક વખત ગભરાઈ ગયો કે શું બાબત છે? જીબું ઈલે જવાબ આપ્યો કે અલ્લાહે જાહેરકયું² છે કે તેનો અજાબ તેના કોઈ એક બંદા ઉપર ઉત્તરવાનો છે, તો કયાંક તે અમારામાંથી કોઈ એક ઉપર ન હોય! અમારા માટે તમે દુઅા કરો.

અજાઝીલે દુઅા માટે હાથો ઉઠાવ્યા: પરવરદિગાર! તારો અજાબ એ લોકો સવે³ ઉપરથી ઉઠાવી લે! અલ્લાહે તેની આ દુઅા કબૂલ કરી લીધી અને અજાબને હઠાવી દીધો.

લોકોએ તે વખતે સવાલ કર્યો⁴ કે: મૌલા! તો પછી તે અજાબ કેનાપર ઉત્યો?

ઈમામે કહ્યું કે: તે અજાબ અજાજીલ ઉપર આવ્યો કે જે બીજા તમામ માટે દુઆ કરી રહ્યો હતો. બાદમાં તે ઈબલીસ શયતાનથી ઓળખાવવા લાગ્યો. ઈમામે સમજાવ્યું કે: તમે મલાએકા અને શયતાનમાં ફર્ક જોયો? મલાએકાઓએ જ્યારે સાંભળ્યું ત્યારે તેમને પોતાની ફીકર થવા લાગી કે એવું ન બને કે આ અજાબ અમારા વાસ્તો હોય! શયતાને જ્યારે સાંભળ્યું ત્યારે પોતે પોતાને ભૂલી ગયો અને તેણે બીજાઓ ખાતર હાથો ઉઠાવ્યા! આ છે એક જાતનો અભિમાન, ફખ્ર, ગર્વ, હુંપદ, પોતાને બીજા કરતાં ઉચ્ચો સમજવો!

(મૌલાના મીરજા મોહમ્મદ સાદિક હસન સાહેબની મજલિસમાંથી)

હો ઈબ્રાહીમ નબી અઠની દુઆ: રખ્બનગફીરલી વલે વાલેદયા વલીલ મોઅમેનીના યબ યકુમુલ હિસાબ: અય મારા રબ! મને બક્ષી આપ અને મારા માં-બાપને પણ તેમજ મોઅમેનીનને તે દિવસે કે જ્યારે હિસાબ લેવામાં આવશે. (સૂરાએ ઈબ્રાહીમ, આ: ૪૧)

હો નૂહ નબી અઠની દુઆ: રખ્બનગફીરલી વલે વાલેદયા વલેમન દખલ બયતેય મોઅમેનંવ વલીલ મોઅમેનીના વલ મોઅમેનાત: અય મારા રબ! તું મને માફ કરી દે અને મારા માં-બાપને પણ અને દરેક તે શખણે કે જે ઈમાનની હાલતમાં મારા ઘરમાં દાખલ થાય અને તમામ મોઅમેનીન મર્દ તથા મોઅમેનીન ઔરતને. (સૂરાએ નૂહ, આ: ૨૮)

દુઆ એક પ્રકારની શફાઅત છે, છુટકારો - નજાત આપનાર છે અને શફાઅત તે કરે કે જે પોતે સઉ પ્રથમ બક્ષાઈ ગયો હોય. આમ વિચાર કરીએ તો પહેલે માં-બાપની માઝીની દુઆ માંગવી જોઈએ, પછી પોતાની અને મોઅમેનીનની અથવા તો મોઅમેનીનને આગળ, પોતાની જાતને સઉથી આખીરમાં અને માં-બાપને વચ્ચમાં રાખી દુઆ કરવી જોઈએ. પરંતુ, અલ્લાહના બન્ને પયગમ્બરો આપણને શીખવે છે કે સઉથી અગાઉ તમે તમારી પોતાની બક્ષીશની યાચના કરો, તમારા ગુનાહોની માઝી ચાહો અને બાદમાં તમારા માં-બાપ અને છેવટમાં મોઅમીનોની દુઆ કરો. એજ કારણ છે કે હો મોહમ્મદો આલે મોહમ્મદ સર્ઠ ની સિવાય કોઈએ શફાઅતનો વાયદો નથી કર્યો'. ઈસલામી ઊમતના પૂરા ઈતિહાસમાં ઘણા ઘણા મોટાઓ ગુજરી ચુક્યા છે: અવલીયાએ કીરામ, બુજુર્ગ બલીજાઓ, મહાન ફીલો, હો પોતાને ઈમામ કહેવરાવનારાઓ, તફસીર લખનારાઓ, હદ્દીસો બયાન કરનારાઓ, શું શું પસાર નથી થયા? ખોલફાએ બની અખ્બાસ, બની ઉમયાહ, સેલકુજી બાદશાહ, શાહસાની બાદશાહ, કોઈ પણ બાદશાહે, સુદીએ, હદ્દીસ લખનાર અથવા ખલીજાએ એવો દાઅવો નથી કર્યો કે અમે ક્યામતમાં તમને બક્ષાવી આપશું. શફાઅતનો, બક્ષાવવાનો દાઅવો તો તે કરે કે જેણે પોતાને બક્ષીશનું પૂરું ચક્રીન હોય!

(મૌલાના મર્હુમ તાલીબ જવહરી સાહેબની મજલિસમાંથી)

શું બીજાઓ આપણા માટે દુઆ કરી શકે છે?

બીજાઓ ફક્ત આપણા માટે દુઆ કરી શકતા નથી, બલકે એમ કરવું જરૂર છે. ઘણી વખત એવું બને છે કે આપણા બન્ને હોઠો વચ્ચેથી નીકળેલી દુઆ દરબારે ઈલાહીમાં કબૂલ થતી નથી, જ્યારે કે તેજ કલામો આપણા હકમાં બીજાની જબાનથી ઉચ્ચારેલા જલદી સ્વીકારવામાં આવે છે.

હો સચ્ચાદે સજજાદ, આપણા રથા ઈમામ, અલી ઈન્જુલ હુસ્યન, જ્યનુલ આબેદીન અં, પોતાના ખાદિમને ફરમાવતા હતા કે: હજતમંદને આપતી વખતે તારો હાથ જરા રોકતો જ કારણકે તેની હુઆ રદ નથી જતી અને તેને તું હુઆ કરવાનું કહેતો જ. (મેઅરાજુસસાદાહ, મહુમ અલ્લામા હાજ ગુલામઅલી હાજ ઈસમાઈલ અંમી).

આ દુનિયામાં ઈન્સાનની સઉથી પહેલી ફીકર પૈસા શોધવાની હોય છે કારણકે તેનું ગુજરાન તેના ઉપર નખે છે (ખાવું, પીવું, મકાન, કપડા, ઘરની સગવડ, શાદી, ઔલાદની પરવરિશ, સામાજિક ખર્ચ, સફર, ૧૦) અને સઉથી સખ્ત પરિક્ષા પણ તે કમાણીની અંદરજ રહેલી છે કારણકે હલાલને કેમ કરી હરામથી બચાવવું? શરીઅત શા માટે હલાલ ઉપર ભાર આપે છે? કારણકે જાએજ-ઇસલામી કાનુન મુજબ મળેલી રોજ મનુષ્યના શરીર ઉપરાંત તેના દિલ ને પાક-સ્વર્ણ કરે છે અને તે પાકીજગી હુઆ કબૂલ થવાનું મોટું કારણ છે.

અગર જે સમયે તે પાક પૈસા કોઈ ગરીબ-લાચારના હાથમાં જાય, તે વખતે તેનું દિલ ખુશ થાય અને તેજ હાલતમાં તેની જબાનથી નીકળેલા શબ્દો વીજળી વેગે અલ્લાહના દરબારમાં પહોંચી જાય તો તેમાં કંઈ અજબ થવાનું નથી!

જેવું વાવો તેવું લણો મુતાબીક, આ વાતને સમજવી સહેજ મુશકીલ નથી. ઈસલામ હમેશાં અલ્લાહની રાહમાં ખર્ચ કરવાની ભલામણ કરે છે. પોતાના મોઅમીન ભાઈ માટે કરેલી આ કુરબાનીનું વળતર અલ્લાહ તરફથી આપણને આપણી હુઆની કબૂલાત માઅરફત મળે છે.

બીજું એક રિવાયત છે કે: જ્યારે એક મુસલમાન બીજા એક બીમાર મુસલમાનની મુલાકાતે જાય છે ત્યારે સૌતેર હજાર ફરીશતાઓ તેને સલામ મોકલે છે. માટે તમારા બીમાર ભાઈ પાસે તમે માંગળી કરો કે તમારા હકમાં તે હુઆ કરે કારણકે બીમારની હુઆ મલાએકાઓની હુઆ બરાબર છે અને તે જલદી કબૂલ થવા લાયક બને છે.

અલ્લામા મજલીસી અંમીની કીતાબ તેહજીબુલ ઈસલામ માં આ હદીસો મળશે:

હકતાલા ડાબી બાજુના ફરીશતાને હુકમ આપે છે કે બીમારીના સમયમાં બંદે મોઅમીનના કોઈ ગુનાહ લખે નહીં.

બીમારી અને દર્દના સબબથી એક રાત જાગવું એક વરસાની ઈબાદતથી અફઝલ છે.

બંદે મોઅમીનનો એક રાતનો તાવ ગુજરેલા ગુનાહોનો કફફારો બને છે.

હવે વિચાર કરો કે જ્યારે એક બંદે મોઅમીન ગુનાહોથી સાફ થઈ રહ્યો હોય, આબીદની હયસીયત રાખતો હોય, તેના ગુનાહોને લખવાથી રોકી દેવામાં આવ્યા હોય, તેની બીમારી તેને માઅબુદ્ધ પાસે એક દરજો અર્પણ કરતી હોય, તે વખતે મજફુર બીમાર અગર અલ્લાહ પાસે આપણી હુઆ માંગો તો તેના બોલને રખ્ખુલ આલમીન કેમ હુકડાવી આપે?

શું ઈમામથી બચાન થયેલી હુઆમાં આપણે ઉમેરો કરી શકીએ છીએ ?

અખુલ્લાહ બીન સનાન કહે છે કે હ૦૯૦ જાન્ફર સાદિક અંમે ઈરશાદ ફરમાવ્યું: નજદીકના સમયમાંજ તમારા માટે શંકાસ્પદ સંજોગો ઉભા થશે. એ વખતે તમારી હાલત એવી થશે કે તમને

(હીદાયતનું) ઈલમ નજરે નહીં પડે અને જહેરી રીતે કોઈ ઈમામ (હીદાયત) નહીં હોય. એ સમયે માત્ર એ માણસ બચી શકશે જે દુઆએ ગરીફને પોતાનો વીર્દ બનાવી લેશે.

મેં કહ્યું: દુઆએ ગરીફ કેવી રીતે પડવામાં આવે છે? આપે ફરમાવ્યું:

યા અલ્લાહો, યા રહમાનો, યા રહીમ, યા મોકલ્લેબલ કોલુબે સભ્બીત કલ્બી અલા દીનેક

(અય અલ્લાહ, અય રહમાન, અય રહીમ, અય દિલોને ફેરવનાર! મારા દિલને તારા દીન ઉપર દ્રઢ નિશ્ચયથી રાખ)

મેં કહ્યું: યા મોકલ્લેબલ કોલુબ વલ અભ્સાર સભ્બીત કલ્બી અલા દીનેક.

ઈમામે ફરમાવ્યું: બેશક ખુદા ” મોકલ્લેબલ કોલુબ વલ અભ્સાર ” છે, પરંતુ તમને મેં જે કહ્યું છે તે પ્રમાણેજ કહો : ” યા મોકલ્લેબલ કોલુબે સભ્બીત કલ્બી અલા દીનેક ”.

(મિજાનુલ હીકમત, ભાગ ૧, આયતુલ્લાહ મોહમ્મદ રય શહરીની કિતાબમાંથી)

દુઆની શી વિશાળતા છે?

જેવી રીતે ભોજન પેટની ભૂખના દર્દને મટાળે છે, તેવીજ રીતે દુઆ દિલના ચયન અને મનની શાંતિની ભૂખનો ઈલાજ કરે છે.

આપણા છઠા ઈમામ, હું જાયફરે સાદીક અઠ મે ફરમાવ્યું કે: અય મયસર! દુઆ કરીને એમ ન કહો કે જે તકદીરમાં હશે તે થઈ રહેશે. ખુદા પાસે એક એવી પણ કદર છે, એવો દરજો છે કે જે દુઆ વિના મળી શકતો નથી. અગર તમે જીબ બંધ કરી બેસી ગયા તો તમને કાંઈ નહીં મળે. યાદ રાખજો કે જે દરવાજો હમેશાં ખટખટાવવામાં આવે છે તે એક દિવસ જરૂર ઉઘડવાનો.

બેશક, અગર જે ફરજ ઈબાદતો છે તે વાળું કરવામાં ન આવી હોત તો ઈન્સાનોનો ઘણો મોટો ભાગ અલ્લાહને ભૂલથી પણ કદી યાદ કરતે નહીં, તેના દરબારથી અજાણ રહેત અને તેની મોહબ્બતથી તેઓના દિલ બીલકુલ ખાલી રહી જાત.

આપણા સાચા હાદીઓ, અઈમાંએ માઅસુમીન અઠમુઠ મે ફક્ત આપણને દુઆ માંગવાનો બોધ નથી આપ્યો, પરંતુ તેઓ પોતે પણ અમલ કરીને બતાવી દીધું કે: જુઓ, અમે કોઈ ચીજના મોહતાજ નથી, ચાહીએ તો જન્નતથી ભોજન અને કપડા મંગાવી લઈએ, જુલા જુલાવવા માટે આસમાનથી ફરીશતાઓને તેડાવી લઈએ, ઝમીન પોતાનું પેટ ફાડીને અમારી સામે પોતાના ખજનાઓ પાથરી આપે, એમ સમજો કે આએ આખા વિશ્વનું સર્જન અમારા સદકમાં થયું છે, છતાં પણ અમો કેવી આજીજી, લાચારી, કાકલુદીની સાથે, રોઈ રોઈને, પૂરા વિવેક, અદબ અને નમૃતા પૂર્વક અલ્લાહ પાસે યાચના કરીએ છીએ.

કુલ મા યઅ-બાઓ બેકુમ રખ્બી લવલા દોઆઓકુમ ફક્દ કાગુબ્તુમ ફ સફ્ફા યકુનો લેજામાઃ (અય રસુલ!) તું કહી હે કે મારા રબને તમારી કોઈ પરવા નથી, જ્યારે કે તમે દુઆજ નથી કરતા; તમે તો (તે રસુલને) જુઠલાવ્યા, તો નજીકમાં તેનું જરૂર પરિણામ આવશે. (સૂરાએ અલ ફુરકાન; આયત: ૭૭).

નબીએ કરીમ, હું મોહમ્મદ સઠનું ફરમાન છે કે: દુઆ અલ્લાહ તાલાની રહેમત મેળવવા માટે ચાવી છે, વજુ નમાજ માટે ચાવી છે અને નમાજ જન્નત મેળવવા માટે ચાવીછે.

વધુમાં એક હદ્દીસની અંદર મળે છે કે: હુઅા અલ્લાહ તાલાલાના લશકરોમાંથી એક લશકર છે; તે ઈન્સાનની કગ્ગા (મૌત) ને નક્કી થયેલા સમય છતાં પણ રદ કરી શકે છે.
બીજા સ્થળે માઝસુમ અઠ ફરમાવે છે કે: હુઅા અલ્લાહ તાલાલાની ઈબાદત છે, હુઅા આવનારી મુસીબતોનો નાશ કરે છે અને હુઅા મોઅમીનનું એક હથિયાર છે.

શું હુઅા ઈન્સાનને આળસુ નથી બનાવતી?

પોતાના રબ પાસે તંદુરસ્તી, ઓલાદ, ઝીદગી, દોલત, નેક તૌફીક, સ્કુલમાં કામીયાબી, હીફાજત, વગેરે..ની માંગણી થકી ઈસ્લામ ઈન્સાનને આળસુ કે બેઝીકર બનાવવા ચાહતો નથી. હાથપગ હલાવવા વિના ફક્ત આસમાન તરફ નજર માંડવી, એવો જ્યાલ બીલકુલ જુડો છે કારણકે અલ્લાહની પૈદા કરેલી ફીન્નતને દરેક વસ્તુ તાબે છે, ઈસ્લામે આવા મોઅજ્જાના પાયા ઉપર ઈન્સાનની ઝીદગી રચી નથી. ઝીદગી અને મૌત, તંદુરસ્તી અને બીમારી, તવંગરી અને ગરીબી, કામીયાબી અને નિષફ્ટનતા, હાર - જીત, તડકો - છાયો, શરદી - ગરમી, આ બધી હાલતો અને ફેરફારોથી હુનીયા રંગીન હોય, ઈસ્લામ એક તરફ ઈન્સાનને, આનો જ્યાલ રાખી, કામ કરવા સુચવે છે અને બીજી તરફ આવતી નળતરો કે જે પોતાની તરકીના માર્ગ માં રૂકવટ અને તોફન બનતી હોય, તેનાથી બચવા અલ્લાહ પાસે હાથ ઉચ્ચા કરી હુઅા માંગવા પ્રેરે છે કે જેથી તે ભટકી ન જાય. સઉ પ્રથમ, પ્રગતીના પંથ ઉપર, અલ્લાહે તેને ઈનાયત કરેલી શારિરીક અને અકલી તાકતને મનુષ્ય પોતાના ઉઘ્યોગમાં લીએ અને સાથમાં અલ્લાહની રહેમતનો દામન હાથમાંથી છુટે નહીં, તે માટે હમેશાં પોકારે કે: ખુદાયા! મેં મારી બનતી કોશીશો કરી, પરંતુ હવે મારી શક્તિની બહાર છે, માટે તું મારી જલ્દી મદદ કર!

એક વ્યક્તિ બહુજ હુખ અને મુસીબતની સ્થિતિમાં, છડા ઈમામ અઠની બિદમતમાં હાજર થઈ માંગણી કરી કે : મૌલા! હું બેહદ ગરીબ અને ફકીર માણસ છું, તમે મારા માટે હુઅા કરો, જેથી અલ્લાહ મારી રોજીમાં વધારો કરે અને મને દરેક તકલીફમાંથી નજીત આપે.

હું હું જાયફરે સાદ્રીક અઠમે જવાબમાં ફરમાવ્યું કે: હું તારા માટે હુઅા નહીં કરું.

પેલી વ્યક્તિએ, અજબ થઈ, એક ઠંડી આહ ભરીને પુછ્યું કે: મૌલા! એવું કયું કારણ છે કે તમે મારા માટે હુઅા નહીં કરો ?

ઈમામે તેના સવાલના ઉત્તરમાં જગ્યાવ્યું કે: તને સારી રીતે જાણ છે કે અલ્લાહે આ કાર્ય માટે, એક માગ ' નિરધારિત કરી રાખ્યો છે અને આદેશ આખ્યો છે કે રોજની તલાશ વાસ્તો બહાર નિકળી જાવ અને તકલીફ ઉઠાવો. આની ઉપરવટ જઈ, તું ઈચ્છે છે કે હુઅાના બળ વડે, તારી રોઝીને તું તારા ઘરે બોલાવી લે!

જનાબે મરીયમ અઠ મે, જે વખતે, હું ઈસા અઠને એક ઝાડના નીચે જન્મ આપ્યો અને તે પવિત્ર બીબીને ભૂખ લાગી તો બધી વસ્તુઓપર કુદરત રાખનાર ખુદાએ તેમને આસમાનથી ડાયરેક્ટ રોજી મોકલવાના બદલે અથવા જીબ્રિલ માઝરફત તે ઝાડને ડગમગાવી ફળ પૈદા કરવાને બદલે, ૪૦ મરીયમને ફરમાવ્યું કે તે સુકા ઝાડને પોતાના હાથોથી હલાવે. માઝસુમા મરીયમ અઠમે એજ પ્રમાણે કર્યું તો ઝાડમાં તાજગી આવી, ડાળીઓમાં પાંદડા ફૂટ્યા અને ખજુરો

નીકળી, જે તેમનો ખોરાક બન્યો અને પાણી માટે અલ્લાહે તેમના ચરણમાં એક ચશમો પૈદા કર્યો.
(સુરએ મરીયમ, આયત: ૨૪/૨૫).

હુઅા ઈન્સાનને કાયર અને બેપરવા બનાવવાની વીરુધ, તેને આશાવંત કરી અલ્લાહની રહેમતથી નિરાશ ન થઈ જવાથી રોકે છે. ખુદાએ કાદીરના સહારા હેઠળ જીવવાળા ઈન્સાનની અંદર હમેશાં હીમત રહે છે કે જ્યાં મારી ઝીંગળીની ગાડી અટકશે ત્યાં બધી દુનીયાઓનો પાલણહાર તેને ગતી આપશે. તે સમયે, ન તેને કોઈ દુશમજનનો ડર હોય છે, ન કોઈ આફ્ટ કે મુસીબતનો! તે દરેક તકલીફેને હસ્તે ચહેરે ઝીલી લીએ છે.

હુઅા બેશક એક કુષ્યત, એક શક્તિ છે, પરંતુ કામીયાબી મેળવવા અને કોશીશો કરવાથી રોકૃતી નથી, કારણકે હુઅા માંગવાની તવફીક મળવી પણ, અલ્લાહની અમૂલ્ય અને અગણીત બક્ષિશોનું ફળ છે.

હુઅા જરૂર એક દવા છે, પણ બીમારીમાં ડોક્ટરની દવાથી મોહું ફેરવવાનું કહેતી નથી, કારણકે ખુદ અલ્લાહેજ દવાની અંદર અસર રાખી છે.

નસીહતરૂપે કીતાબોમાં એક વાકેઓ મળે છે કે: એક દિવસ, હું મુસા પયગમ્ભરને દાંતનો દુખાવો થયો. તેમને ખુદા પાસે દુઅા કરી તો અલ્લાહ તરફથી જવાબ મળ્યો કે: હે મુસા! તમે ફ્લાણા ઝડના પાંદડા ચાવશો તો તમારો દર્દ ચાલ્યો જશે. જો કલીમુલ્લાહે તેજ પ્રમાણે કયું અને દર્દ નીકળી ગયો. અમુક વખત પછી, જ્યારે ફરી દાંતનો દુખાવો થયો ત્યારે અલ્લાહના નબીએ તરત તે ઝડ તરફ દોડ્યા કે જ્યાં તેમને શફા મળી હતી. પરંતુ, આ સમયે તેમનો દુખાવો બીલકુલ દૂર થયો નહીં. તવરેત કિતાબના માલિક અને ઓલુલ અજમ રસુલ, હું મુસા અઠ અજબ થઈ તરત પોતાના હાથ ફરિયાદ માટે અલ્લાહના દરબારમાં ઉઠાવ્યા. રબ્બુલ આલમીન તરફથી આવાજ આવ્યો કે: હે મુસા! પહેલે તું મારા ઉપર ઈમાન રાખ્યો હતો અને હવે તું ડાયરેક્ટ ઝડ ઉપર ભરોસો રાખી તે ભાણી દોડ્યો.

ઔના જેવો એક બીજો બનાવ પણ મેઅરાજુસસાદાહ (અલ્લામા હાજી નાજી મર્હુમ સાહેબની કિતાબ)માં વાંચવા મળે છે: જો મુસા એક વાર બીમાર પડ્યા. એમની મુલાકાત માટે આવનાર બની ઈસરાઈલના કેટલાંક લોકો આપની બીમારી સમજી ગયા અને તે દુર કરવાની દવા ચીધી. હું મુસા અઠમે જવાબ આપ્યો કે હું તે દવાનું સેવન કરવા માંગતો નથી. ખુદા પોતેજ મારી આ માંદગી દુર કરી આપશે. પછી બીમારી લંબાણી એટલે આપને અલ્લાહ તરફથી વહી થઈ કે: અય મુસા! હું મારી ઈજાત અને જવાલની કસમ ખાઈને કહું છું કે તમે જ્યાં સુધી બની ઈસરાઈલના લોકોએ ચીધેલી દવા નહીં ખાઓ ત્યાં સુધી હું તમારી બીમારી દુર નહીં કરું.

આ હુકમ થવાથી આપે બની ઈસરાઈલના લોકોને બોલાવ્યા અને એમણે ચીધેલી દવા લાવી આપવા માટે કહ્યું. દવા આવી, આપે તેનું સેવન કયું અને થોડાજ વખતમાં આપની માંદગી ચાલી ગઈ. તેપછી ખુદાએ તાલુકાએ આપનાપર વહી મોકલી કે: અય મુસા! તમે મારી મુકર્રર કરેલી દવાનું સેવન નહીં કરતાં મારા તવક્કલથી શિશ્ય ચાહી, તે મને પસંદ પડ્યું નહીં. તમે જાણી લો કે દવામાં તાસીર મુકનાર પણ હુંજ છું.

હુઅા કબૂલ થવાની શરતોમાંથી એક શરત તે પણ છે કે હુઅા અમલ અને પ્રયત્નોની સાથે હોય. મોઅમીનોના અમીર અને મુત્તકીયોના ઈમામ, હું અલી અઠ ના ટૂકડા બોધવચનોમાં છે કે: અમલ વગર હુઅા કરનાર, કમાન વિના તીર ચલાવનાર જેવો છે.

તીરને, ફેંકનારના લક્ષ્ય તરફ લઈ જવાનું, ધનુષ્ય (કમાન) એક સાધન છે. એવીજ રીતે, દુઓને અસરકારક બનાવવા, અમલની મહત્વતા સ્પષ્ટ છે.

દુઅા માંગનારના કેટલા પ્રકારો છે ?

દુઅા માટે હાથ ઉચા કરનાર સૌ પ્રથમ તો જરૂરતમંદ લોકો હોય છે કે જેઓ મુશકીલમાં ફ્સાઈ ગયા હોય, આફ્તમાંથી છુટવા ચાહતા હોય, કરજના બોજથી મુક્ત થવાની ઉમેદ રાખતા હોય, રોજીમાં બરકત અને બીમારીમાં શફા ઈચ્છતા હોય, જ્યારે પોતાથી બનતા પ્રયાસો કરવાથી નિરાશ થઈ ચુક્યા હોય, જેવી રીતે દરીયાના પાણીમાં એક હુબતો ઈન્સાન જે પોતાની જીદગીથી હાથ ધોઈ, આસમાન તરફ નજર ફેંકી અલ્લાહને પોકારે છે, તેવીજ હાલત તે માણસની બને છે કે જેને આ દુનીયાની મુસીબતોએ કયદ કરી લીધો હોય.

દુઅા માંગનારનો બીજો વર્ગ દીનદાર લોકોનો હોય છે કે જો હું માઅસુમીન અઠમુંઠની હદ્દીસો અને આલિમોના કથનને અનુસરી દુઅા માટે પ્રેરાઈ છે.

અને શ્રીજો તે લોકોનો હોય છે કે જેઓ અલ્લાહની નજીદીકી પ્રાપ્તકરવા દુઅાનું રટણ કરે છે.

જેઓ દુઅાના ગુઢ અર્થ સમજી શકે છે તો ઓ દુઅાનો અનેરો આનંદ માણે છે કારણકે પોતાના પાલણહાર સાથે ઉદ્દેશ કરવામાં, ન તેને ફક્ત સંતોષ મળે છે બલકે દુઅા પડનારને તેના તરફથી જવાબ મળવાનો આભાસ પણ થાય છે.

અલ્લાહની મોહબ્બત તેમના બંદાઓના દિલમાં એક સરખી નથી હોતી: કોઈની અંદર બહુજ કમજોર તો બીજાઓમાં એવી મજબૂત કે બીજી કોઈ મોહબ્બતને જગ્યા આપતી નથી. અને એવા પણ ફરમાંબરદાર બંદાઓ હોય છે કે જેમના અંતકરણમાં તે મોહબ્બત એવી સજ્જડ હોય કે લાંબી લાંબી ઈબાદતો અને દુઅાઓમાં પસાર કરેલી કલાકો તેમની તરસને છીપાવતી નથી.

એક નાના બાળકને, પોતાની દુનીયામાં, કોઈ સહારો અથવા આશરો મળતો નથી સિવાય કે માં ના ઘાર, મોહબ્બત અને હેતભર્યા ખોળાની અંદર. જ્યારે પણ તેને કોઈ ગભરાટ, દુખ કે તકલીફ જણાઈ છે ત્યારે તે તરત માં તરફ દોડે છે અને તેને પુરા અવાજથી પોકારે છે. ભલે તેની નાફરમાનીના કારણે તેની માં તેને સજી અથવા ઠપકો આપે તો પણ તેનો અંતીમ સહારો અને આશરો તેની માંજ હોય છે, ભલેને તે તકલીફ, કોઈ વખત, બહારથી, બીજા તરફથી ડેમ ન આવી હોય!

એજ પ્ર માણે, ઈન્સાનનો છેવટનો આધાર અલ્લાહની અપાર રહેમતની ઈમણયા હેઠળ રહેલો છે. જેવી રીતે દુનીયાની તરેહ તરેહની તકલીફો ના સમયે, તે ફક્ત અલ્લાહનેજ પોકારે છે, એવીજ રીતે આસમાની સજી અને મુસીબતોના મૌકાપર, દુઅાના સહારે, તે પોતાના માલિક પાસેજ ફરીયાદ અને યાચના કરે છે. ખુદાના આવા નેક અને મુતાકી બંદાઓના દિલ હમેશાં અલ્લાહની મોહબ્બતભરી આશાથી છલકાએલાં હોય છે.

એવું બીલકુલ અશક્ય છે, બલકે બનવાજોગ નથી કે અલ્લાહ તેમના મજફુર ફરમાંબરદાર બંદાઓને નિરાશ કરે, જ્યારે કે તેણેજ તેની રહેમત અને મહેરબાનીનો પાઠ આપી તેનો સહારો લેવા ભલામણ કરી હોય! પરવરદિગારની રહેમત એવી છે કે: ન તે આપવાથી તેમાં ઘટાડો થાય છે અને ન તે રોકવાથી તેમાં કોઈ વધારો થાય છે.

હદ્દીસમાં છે કે: જે વ્યક્તિને ખુદા દોસ્ત રાખે છે તેને કોઈ વખત એવી બાબતમાં ફ્સાવે છે કે તે અલ્લાહ પાસે આહોગારી કરે અને પોતે સાંભળે. દાખલા રૂપે, કોઈની પાસે તેનો ઘારો બાળક

કોઈ ચીજ માંગે ત્યારે એ તેની માંગણીને ઝટ પુરી કરી દેવાના બદલે તેને જરા કાકલુદી કરાવે છે. એમ કરવું ફક્ત તેની મોહબ્બતમાં હોય છે અને આમાં તેને આનંદ મળે છે.

દુઃખાની શી હકીકત છે ?

અલ્લાહ રહમાન છે અને તેની રહેમત દરેક તેની પૈદા કરેલી વસ્તુપર પથરાય છે: વનસ્પતી, જાનવર, ઈન્સાન, પછી તે ખુદાનો ઈન્કાર કરનાર કેમ ન હોય. એક બાજુ રખ્ખુલ આલમીન તરફથી ઉપરથી આવતો રહેમતનો વરસાદ છે અને બીજી બાજુ દુનીયાની સપાઠીપરથી નીચેથી ઊછળતી બંદાની પોકાર છે: આ છે ઈન્સાનનો તેના માઅબુદ્ધ સાથેનો વહેવાર.

પડદો બે પ્રકારનો છે: એક અંધકારનો અને બીજો પ્રકાશનો. ઈન્સાન પોતાની જોવાની શક્તિ બે જગ્યાએ ગુમાવી દીએ છે: એક ગાઢ અંધકારની સામે અને બીજી તેજસ્વી પ્રકાશની સામે. સૂર્ય ને પોતાની નરી આંઘ્યોથી કોણ જોઈ શકે છે? એટલા માટે નહી કે દરમીયાનમાં કોઈ નણતર છે, પરંતુ તેનો પ્રકાશ એવો તેજ છે કે નજર ત્યાં પહોંચવા ઈન્કાર કરી આપે છે: તે છે રોશનીનો પડદો.

ઈન્સાનનો તેના પાલણહાર સાથેના વહેવારમાં, આ દુનીયાની મોહબ્બત અને લાલચ, પોતાના બુરા કર્તવ્યો અને ગુનાહકારી, તેના માટે અંધકારનો પડદો બને છે.

તેની વીરુધ્ઘમાં, આ પ્રકાશનો પડદો કે જેને ચીડી શકાતો નથી અને જ્યાં સુધી પહોંચવું અશક્ય છે, તે અલ્લાહના નેક અને પરહેજગાર બંદાઓના દિલમાં તેના માઅબુદ્ધની મોહબ્બત અને કુરબત-નજીકીની તરસ છીપાવે છે.

આવા બંદાઓની દુઃખાને અલ્લાહ એવી રીતે સાંભળી રહ્યો હોય છે કે જાણે તેમની અને તેમના માલિક વચ્ચે કોઈ ફાસલો નથી, દરમીયાનમાં કોઈ એવો દરવાજો નથી કે જે બંધ થઈ જાય.

અલ્લાહ, બંદા અને તેના દિલના, વચ્ચે છે અને બંદો, જ્યારે પોતાના મનમાં આ ખ્યાલ લાવી ડર ઉત્પન કરે છે, ત્યારે નાફરમાની કરવાથી કાંપે છે, ગુનાહો ન કરવાનો વાયદો કરે છે, ગુજરેલા ગુનાહોનો પસ્તાવો જાહેર કરે છે, તેના તમામ વખાણ કરે છે, આજીજ અને કાકલુદી સાથે, જરા પણ થાક્યા વિના અને ટાઈમનો ખ્યાલ કર્યા વગર, પોતાની સંભળી હાજતો તેના સમક્ષ પેશ કરે છે.

બેશક, જે માણસથી આપણાને ગાઢ દોસ્તી અને મોહબ્બત હોય, તેની સાથે વાતો કરવાથી, ન ટાઈમનો ખ્યાલ રહે છે, ન કંટાળો ઉપજે છે, ન થાડ. ત્યારે શું કહેવું જે વખતે અલ્લાહ પોતે આપણી બીલકુલ નજીક હોય, આપણાને સમજી રહ્યો હોય, જોઈ રહ્યો હોય, આપણી દુઃખાને સાંભળી રહ્યો હોય! આવું ચ્યાન, આવી શાંતિ, આવી રાહત, દુઃખ સિવાય આપણાને કયાં મળે?

વ હોવા મઅકુમ અયના માકુન્તુમ, વલ્લાહો બેમા તમદુના બસીર : અને જ્યાં પણ તમે હો, તે (અલ્લાહ) તમારી સાથેજ હોય છે; અને જે કરણી તમે કરો છો તે અલ્લાહ નિહાળે છે. (સૂરાએ હદ્દીદ, આયત: ૪)

અલ્લાહીના આમનુ વ તત્મઈન્નો કોલુબોહુમ બે જીકરીલ્લાહે, અલા બેજીકરીલ્લાહે તત્મઈન્નુલ કોલુબ : આ તે લોકો છે જેઓએ ઈમાન કબુલ કર્યું અને તેમના દિલોને અલ્લાહની

યાદથી (ઝીકરથી) શાંતિ મળતી રહે છે; યાદ રાખો કે અલ્લાહના ઝીક્થીજ (તેની યાદથીજ) દિલોને શાંતિ મળે છે. (સૂરએ અર-રાધ, આયત: ૨૮).

જેમ કુંગરનું શિખર અને તેનું તળીયું હોય છે, એજ પ્રમાણે, દુઆની ટોચ: અલ્લાહની અપાર અને અખુટ રહેમતની આશા છે અને તેનું તળીયું: ઈન્સાનની બદકારી અને ગુનાહો છે. જ્યારે માનવ પોતાના ખરાબ કામ અને ગુનાહોને જુએ છે ત્યારે બેધડક તડપી ઉઠે છે અને જે વખતે આહીસ્તે આસમાન ભાણી નજર ઉઠાવે છે તે વખતે અલ્લાહની રહેમત તેના ભયંકર ગુનાહોથી પણ બહુજ વિશાળ દેખાય છે અને ત્યારે તે તરત પોકારી ઉઠે છે કે: અય મારા રબ! મારા ગુનાહોને માફ કરી આપ, મેં પોતાએ મારા નફ્સપર ઝુલ્ભ કર્યો છે! મને તારી રહેમતોની છાયામાં લઈ લે. તારા સિવાય કોઈ કોઈને છાયો નથી આપી શકતો!

ગંધીમાંથી પાકીજગી તરફ, અંધકારમાંથી નુર તરફ અને નીચેથી ગગન તરફ જાવું, તે ઈન્સાનની અલ્લાહ તરફની સફર છે અને જ્યારે ઈન્સાન પોતાના ખુદામાં બધી ઉમેદો - આશાઓ રાખીને દુઆનું સાધન લઈને રવાનો થાય છે ત્યારે તે પ્રવાસનો, ન કોઈ છેડો હોય છે, ન તેનો કોઈ અંત! તમામ અંબીયાઓના સરદાર અને અલ્લાહના આખરી પયગમ્બર, હું રસૂલે ખુદા સ૦ મે એક દિવસ તેમના સહાબીઓને ફરમાવ્યું કે: શું તમે ચાહો છો કે હું તમને એક એવું હથિયાર બતાવું કે જે તમારા દુશમનોથી તમારું રક્ષણ કરે અને તમારી રોજ્ઞમાં પણ વધારો કરે?

યા રસૂલિલ્લાહ! અમને એવું હથિયાર જરૂર દેખાડો, અસહાબોએ જવાબ આપ્યો.

એ હથિયાર છે: પરવરદિગાર પાસે રાત અને દિવસ દુઅા માંગ્યા કરવી, અલ્લાહના નબીએ તેમને મહાન શસ્ત્ર બતાવ્યું.

પછી અલ્લાહના ઘારા રસૂલે ફરમાવ્યું કે: તમારા બીમારોનો ઈલાજ કરો સદકો આપોને અને બલાઓને દરે કરો તમારી દુઅા થકી.

હદીસ શરીફમાં છે કે: એક વેલા, હું મોહમ્મદ સ૦ મે જોયું કે અન્સારોમાંના એક અખુ અમામા મસજીદમાં નવરા બેઠા હતા. આં હજરત સ૦મે પુછ્યું : તમે હજ સુધી મસજીદમાં કેમ બેઠા છો જ્યારે આ સમય નમાજનો નથી?

અખુ અમામાએ કહ્યું: યા રસૂલુલ્લાહ સ૦! મારા માથે ચીતા અને કરજનો બોજો છે.

આં હજરત સ૦મે ફરમાવ્યું: હું તમને એક દુઅા શીખવાનું હું, જો તમે એને ઉચારતા રહેશો તો તમારી ચીતા ટળી જરો અને કરજ અદા થઈ જરો, અલ્લાહ એનો માર્ગ કરી આપશો.

એ દુઅાના શબ્દો આ છે:

હે અલ્લાહ! તું મને મુક્તિ આપ ચીતાઓમાંથી, કંજુસાઈમાંથી, આળસુપણામાંથી, કાયરતમાંથી, અને લાકોની શરણાગતિથી મને ઉગારી લે!

અખુ અમામાએ આ દુઅા ઉચારવાનું ચાલુ રાખ્યું અને એમની ચીતાઓ અને મુશકેલીઓનો અંત આવી ગયો. (મર્હુમ અલ્લામા હાજ નાજની ગુજરાતી પ્રતિ: સહીફાએ કામેલામાંથી).

ફક્ત પોતાના સ્વાર્થ અને લાભ ખાતર પોતાના મોઅમ્રીન ભાઈથી સંબંધ રાખવામાં આવે તો તે કદી ટકશે નહીં, બનાવટી કહેવાશે અને ઈન્સાનિયતની ખુશબુથી ખાલી રહેશે. એજ પ્રમાણે, અલ્લાહ સાથેના સંબંધો કદી ટુટવા ન જોઈએ. સુખના દિવસો હોય યા દુખના, મુસીબત આવે તે પહેલાં, જબાનપર દુઅા સદા જારી રહેવી જોઈએ.

દુઅા ફક્ત પોતાની હાજત પેશ કરવાનું અથવા પોતાની ઉમેદ પુરી થવાનું નામ નથી, બલકે તે ઈબાદતનો એક પ્રકાર છે, બંદગીનો એક ભાગ છે, જે ઈન્સાન કુરઆને મજૂદના હુકમ મુતાબીક અદા કરી રહ્યો છે: **وَ مَا بَلَكْتُ لَهُ إِنَّمَا لِي لِلَّهُ لَهُ الْحُكْمُ**

મેં જીનાતો અને ઈન્સાનોને નથી પયદા કર્યા સિવાય મારી ઈબાદત માટે.

(સુરાએ જારીયાત, આયત: ૫૫).

હદીસમાં છે કે: સર્વથી વધારે નબળો-તાકત વગરનો ઈન્સાન તે છે કે જે દુઅા કરવામાં કમજોર છે. દુઅાનો મકસદ હાજત કબુલ થવાનો છે. અને અગર બંદાની એકેય હાજત કબુલ થઈ નહી તો તેમાં, ન તેને કંટાળવાનું છે, ન ગુર્સો કરવાનો! જેવી રીતે મુસ્તહબ નમાઝો-રોજા છે, ખયરિયાત અને સદકા, વગેરે છે એજ મુજબ દુઅા અલ્લાહના હુકમોમાં નો એક હુકમ છે અને અલ્લાહને તે બહુજ પસંદ છે.

જ્યારે માણસની કોઈ હાજત મંજુર થતી નથી ત્યારે તે નિરાશ થઈ ફરિયાદ કરવા લાગે છે. પરંતુ, અલ્લાહે તેને કઈ કઈ બલાઓમાંથી બચાવી લીધો છે, તેનાથી તે બેખબર છે. ઘણી વખત, મુસીબતોનું હઠી જવું પોતાની ઉમેદો પુરી થવાથી બહેતર હોય છે. ઉદાહરણ રૂપે માની લેવામાં આવે કે: એક નબળી સથિતીવાળાને ખુદા ઘણી દોલતથી નવાજ તેને કોઈ ગંભીર બીમારીમાં ગીરફ્તાર કરી આપે અથવા તો સહન થઈ શકે નહી એવી બલાઓમાં મુજ્જેલા કરે. તે સમયે, આ પૈસો ન તેને બીમારીમાંથી શક્ષા આપશે, ન મુસીબતોને ખુશીમાં ફેરવી આપશે, તેને રાહત આપવાના બદલે તેને એવો બેચ્યન અને ભારે તકલીફમાં હુબાળી દેશે કે તેના માટે રાતની ઉધ હરામ થઈ જશે. માટે, દુઅાના રદ થવામાં કોઈ વખત ઈન્સાનની પોતાનીજ ભલાઈ સમાએલી હોય છે.

હો સાદીકે આલે મોહમ્મદ અઠીની જબાન મુબારક સાંભળીએ: મોઅમીન માટે તે વખત સુધી બધું સારું છે અને અલ્લાહની રહેમતપર આશા રાખી શકે છે જ્યાં સુધી કે તે બેસબ્રો કરે નહી અને નિરાશામાં પડી જઈ દુઅાને છોડી આપે નહી.

બેસબ્રોની માયના શી છે? સહાબીએ પ્રશ્ન કર્યો?

જ્યારે તે એમ રહેવા લાગે કે મેં ઘણી દુઅાઓ કરો, આ માંગ્યું અને તે માંગ્યું, પણ એકેય પુરી થઈ નહી, ઈમામે તેનો ઉત્તર આય્યો.

હાજત ભલે પુરી ન થાય, જેમાં અલ્લાહની કોઈ મસલેહત સમાએલી હશે, પણ પોતાની દુઅાના કારણે બંદો માઅબુદ્ધની રહેમતમાં ઘેરાએલો રહે છે, જે તેના માટે ફક્ત કોઈ નાની વસ્તુ નથી, બલકે ખલ્લાકે આલમની એક મોટી અને અપાર બક્ષિશ છે.

દુઅા આપણાથી કાંઈ માંગે છે

ઉદ્ડી રજ્બકુમ તજરરોઅન વ ખુફ્યતન ઈન્નાં લા યોહીબ્બુલ મોઅતદીન : પુકારો તમારા રબને (દુઅા કરો) કરગરીને અને ધીમા આવાજે, બેશક હદ્થી નીકળી જનારાઓને તે દોસ્ત રાખતો નથી.

વલા તુફસેદુ ફીલ અર્જે બાઅદા ઈસલાહેલા, વદ-ઉહો ખવ-ફ્લવ વ તમઅન, ઈન્ન

રહેમતલ્લાહે કરીબુન મેનલ મોહસેનીન : અને તેના સુધારા પછી ઝીનમાં ફસાદ બરપા ન કરો અને (દુઆ કરો) તેને પુકારો (અજાબના) ખોઝથી અને (રહેમતની)આશા રાખીને; ખરેખર, અલ્લાહની રહેમત (નેકી કરનારાઓ) એહસાન કરવવાળાઓની નજીક છે.

(સૂરતુલ અભરાફ; આયત: ૫૫ - ૫૬).

એક દીવસ, ૯૦ રસુલે અકરમ સ૦ જહાદમાં ગયા. સાથે અસહાબો પણ હતા. જંગલમાં પહોંચ્યા તો લશકરવાસીઓ મોટા આવાજથી અને કાન બહેરા કરી આપે એવી રીતે, અલ્લાહો અકબર અને લાએલાહ ઈલ્લાહિલ ની પુકાર કરવા લાગ્યા. રહેમતુન્લીલ આલમીન નો તાજ પહેરીને આવેલા અલ્લાહના તે ઘારા નબીએ ફરમાવ્યું કે: અય લોકો! જોરજોરથી ચીખવાનું બંધ કરો! શું તમે એવા ખુદાને બોલાવી રહ્યા છો કે જે બહેરો અને છુપો હોય? અરે! તમે તો એને પુકારો છો કે જે ફક્ત તમારી બધી વાત સંભળતોજ નથી બલકે તે બીલકુલ તમારી નજીદીક છે!(અનવારુલ બયાન ફી તફસીરીલ કુરાન, મર્હુમ અલ્લામા હાજી નાજી સાહેબ).

દુઆ જરૂર કરો, પણ ફક્ત જબાનથી નહીં, બલકે દિલની સાથે, કરગરીને, રડી રડીને, કાકલુદીની સાથે, આજ્ઞાપૂર્વક, અને મોટા અવાજથી નહીં, બલકે ધીમા સ્વરે, જેથી તમે રીયાકારી યાને બીજા લોકને સંભળાવવાથી અથવા દેખાડવાથી બચી જાઓ. અને એવી પણ દુઆ ન કરો કે જે તમારી શાનથી ઉચ્ચી હોય, યાને કે એવી વસ્તુ અથવા એવા હોદા માટે દુઆ કરવી કે જે મળવી અશક્ય હોય: યાને નબી અથવા ઈમામનો મરતબો, આસમાન ઉપર ઉડીને જવું, કામ કર્યા વિના આપોઆપ ઘરમાં જમવાનું આવી જવું, વગેરે...

અસલ મતલબ એવો છે કે બંદો હમેશાં અલ્લાહના ફિલો કરમનો મોહતાજ છે અને અગર અલ્લાહની સામે પોતાની હાજત પેશ કરવા જરૂર સમજતો ન હોય, તો એક તરફ પોતે બેપરવા અને ધમંડી છે અને બીજી તરફ પોતે અલ્લાહને દુઆનો લાયક સમજતો નથી. ખુદા મગરૂર ઈન્સાનને દુશમન રાખે છે.

વ મન અહસનો કવ-લમ મિમ-મન દાા એલલ્લાહે વ આમેલા સાલેહંવ વ કાલા ઈન્નની મેનલ મુસલેમીન : અને તેનાથી બેહતર કેની વાત થઈ શકે છે કે જે (લોકને) અલ્લાહની તરફ બોલાવે અને સારા સારા કામ કરે અને કહે કે હું પણ અલ્લાહના ફરમાં બરદાર બંદાઓમાંથી છું? (સૂરાએ હા-મીમ-સજીદાહ; આયત: ૩૩).

દુઆના શબ્દો અલ્લાહની નજરમાં તેજ સમયે દુઆ છે જ્યારે સાલેહ-નેક અમલથી તેનું સમર્થન થઈ રહ્યું હોય. જેવી રીતે એક માણસ પોતાના રબથી દરગુજર, માફી અને રહેમતનો ચાહક છે એજ પ્રમાણે તેને ઘટે છે કે અન્ય માનવોની સાથે પણ તે દરગુજર, માફી અને રહેમતને ગ્રહણ કરે, જે સાચા અર્થમાં જગતનો સુધારો છે. પરંતુ જ્યારે એવું થાય કે માણસ પોતાના માટે તો અલ્લાહ તરફથી મહેરબાનીનો ઉમીદવાર હોય, છતાં કે તે પોતાના પાડોશીઓ સાથે તો સરકશી અને બેપરવાહીની રીત અપનાવે તો એવા વર્તાણુકનું બીજું નામ છે: ઝીનપર ફસાદ ફેલાવવો. આમ કરતાં, બંદો પોતાની દુઆને અલ્લાહની નજરમાં નિર્થક બનાવી આપે છે.

મનુષ્યને પોતાના નેક ગુણોનો પુરાવો, સમાજની અંદર, માનવ સંબંધોમાં, આપવાનો છે કે તે પોતાની દુઆમાં સાચો છે યા નહીં. જે માણસ પોતાના દુન્યવી વહેવારની અંદર પોતાની દુઆઈ હેસિયતને ભુલી જાય, તો તેની મીસાલ એવા માણસની છે જેણે જભથી મોટા મોટા દાવા કર્યા,

પરંતુ જ્યારે તેની પરીક્ષા લેવામાં આવી તો તે નિષ્ફળ નીવયો, શુન્યથી - મીંડાથી કંઈ વધુ નથી.

આપણને અલ્લાહના અજાબનો ડર છે અને તેની પકડથી બચવા માટે તેનાથી કાકલુદી કરી રહ્યા છીએ તો એવી હાલતમાં જરૂરી છે કે જ્યારે કોઈ માણસ આપણી પકડમાં આવી જાય, તો તે વખતે આપણે પણ તેનાથી ગુસ્સો ન કરીએ અને બદલો લેવાથી હાથને રોકી લઈએ. આવા સમયે, આપણને અલ્લાહના મુકાબલામાં, આપણી પોતાની આજજી-કાલાવાલાભરી હેસ્થિયત યાદ આવી જવી જોઈએ.

એક વખત અલ્લાહો અકબર કહીને જ્યારે આપણે અલ્લાહની મોટાઈનો ઈકરાર કરી ચુક્યા હોઈએ ત્યારે આપણી કરતાં નબળી સ્થીતીવાળા, મોહતાજો, કમજોરો, જરૂરતમંદોની સમક્ષ આપણી મોટાઈનો ડંકો બજાવવાના બદલે, અલ્લાહની સામે આપણી પોતાની કાકલુદીભરી હાલતનો મનમાં ખ્યાલ લાવવો જરૂરી છે. એક માનવ પર તાકત પામીને આપણે તેનાપર પોતાની મોટાઈનું પ્રદર્શન કરી શકીએ છીએ, પણ એમ ન કરતાં, તે સમયે, અલ્લાહના મુકાબલામાં પોતાની તુચ્છ હેસ્થિયતને યાદ કરી, પોતાના રબને એમ કહીને તે માણસને છોડી આપીએ કે: ખુદાયા! મેં તેને માફ કરી આય્યો, તું પણ તેને તારી માઝી બક્ષી આપ.

જ્યારે બંદાના મનના તરંગો પોતાના રબથી એ પ્રમાણે સંકલિત થઈ જાય કે માત્ર તે અલ્લાહથીજ ડરે અને તેનાથીજ આશા રાખે ત્યારે હર પળે, દુઆના આધારે, તે તેનાથી વાતોમાં લીન રહે છે. દુઅા, દિલનું વ્યાકુળ સ્વરૂપનું બહાર નીકળવાનું, એક નામ છે.

અલ્લાહ પાસે કેવી રીતે દુઅા માંગવી ?

કોઈ વ્યક્તિ કોઈને કંઈ આપે છે તો તેમાંથીજ દીએ છે કે જે અલ્લાહે તેને આપેલ છે. કોઈના માટે અગર દોડભાગ કરે છે તો તે એજ શક્તિ અને બળથી કે જે અલ્લાહે તેને અપી છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે બીજાઓના હાથોથી મળે છે તે હકીકતમાં ખુદાએજ આપેલ હોય છે, જે કાર્યો બીજા થકી પૂર્ણ થાય છે તે ખરું જોતાં અલ્લાહના લીધેજ હોય છે. ઈન્સાન તો કંગાલ-મોહતાજ છે. જે પોતેજ જરૂરતમંદ હોય તે બીજાઓની હાજરત શું પુરી કરવાનો!

ખુદાની મહેર અને બક્ષીશ તથા બીજાઓનું આપવું, તેમાં જમીન-આસમાનનો ફર્ક રાખે છે. આમ ઈન્સાનનું અર્પણ કરવું બદલાની આશા રાખે છે અને કોઈ પણ મૌકે તે જરૂર આ ભેટની યાદ અપાવી બડાઈ હંકરો. પરંતુ ખુદાવંદે કરીમ પોતાના ફજલો કરમથી જ્યારે નેઅમતોથી પોતાના બંદાને માલામાલ કરી દીએ છે તો તે વખતે, ન તે કોઈ બદલાની આશા રાખે છે, ન એહસાનની યાદ અપાવે છે. આભાર એ મનાવે છે જે પોતે આપવાને કંઈ મોટી ચીજ સમજતો હોય, મામુલી બક્ષીશને મહત્વતા આપતો હોય.

ખુદાવંદે આલમ જોઈએ એટલી નેઅમતો આપે, ગમે તેટલા એહસાન કરે, તેની પોતાની અખુટ રહેમતની સામે કંઈ વિસાત રાખતી નથી. જ્યાં બેહિસાબ અતાઓ હોય ત્યાં કોઈ કંજુસાઈ હોયજ નહીં.

આ વાત નિર્વિવાદ છે કે ઈન્સાન પોતાના મનમાં ઘણી વખત અશક્ત છે. જ્યારે તેની બધી કોશીશો એળે જાય, બધી યુક્તિઓ નિષ્ફળ નીવળે, ત્યારે જ્યાં ત્યાં ઓથ અને વસીલાઓ ગોતતો

ફરે છે કે જેથી પોતાના કાર્યમાં તેને સફળતા પ્રાપ્ત થાય. જગતમાં એક ઈન્સાનનો બીજા ઈન્સાનપર આધાર રહેલો છે, એક બીજા થકી કામ પુર્ણ થાય છે. એમાં કોઈ બુરાઈ નથી. ઈન્સાન એક સામાજિક પ્રાણી છે. તેની પાસે બધા ઈલ્ભો નથી, તેની પાસે બધી તાકતો નથી, તેની પાસે બધી સગવળો નથી. પરંતુ શર્ત એ છે કે જે ખરેખરો કારસાઝ અને માલિક છે, તેને કોઈ પણ કાળે ભુલી ન જતાં, ગમે તેવા કપરા સંજોગોમાં તેની તરફ રજુ થવું જોઈએ. આ છે ઈન્સાનની બુલંદી, આ છે અલ્લાહપર તેનો ભરોસો. ઈન્સાનની કોઈ હાજત પુરી કરનાર નથી સિવાય કે જે બેપરવા અને સ્વતંત્ર - અલ્લાહુર્સમદ છે.

જ્યારે આદમ-પુત્રમાં આવા મક્કમ-કઢ વિચારો મજબુત થઈ જશે ત્યારે ગફલતના બધા પરદા ફાટી જશે, દિલમાં શાંતિ અને મનમાં ચયન ઉત્પન થશે, ડગમગતા પગો સ્થાયી બનશે, દુનિયાની કોઈ પણ જેરીલી હવા તેના મોઢાને અલ્લાહથી ફેરવશે નહીં અને દુઆ, યાચના, પુકાર ફક્ત તેનીજ બારગાહ માટે રહી જશે.

જ્યારે એ માઅબુદ્ધ જોશે કે મારો બંદો બધા દરવાજાને ઠોકર દઈ, મારી તરફ મીટ માંડી રહ્યો છે ત્યારે તે પોતાની દ્વારા ભાવનાથી તેના સર્વે કામો સરળ કરી આપશે. જો કે ખુદા દરેક માણસના દિલની બધી વાતોને જાણે છે, પણ તે ઈચ્છે છે કે તેની સમક્ષ તેનો બંદો પોતાના તમામ અરમાનો, આરજુઓ, આશાઓ, ઉમ્મીદો, હાજતો વ્યક્ત કરે.

આપણા છઠા ઈમામ, અબુ અબ્ડીલ્હાહ, હો જાઅફરે સાદીક અઠ ફરમાવે છે કે: પરવરદિગાર સારી રીતે સમજે છે કે જ્યારે બંદો દુઆ કરે છે તો તે પોતાના પાલણહારથી શું ચાહે છે. પરંતુ, અલ્લાહ એ વાતને પસંદ કરે છે કે તે પોતાની હાજત, ખુલ્લા દિલ, સાફ મનથી, કોઈ પણ અડચણ વગર, તેની સામે એક પછી એક રજુ કરે.

દુઆ માંગવા પછી ઈમામ જે શબ્દો સજદામાં કહેતા હતા તે ઉચારવામાં આવે કારણકે જે દુઆ સજદામાં કરવામાં આવે છે તે અલ્લાહના દરબારમાં જલદી કખુલ થવાને લાયક બને છે. જેમકે છઠા ઈમામ અઠનીજ હદીસ છે કે: બંદો ખુદાની બારગાહમાં એ વખતે વધારે નજદીક થઈ જાય છે જ્યારે સજદાની હાલતમાં પોતાની દુઆ માટે અલ્લાહને પુકારે છે.

એક બીજી હદીસમાં એજ ઈમામ ફરમાવે છે કે: જ્યારે દુઆ કરો ત્યારે એમ માની લો કે તમારી હાજત પુરી થઈ ગઈ છે અને તે તમારા દરવાજા આગળજ ઉત્તી છે અને હમણાજ તમારા ઘરની અંદર દાખલ થશે.

હદીસમાં એમ પણ આવ્યું છે કે: સુખ અને રાહતના વખતમાં પણ અલ્લાહના દરબારમાં દુઆ કરતાંજ રહેવું, એવું નહીં કે મુસીબત પડે ત્યારેજ ખુદાને પુકારવું.

વ એજા મર્સલ ઈન્સાના જુરરન દાઓ રજબહુ મોનીબન એલયહે સુભ્રા એજા ખવ્યલહુ નેઅમતંમ મિનહો નસેયા માકાના યદઉ એલયહે મિન કખલો.....: અને મનુષ્યપર જ્યારે કોઈ આફત આવી પડે છે ત્યારે પોતાના પાલણહાર તરફ રજુ થઈ દુઆ માંગવા લાગે છે, પછી જ્યારે તે પોતાના તરફથી કોઈ નેઅમત તેને અર્પણ કરે છે ત્યારે જે બાબત માટે તે પ્રથમ તેની પાસે દુઆ માંગતો હતો તેને વીસરી જાય છે.....

(સૂરએ જોમર; આયત: ૮).

દુનિયામાં દરરોજનો આપણો અનુભવ હશે કે માંગનારાઓ માંગવા માટે કેવી કેવી તરકીબો રજુ કરે છે. ઘણા માંગવાવાળાઓ એવા હોય છે કે જેમને જોઈનેજ આપણને કંટાળો ઉપજે, જ્યારે કે

ઘણાના માંગવામાં આપણને રસ પડે. આ તો થઈ માનવી માનવી વચ્ચેની વાત જ્યારે કે ખુદા અને બંદા વચ્ચેની વાત તો જુદીજ છે.

આ માટે, દુઓની સરસ અને સભ્ય રીતો હજરત માઅસુમીન અઠમુંઠમે બતાવેલી દુઓ છે, કે જેના વાંચવાથી આપણને ખાત્રી થાય કે માઅસુમોએ આપણને ખુદાથી કેમ માંગવું, એજ નથી બતાવું, બલકે સાથમાં ખુદાનો પરિચય સમજાવ્યો છે અને તેની બેહીસાબ નેઅમતો તરફ પણ આપણું ધ્યાન દોયું છે.

આ સંબંધમાં, દુઓની શરૂઆત કેમ કરવી, તે માટે આપણે હલાલે મુશકેલાત, અમીરુલ મોઅમેનીન, અલી ઈજને અભી તાલીબને સાંભળીએ. ઈમામ ફરમાવે છે કે: હજત પેશ કરવા અગાઉ, સઉ પ્રથમ અલ્લાહના વખાણ કરવા અને તેમના નબી સઠ ઉપર દુરુદ મોકલવું જોઈએ.

એજ પ્રમાણે, ઈમામ સાદિક અઠથી પણ નકલ કરવામાં આવે છે: જ્યારે તમારામાંથી કોઈ પોતાના પાલણાહાર પાસે દુનિયા અથવા આખેરતની કોઈ હજત માંગવા ચાહે તો સઉ પ્રથમ અલ્લાહના વખાણ કરે અને હું મોહમ્મદો આલે મોહમ્મદ સઠ ઉપર દુરુદ મોકલે, તે બાદ પોતાના ગુનાહોની માઝી મેળવવા રોઈને કાકલુદી કરે અને આખીરમાં પોતાની દુઓ માંગે.

જેવી રીતે, જ્યારે તમે કોઈ પાસે મદદ માંગવા તેમને મળવા જાઓ ત્યારે તમે જરૂર તેમને પહેલાં સલામ કરસો અને બે સારા શબ્દો ઉચારસો, તે પછી તમે તમારી અરજી પેશ કરસો. અહીં સવાલ ઉત્પન થઈ શકે છે કે ખુદા વખાણનો મોહતાજ નથી, તે બેપરવા છે જ્યારે કે ઈન્સાન વખાણનો ભુખ્યો છે. અલ્લાહની સરખામણી ઈન્સાન સાથે કેમ થઈ શકે?

આનો શરૂઆતમાં ખુલાસો અપાઈ ચુક્યો છે, છતાં વધુમાં જવાબ એમ છે કે: અલ્લાહ બીલકુલ પાક છે અને દરેક મખલુક કરતાં તે વખાણ અને શુદ્ધ ને વધુ લાયક છે, પણ તેનો મોહતાજ નથી. ઈન્સાનને પોતાના માલિક પ્રત્યેની ઈબાદતનો હક કેવી રીતે અદા કરવો તે શરીરાત તેને શીખવે છે. આવું કરવું તે નેક અખલાક-સારા ચારિત્ર, સભ્યતા અને અદબની નિશાની છે. અલ્લાહની પ્રશંસાનો ઈનકાર કરવાથી શું ઈન્સાન પોતાને નગુણો નહીં સમજે? શું અલ્લાહના વખાણનો વિરોધ કરવા પછી પણ ઈન્સાન એમ સમજશે કે તેણે પોતાનો મજહબી હક બલકે ઈન્સાનિયતનો હક બરાબર અદા કર્યો છે?

અલ્લાહ જેમ ઈન્સાનનો સર્જનહાર છે તેમ સારા અખલાકનો પણ સર્જનહાર છે. હું પચ્ચગમબરે ઈસલામ સઠ હમેશાં ફરમાવતા હતા કે: મને એટલા માટે રસુલ બનાવીને મોકલવામાં આવ્યો છે કે અખલાકને તેની બુલંદી ઉપર પહોંચાડી આપું.

ન અલ્લાહની પુરેપુરી ઈબાદત થઈ શકે છે, ન તેની પુરેપુરી માઅરેફત-ઓળખાણ હાંસીલ થઈ શકે છે, ન તેના પુરેપુરા વખાણ અદા થઈ શકે છે. ઈન્સાન જેટલા ખુદાના વખાણ કરતો રહેશે એટલો જ તેનો ઘમંડ, તેનો અહંકાર, તેનો હુંપદ ટુટતો જશે.

એજ પ્રમાણે, હું મોહમ્મદો આલે મોહમ્મદ સઠ ઉપર દુરુદ મોકલવું, તે આપણી ફરજોમાંની એક ફરજ છે, જેના માટે કુરાને શરીરફમાં, સુરાએ અહાબની પદ મી આયતમાં અલ્લાહનો ઈરશાદ થઈ રહ્યો છે: ઈન્નાલ્લાહ વ મલાએકતહુ યોસલુના અલન્નબી યા અથ્યોહલ્લાહીના આમનુ સલ્લુ અલયહે વ સલ્લેમુ તસલીમા : તેમાં શક નથી કે ખરેખર અલ્લાહ અને તેના મલાએકા નબી ઉપર દુરુદ મોકલે છે તો અય લોકો કે જે ઈમાન લાવ્યા છો તમે પણ તેમની ઉપર દુરુદ મોકલતા રહો અને બરાબર સલામ કરતા રહો જેવી રીતે સલામ કરવાનો હક છે.

આ માઅસુમ હસ્તિઓ છે, અલ્લાહના ખાસ ઘાર બંદાઓ છે, જેમની મોહબ્બતમાં અલ્લાહે આ કાએનાત પયદા કયું છે તો તેમના ઉપર સલવાત મોકલી, આપણે તેમને ખુદા સમક્ષ વસીલો બનાવીએ છીએ, જે તેમના પ્રત્યે હક અને મોહબ્બત અદા કરવાનું એક કારણ છે અને નેક અખ્લાક- સારા ચારિત્રનો એક ભાગ છે. આપણે પોતાને ભાગ્યવાન સમજવું જોઈએ કે આવી માનવંત અને પાકીજા શખ્શીયત આપણી હાજતોની અલ્લાહ પાસે વડીલ બને!

હદીસમાં છે કે: એક જાડ છે, તેના મુળ હું રસૂલ સર્ઠ છે, તેની ડાળીઓ એહેલેબયતે તાહેરીન અઠમુંઠ છે અને તેના પાંદડાઓ તેમના મોહીબો છે. દરેક કોઈ સમજી શકે એવી વાત છે કે અગર કોઈ પાંદડાઓને તાજા રાખવા ચાહે તો તે કદ્દી પત્તાઓ ઉપર પાણી નહીં નાંખે કારણે તેમ કરવાથી લોકો તેને બેવકૂફ-મૂખ' સમજશે. જો પાંદડાઓને લીલા અને તાજા રાખવા હોય તો મુળમાં પાણી સીચવું પડશે. એવીજ રીતે સલવાત પડવામાં આપણા પોતાનાજ ફાયદાઓ સમાએલાં છે. આપણી કઈ તાકત છે કે જેને અલ્લાહે બધી દુનિયાઓ માટે રહેમત બનાવીને મોકલ્યા હોય તેમના હકમાં આપણે રહેમતની દુઆ કરીએ! દુર્દાના આપણા તરફથી આપણા વાસ્તેજ એક દુઆ છે, આપણી દુઆની અંદર એક અનોખી દુઆ!

એક ઘાલું પાણીથી બીલકુલ છલોછલ ભરપૂર છે. એક ટીપા માટે તેમાં જગ્યા નથી. જો તેમાં પાણી રેડવામાં આવ્યું તો તે છલકાઈને બહાર વહી જશે. જે ઠામ તે ઘાલાના નિયે હશે તેને આ પાણી મળતું રહેશે. હું માઅસુમીન અઠમુંઠ જેવી રહેમતથી ભરપૂર શખ્શીયત ઉપર જ્યારે સલવાત મોકલવામાં આવે ત્યારે ઠામ રૂપી તેમના મોહીબો ઉપરજ આ રહેમત વરસે છે.

ઉપરાંતમાં, જે લોકો અમૃ બીલ માઅરુફ અને નહીં અનીલ મુનકર (સારા કામની ભલામણ અને ખરાબ કામની રોકથામ) તજી દે છે તે વખતે દુઆ કબૂલ થવાથી રોકાઈ જાય છે.

જેમકે ઈસલામના પયગમ્બર સર્ઠ ફરમાવે છે: અમૃ બીલ માઅરુફ અને નહીં અનીલ મુનકર જરૂર કરો. નહીંતર અલ્લાહ તમારા ખરાબ માણસોને તમારાપર સવાર કરી દેશે. પછી તમારા સારા લોકો દુઆ કરશે તો તેઓની દુઆ કબૂલ નહીં થાય.

આપણા પાંચમા ઈમામ, હું મોહમ્મદે બાકીર અઠથી મનકુલ છે કે: ખુદાવંદે આલમે જી શોઅયબ પયગમ્બરને વહી મોકલી કે તમારી કોમમાંથી હું એક લાખ માણસો ઉપર અજાબ કરીશ કે જેમાં ચાલીસ હજાર બદકાર હશે અને ચાઠ હજાર નેક લોકો હશે. અલ્લાહના નબીએ પરવરાદિગાર પાસે અરજ કરી કે: માલિક! નેક લોકો ઉપર કયા કારણે તારો કોય ઉત્તરશે?

જવાબ મળ્યો કે: એ કારણે કે તેઓ ખરાબ લોકોની સાથે હળીમળીને રહે છે, તેમના પ્રત્યે નરમ વલણ રાખે છે અને મારા ગુસ્સાના ખાતર ગુસ્સે થતા નથી. (મેઅરાજુસ્સાદહ અનુવાદક: અલ્લામા મર્હુમ ગુલામેખલી હાજ નાજ સાહેબ અઠમો).

હું ઈશ્વરાહીમ ખલીલુલ્લાહ અઠની દુઆ: સૂરએ અલ બકરહ, આ: ૧૨૭/૧૨૮/૧૨૯):

રજ્બના તકબ્બલ મિના, ઈન્નકા અન્તસ્સમીઉલ અલીમ: અય અમારા રબ! અમારી (આ સેવાને) સ્વીકારી લે, ખરેખર તુંજ (દુઆનો) સાંભળનાર (અને નિયતનો) જાણનાર છે.

રજ્બના વજઅલના મુસલેમયનેલક વમીન ઝુરરીથ્યતેના ઉભતન મુસલેમતલ્લક વ અરેના મનાસેકના વતુબ અલયના ઈન્નકા અન્તાત્પ્યાબુરરહીમ: અય અમારા રબ! તું અમને તારા તાબેદાર બંદા બનાવ અને અમારા વંશમાંથી પણ એક એવા સમુહને પયદા કર કે જે તારા

તાબેદાર હોય અને અમને અમારા હજના કાનુંનો બતાવ અને અમારી તવબા કબુલ ફરમાવ, બેશક તું બહુજ તવબા કબુલ કરનાર દયાળું છે.

રજ્બના વબ્ઝસફીહીમ રસૂલમ મિનહુમ યત્થુ અલયહીમ આયાતેકા વ યોઅલ્લેમોહોમુલ કિતાબા વલ હિકમતા વ યોજકડીહીમ ઈન્કા અન્તાલ અજીજુલહકીમ: અય અમારા રબ! તે સમૃહની અંદર તેઓમાંથી એક રસૂલને મોકલ કે જે તેઓને તારી આયતો પડીને સંભળાવે અને તેમને આસમાની કિતાબની અને અક્કલમંદીની વાતો શીખવે અને તેમને (તેમના નફ્સને) પાડીજા કરે, બેશક તુંજ સંપુર્ણ કુદરત રાખનાર હિકમતવાળો છે.

હો ઈશ્વાહીમ અ૦ બ્રાહ્મ વાર જુદી જુદી દુઆઓ માંગો છે અને દર વખત રજ્બના કહીને અલ્લાહને પુકારે છે. ખુદાના નબી દુઆનો પહેલો અદબ આપણાને શીખાડે છે કે જ્યારે તમે દુઆ માંગો તો દરમીયાનમાં વારંવાર અલ્લાહને પુકારતા રહો અને જેવી દુઆ હોય તેવું અલ્લાહના નામોમાંથી એક નામ ઉપ્યોગમાં લ્યો, આ છે બીજો અદબ.

જ્યારે ખીદમતની વાત આવી ત્યારે પયગમ્બરે ખુદાએ કહ્યું કે: અય મારા પાલણહાર, તું દુઆનો સાંભળનાર અને નિયતનો જાણનાર છે, તવબા માંગતી વખતે ફરમાવ્યું કે: તું દુઆને કબુલ કરનાર તેમજ દયાળું છે અને રસૂલની માંગણી કરવા સમયે પુકાર્યું કે: તું કુદરત રાખનાર અને મહાન હીકમતવાળો છે.

બીમાર હોય તો: યા શાશ્વી કહીને પુકારો, રોજ માટે : યા રેજાકો થી અવાજ આપો, અવલાદની તમના હોય તો: યા ખાલીકો થી તેને યાદ કરો; વગેરે..
(મૌલાના મર્હુમ તાલીબ જવહરીની મજલિસમાંથી)

આસમાન તરફ હાથ ઉંચા કરી દુઆ માંગવાનું શું કારણ છે ?

સયદુલ વસીયીન, હજરત અલી ઈબ્ને અબી તાલીબ અ૦મે, એક દીવસ ફરમાવ્યું કે: અય લોકો! જ્યારે તમારામાંથી કોઈ માણસ નમાજ પુર્ણ કરી લીએ ત્યારે આસમાન તરફ હાથ ઉઠાવીને દુઆ માંગો. તે વખતે હાજરીનમાંથી સબાનો એક રહેવાસીએ પુછ્યું કે: યા અમીરલ મોઅમેનીન! શું અલ્લાહ દરેક જગ્યા મૌજુદ નથી? તો મૌલાએ જવાબ આપ્યો કે હા, અલ્લાહ દરેક જગ્યાએ હાજર છે. એજ વખતે તે માણસે તરત ઉઠીને ફરી સવાલ કર્યો કે યા હજરત! તો પછી શા માટે આસમાન તરફ હાથ ઉઠાવવા જોઈએ? ઈમામે સમજાવ્યું કે: શું તેં કુરાઅનમાં આ આયત નથી પડી? વ ફીસસમાએ રીજકોકુમ વ મા તુઅદુનઃ અને આસમાનમાં તમારી રોજી છે અને એ ચીજ કે જેનો વાયદો આપવામાં આવ્યો છે.

(સૂરાએ જારેયાત; આયત: ૨૨).

આમ જગ્યાં રીજક છે ત્યાંથીજ રોજી માંગવી જાઈએ અને અલ્લાહ તાલાબ આસમાનમાંથી આપવાનો વાયદો કર્યો છે.(શેખ સદુક અ૦૨૦ની કિતાબ એલલુશશરાઅઓમાંથી).

હો પયગમ્બરે ઈસલામ સ૦ મે ફરમાવ્યું છે કે: જ્યારે બંદો ખુદાવંદે કરીમ પાસે હાથ ઉંચા કરી દુઆ માંગો છે ત્યારે તેને ખાલી હાથ પાછો ફેરવવામાં અલ્લાહને શરમ થાય છે. એટલે બંદાની હાજર પુરી કરવામાં, મસલેહત હોય, તો હાજર પુરી કરે છે. પણ તેના હાથ તો પોતાના ફરજ

અને રહેમતથી ભરી આપે છે. તેથીજ તો દુઆ કર્યા બાદ, પોતાના બન્ને હાથો મોઢાપર ફેરવવાનું ફરમાન છે.

જ્યારે આપણા આઠમા ઈમામ અઠને એક સહાબીએ સવાલ કર્યો કે: શા માટે હાજત માંગતી વખતે આપણો હાથોને આસમાન તરફ ઉઠાવીએ છીએ? તે વખતે આપણા મૌલા અને આકા, હો અલી ઈંબે મુસા રજા અઠ મે તેમને જે જવાબ આપ્યો, તે આપણે સાંભળીએ:

અલ્લાહે પોતાની મખુલું તેની ઈબાદત કરવાની તેમજ પોતાને બંદા તરીકે બતાવી માઅબુદ્ધની ફરમાંબરદારી કરવાની ઘણી રીતો શીખવી છે, જેમાંથી એક દુઆ માંગતી વખતની હાલત છે: દરેક હાજત અને યાચના વેળા પોતાના હાથોને આસમાન તરફ ઉઠાવી ઈન્સાન પોતાને હકીર, તુચ્છ, ઝલીલ અને અલ્લાહનો તાબેદાર બંદો બતાવે.

જે ઈન્સાન પોતાને બેઈજીત સમજે છે તેને અલ્લાહ ઈજીત બક્ષે છે, જે પોતાને નિચો ગણે છે તેને અલ્લાહ ઉચ્ચો લાવે છે. અલ્લાહ ચાહે છે કે ઈન્સાન આ ખાકસારીનો પાઠ પોતાના જીવનમાં ઉતારે અને મોટાઈ-અહંકારને હંમેશ માટે તલાક આપી દીએ, જેથી માલિકની મહેરબાનીઓનો તે હક્કદાર બની શકે.

હો અમીરુલ મોઅમેનીન અઠથી મનકુલ છે કે: જ્યારે કોઈ શાખા નમાજથી ફારેગ થઈ જાય, તો પોતાના હાથોને આસમાન તરફ બુલંદ કરીને દુઆ માંગવામાં ખુબ મહેનત કરે.

સહીહ હદ્દીસમાં છે કે: જ્યારે હો ઈઠો જાઅફરે સાદ્દિક અઠ નમાજની સલામ પડતા હતા ત્યારે પોતાના હાથોને પોતાના માથા સુધી ઉચા કરીને દુઆ કરતા હતા.

હો ઈઠો મોહમ્મદે બાકિર અઠ થી રિવાયત છે કે જે બંદો પોતાના હાથોને અલ્લાહ તરફ બુલંદ કરે, ખુદાવંદે આલમની જાતને શરમ આવે છે કે તેના હાથોને પાછા ખાલી વાળે. માટે તમે જ્યારે દુઆ કરો તો પોતાના હાથોને નીચે ન લાવો જ્યાં સુધી કે મોઢા ઉપર ફેરવી ન લ્યો.

(આ શાખા હદ્દીસો આકાએ શેખ અખ્બાસે કુમ્મી તા.સ.ની કિતાબ મફાતીહુલ જ્ઞાનમાંથી)

દુઆ કેમ કબુલ થતી નથી ?

દુઆ કબુલ ન થવાથી કદી કંટાળવું નહીં. પરંતુ, દુઆ શા માટે કબુલ થતી નથી, તેનું કારણ શોધવું. અને કદાચ આપણી પોતાની ભુલ થકી એમ થતું હોય તો તે ભુલને તરત સુધારવાની કોશીશ કરવી.

હિન્દુરત ઈમામે જાઅફરે સાદ્દિક અઠની ખિદમતમાં એક શાખા આવીને અરજ કરી કે:

યા મૌલા! અમારી દુઆઓ કબુલ થતી નથી તેનું કારણ શું? ઈમામે જવાબ આપ્યો કે: ખુદાએ તાલુકા પોતાની કીતાબ કુરાઓને શરીફમાં ફરમાવે છે કે:

૧ અવફુ બે અહદી ઉફે બે અહદેકુમ : તમોએ મારી સાથે જે વાયદો કર્યો છે તે પુરો કરો તો હું પણ તમારી સાથેનો વાયદો પુરો કરું. (સૂરાએ અલ બકરહ; આયત: ૪૦).

માટે, તમારી દુઆ ન કબુલ થવાનું એ કારણ છે કે તમે તમારો અહદ પુરો કરતા નથી યાને કે જે વાજુબાત બજાવી લાવવા તમે વચ્ચન આપ્યું છે, તેનું તમે પાલન કરતા નથી અને જે હરામ કામથી દુર રહેવા તમે કબુલ કર્યું છે, તેને અંજામ આપો છો. ખુદાની કસમ! અગર તમે તમારા અહદ ઉપર અમલ કરસો તો અલ્લાહ પણ તમારી દુઆ પુરી કરી પોતાનો વાયદો નિભાવશે.

ઘઉં અથવા ચાવલના ભંડારમાં જો ઉદર પેસ્યા ન હોય તો મહીનાઓથી સંગ્રહેલા તે દાણાઓ જાય ક્યાં? માટે જરૂરી છે કે ઉદર એવી જગ્યામાં ધુસી ન શકે તેની અગાઉથીજ વ્યવસ્થા કરવી, દવા છાંટવી, અવારનવાર તપાસ કરવી, સાફ્સફાઈ રાખવી, ઉપરાંત ચોરની નજરથી પણ સાવચેત રહેવું અને પછીજ ત્યાં અનાજ ભરવું.

અથવા જે લોકો જાહેરી ઈબાદતો બજાવી પોતાના બાતીનની ખરાબીઓ અને નાપાડીઓને સુધ્ધારતા નથી, તેઓનું છાંટાંત એવુંજ છે કે ઘરમાં અંધારું હોય અને ઘરના છાપરે દીવો સળગતો હોય! આ દીવાથી ઘરમાં કોઈ અજવાણું નહીં ફેલાય! તો એવો દીવો શા કમનો કે જે પોતાના માલિકને અંધારામાં રાખે?

અથવા તો કોઈ ખેડૂત જમીન બરાબર સાફ અને તૈયાર કરી તેમાં દાણા વાવે અને પછી તેની કોઈ સંભાળ રાખે નહીં. બાજુમાં ખડ ઉગવા શરૂ થઈ જાય. હવે તે ખડને જડમૂડમાંથી ન ખેંચી કાઢતાં ઉપર ઉપરથી કાતરી નાંખે તો શું કોઈ ફાયદો થવાનો? ખડ જેમ કાપશે તેમ વધુ ઉગશે અને બીયાંને બીલકુલ વધવા નહીં આપે!

અલવી ઉપદેશમાંથી મૌલાએ મુત્તકેયાનની એક હદ્દીસ મળે છે કે: જો તમે તમારી દુઆઓના માગ ને ગુનાહોથી બંધ કરી દીધો છે તો તેના કબૂલ થવાની વાટ ન જુઓ.

હદ્દીસે નબવીમાં મળે છે કે: એક દિવસ, જ્યારે હું મુસા પયગમ્બર અઠ એક માણસ પાસેથી ગુજર્યા કે જે સજદામાં અલ્લાહને એકદમ પોકારી રહ્યો હતો. તે વખતે અલ્લાહે તેમને વહી કરી: અય મુસા! અગર આ માણસ એટલો લાંબો સજદો કરે કે તેની ડોક ટુટી જાય તો પણ હું તેની દુઆ કબૂલ કરીશ નહીં જ્યાં સુધી કે તે મારી નાફરમાની છોડી મારી તાબેદારી કરશે નહીં (જ્યાં સુધી તે ગુનાહોને છોડી નેકી તરફ રજુ નહીં થાય)!

હાજતોનું રદ થઈ જવામાં સઉથી એક મોટું કારણ ઈન્સાનના ગુનાહો છે. જેવી રીતે મૌલા અલી અઠ દુઆએ કોમયલમાં ફરમાવે છે કે: અય અલ્લાહ! તું મારા તે ગુનાહોને માફ કરી આપ કે જે મારી દુઆને કબૂલ થવાથી રોકે છે.

બાકેરુલ ઓલુમ, હું આપણા પાંચમા ઈમામ અઠ નો ઈરશાદ છે કે: બંદો જ્યારે પોતાની હાજત લઈને અલ્લાહને પોકારે છે, તે વખતે ખુદાવંદે આલમ ફરીશતાને હુકમ આપે છે ક તેને રાજુ કરશો નહીં બલકે તેની દુઆને કુકડાવી આપો કારણકે તે મારા ગુસ્સાને વળેલો છે.

અહીં એક સવાલ જન્મે છે: આ રિવાયતો અને બીજી અનેક તેના જેવી હદ્દીસોને નિહાળતાં એમ સમજાય છે કે માઅસુમીન અઠમુઠ સિવાય બધા ઈન્સાનો ગુનેહગાર હોય, તો શા માટે દુઆ કરવી કારણકે આપણી કોઈની દુઆ કદી કબૂલ થવાની નથી? આનો જવાબ બીલકુલ સરળ છે: આપણે ધણી વગરના ઢોર જેવા નથી. બલકે આપણા ઈમામો અઠમુઠ કે જે આપણા હકીકી સરદાર, રસ્તો બતાડનાર અને કયામતના દિવસે આપણી શફાઅત કરનાર-આપણને છોડાવનાર હોય, તેમને દુઆઓનો એક અપૂર્વ અને આણમોલ ખજાનો આપણને ભેટ કર્યો છે, ઉપરાંત આપણને દુઆ કરવાની રીત અને તેનો કબૂલ થવાનો ઈલાજ પણ બતાવ્યો છે.

પોતાના ગુનાહો ઉપર પસ્તાવો જહેર કરવો, પાછા તે ગુનાહો કરવા નહીં, પોતાની ભુલનો ઈકરાર કરવો, પોતાને ગુનેહગાર અને સજાને લાયક સમજવો, તૌબા માંગવી, ઈસ્તેગફાર કરવું, આ બધું એટલા માટે કે દુઆના માર્ગપરથી તમામ રૂકાવટો હઠાવી તેને સાફ કરી આપે અને હું મોહમ્મદો આલે મોહુંમદ સ૦ ઉપર દુરૂદ મોકલી તેમનો પવિત્ર દામન પકડવું અને અલ્લાહના તે

ઘારા બંદાઓને આપણી હાજતને મંજુલ સુધી પહોંચાડવા અર્થે વસીલો બનાવવો. આપણે ભલે ગુનેહગાર હોઈએ, પણ આપણને ખુદાએ પવિત્ર સરદાર આપ્યા છે.

દુઅા કબૂલ ન થવાનું બીજું કારણ તે પણ છે કે હમેશાં સારા કાર્ય કરીને દુઅા માંગવી.

હો પયગમ્બરે ઈસલામ, રીસાલત માબાબ સું મે ફરમાવ્યું કે: હે અબાઝર! નેક કામ કરીને અગર તમે દુઅા કરો તો આટામાં નમક જેટલી દુઅા બસ છે.

બીજું એક હદ્દીસમાં આપનો કોલ છે કે: જે કોઈ દૃષ્ટિ કે તેની દુઅા કબૂલ થાય તો હલાલ કમાઈને પવિત્ર ખાય. જે કાઈ હરામ કોળીયો ન ખાય તો તે અમલ બે હજાર સુન્નત નમાઝ પડવા કરતાં બેહતર છે.

એક માણસ છઢા ઈમામ અઠની ખીદમતમાં આવીને સવાલ કર્યો કે: મૌલા! એક શાખણું કહેવું છે કે અગર હું ઘરમાં બેસી રહું તો શું મને રોજી મળશે? આપે ફરમાવ્યું કે: નણ માણસો એવા છે કે જેમની દુઅા કબૂલ થતી નથી અને તેમાંનો એક શાખા આ છે.

કોઈ શાખે હો અમીરુલ મોઅમેનીન અઠ ની સામે દુઅા કબૂલ ન થવાની શીકાયત કરી, કહેવા લાગ્યો કે: ખુદા કહે છે કે દુઅા કરો તો હું કબૂલ કરીશ, પરંતુ એ છતાં શું કારણ છે કે અમે દુઅા કરીએ છીએ અને તે કબૂલ નથી થાતી. તેના જવાબમાં આપે ફરમાવ્યું:

તમારા દિલ અને દિમાગો આઠ બાબતોમાં ધોકો કર્યો છે, જેના કારણે તમારી દુઅા કબૂલ નથી થાતી:

પ્રથમ: તમે ખુદાને ઓળખીને તેનો હક અદા નથી કર્યો. એટલા માટે તમારી માઅરેફતે તમને કોઈ ફાયદો ન પહોંચાડયો.

બીજું: તમે તેના મોકલેલા પયગમ્બર પર ઈમાન તો લઈ આવ્યા છો, પણ તેની સુન્નતની વિરુદ્ધતા કરો છો. એવામાં તમારા ઈમાનનો શો નતીજો નીકળો?

નીજું: તમે તેની કિતાબને પડો છો, પણ તેનાપર અમલ નથી કરતા. જીબથી તો કહો છો અમે સાંભળ્યું અને પયરવી કરી, પણ અમલી રીતે તેનો વિરોધ કરો છો.

ચોયું: તમે કહો છો કે અમે તેના અભાબથી ડરીએ છીએ. એ છતાં નાફરમાનીએ તરફ આગળ વધો છો તો પછી ડર કર્યાં રહ્યો?

પાંચમું: તમે કહો છો કે અમે જન્નતના મુશતાક છીએ જ્યારે કે કામ એવા કરો છો જે તમને તેનાથી દુર લઈ શક છે. તો પછી શોખ અને દિશક કર્યાં રહ્યા?

છંકું: ખુદાની નેઅમતો તો ખાવ છો, પણ શુદ્ધ (આભાર)નો હક અદા નથી કરતા.

સાતમું: તેણે તમને હુકમ આપ્યો: શેતાનથી દુશમની કરો, પણ તમે તેનાથી દોસ્તીનો હાથ લંબાવો છો.

આઠમું: તમે લોકોના દોષ ગોતવાને પોતાનો સિધ્યાંત બનાવી રાખ્યા છો અને પોતાની ખોડ ખાપણ જુલાવી દીધી છે.

આવા સંશોધનોમાં તમે કઈ રીતે આશા રાખો છો કે તમારી દુઅા કબૂલ થાય જ્યારે કે તમે પાતે તેના સ્વીકારના બારણા બંધ કરી દીધા છો.

નકવા અને પરહેઝગારી અપનાવો, તમારા કમો ની સુધારણા કરો, અન્ને બીલ માઅરુફ અને નહીં અનિલ મુન્કર કરો, જેથી તમારી દુઅા કબૂલ થઈ શકે.

(તફસીરે નમુના - ભાગ ૧ લો - આયતુલ્લાહ ઉજ્મા સૈયદ નાસીર મકારમ શીરાજી)

ફુઝ-કોરુની અજકુરકુમ વશ-કોરુલી વલા તકફોરુન : માટે તમે મને યાદ કરો તો હું પણ તમને યાદ કરીશ અને મારો શુષ્ઠ માનો અને અપકારી (નાશુષ્ઠગુજરાત) ન બનો.

(સૂરએ અલ બકરહ; આયત: ૧૫૨).

બંદાના યાદ કરવાનો તથા ખુદાના યાદ કરવાનો શું અથ' છે? આ સંબંધમાં તફસીરે કબીરની અંદર ફખરુદીન રાજીએ દસ વિભાગ હેઠળ કરેલ છે:

- મને ફરમાંબરદારી વડે યાદ કરો કે જેથી હું મારી રહેમત મારફતે તમને યાદ કરું;
- મને દુઆના સાથે યાદ કરો કે જેથી હું તમને તેની કબુલીયત સાથે યાદ કરીશ;
- મને વખાણ અને કુરબાનીની ભાવના સાથે યાદ કરો તો હું તમને વખાણ અને નેઅમતો ની સાથે યાદ કરીશ;
- મને દુનિયામાં યાદ કરો તો હું તમને આખેરતમાં યાદ કરું;
- મને એકાંતમાં યાદ કરો કે જેથી હું તમને લોકોની વચ્ચે યાદ કરું;
- મને નેઅમતોની બહોળાઈ વખતે યાદ કરો કે જેથી હું તમને સખ્તીના સમયે યાદ કરું;
- મને ઈબાદત વડે યાદ કરો કે જેથી હું તમારી મદદ કરું;
- મને પ્રયત્ન અને કોશીશ વડે યાદ કરા તો હું તમને હીદાયત વડે યાદ કરું;
- મને સાચા અને ચોખા દિલથી યાદ કરો અને હું તમને નજીત વડે યાદ કરું;
- મારી રબુબીયતનું વર્ણન કરો કે હું રહેમત (મહેરબાની)ની સાથે યાદ કરું.

(ઈસ્નાઅશરી માસિક - ઓક્ટોબર ૧૯૮૮ - અંક દાઢો - વરસ દ૪ મું)

ઈમાન, યકીન, ભરોસા વગરની દુઆ પણ કબુલ થતી નથી. યકીન વિનાની દુઆ તે ખોટા સિક્કા સમાન છે. જેમ ખોટા સિક્કા અને પૈસાની ખોટી નોટ નું બજારમાં કંઈજ ઉપજતું નથી તેમ વિશ્વાસ-ભરોસા વગરની દુઆથી કિસમતમાં કંઈજ ફેર પડતો નથી. દુઆથી તકદીર ત્યારેજ બદલાઈ છે જ્યારે અંત:કરણ મુજબ દુઆ કરવામાં આવે.

અલ્લાહ ગયબ કહેતાં જોવામાં આવતો નથી અને દુઆ પડતી વખતે ફક્ત આપણેજ બોલી રહ્યા હોય છે, સામેથી કોઈ જવાબ મળતો નથી. તે વખતે એવું બને છે કે જબાન ચાલતી હોય, વિચારો બીજી જગ્યાએ ભટકી રહ્યા હોય અને દિલ તેમાં લાગેલું હોતું નથી.

હો માઅસુભીનો અઠમુઠ ની પવિત્ર મુખારક દેવડી ઉપરથી આપણને એવી દુઆઓ મળી છે કે જેના સંદકથી ભયંકર બીમારીઓને આપણે નાખૂદ કરી શકીએ છીએ, મુસીબતોના જંગી પર્વતોને આપણે ખસેડી શકીએ છીએ, જાલીમોના ફોલાદથી વધુ કઠણ દિલને આપણે પીગળાવી પાણી બનાવી શકીએ છીએ, હજારો ગુનાહોને માફ કરાવી આપણા ભારને હલકો કરી શકીએ છીએ. પરંતુ, એ દુઆ અંતકરણપૂર્વક થવી જોઈએ અને બધું ધ્યાન તે વખતે અલ્લાહમાંજ પરોવી દેવું ઘટે છે, તોજ દુઆ કબુલિયતના દરજે પહોંચી શકે છે. વષો' સુધી ઢચુપણુ મનથી માંગેલી દુઆ

નિષ્ફળ જાય છે જ્યારે કે થોડીક મીનીટો ખરા મનથી કરેલી દુઆ માલિકના દરબારમાં ઘણીજ જલદી કબુલને પાત્ર બને છે.

સાચા દિલથી અને ખુદા ઉપર સંપૂર્ણ ધકીન રાખનારની દુઆ સ્વીકારવામાં આવી કે નહીં, તેની જાણ તો ક્યામતના દિવસે થશે કે ખુદા સુખાનહું વ તથાલા પોતાના બંદાને કહેશે કે: અય મારા બંદા! તેં માંગ્યું અને મેં ન આપ્યું. તેનો અર્થ એ નથી કે હું આપવા અશક્ત હતો અથવા મારી પાસે તારી કોઈ કદર ન હતી, પરંતુ તારી દુઆ ન કબુલ કરવામાં તારીજ ભલાઈ સમાએલી હતી. સાદીકે આલે મોહમ્મદ અઠના એક અંધ સહાબી હતા, જેમનું નામ હતું: અબુબસીર. તેમણે એક દિવસ ફરજને રસુલની ખીદમતમાં આવી સવાલ કર્યો કે: મૌલા! ઘણી દુઆઓ પડી, પણ આંખ્યો તો એવીને એવીજ રહ્યો. તમારા જેવા ઈમામ અમારી વચ્ચે હોય અને તમારા શીઆહની આવી હાલત! રસુલના સાચા જાંનશીને તેમના માટે દુઆ કરી અને અબુબસીર દેખતા થઈ ગયા. પછી ઈમામે તેમને ફરમાવ્યું કે: અય અબુબસીર! આજ તમે મારી જીયારતનો ફાયદો ઉઠાવી રહ્યા છો, પણ યાદ રાખજો કે ક્યામતના દિવસે તમે અમારી સાથે નહીં રહ્યો. માનવંતા સહાબી ઈમામના કદમોને બોસા દઈ કહેવા લાગ્યા કે: મૌલા! મને એવી આંખ્યો નથી ખપતી જે તમારી મોહબ્બતને ખોઈ નાંબે!

હું ઈં ઝયનુલ આબેદીન, આપણા ચોથા ઈમામ અઠ ફરમાવે છે કે: જે ગુનાહો દુઆઓને કબુલ થતાં રોકે છે તે આ પ્રમાણે છે:

૧/ નિયતમાં ખરાબી એટલે કે નિયત પાક-સાફ ન હોવી.

૨/ બાતિનની નજાસત એટલે ઈન્સાન જાહેરી રીતે કેટલો પાક-સાફ હોય, તે કમાલની વાત નથી, પરંતુ તેનું દિલ કેટલું પાક-સાફ અને નુરાની છે, તે મહત્વનું છે.

૩/ મોઅમીન બીરાદરો સાથે મુનાફેકત ભયો વર્તાવ.

૪/ વાળું નમાઝો અદા કરવામાં મોળું કરવું.

૫/ સદકત-ખયરાત ન આપવા.

૬/ બદકલામી - ખરાબ શબ્દોથી તેમજ નકામી વાતો કરવી.

(ઈસ્નાઅશરી-માસિક, નવેમ્બર ૨૦૦૩, માહે રમઝાન હી.સ.૧૪૨૪)

યાદ રહે કે શા માટે દુઆ કબુલ થતી નથી? તેનું કારણ ફક્ત અલ્લાહજ બેહતર જાણો છે. બસ, તેના બંદાનો હક છે કે તેની ફરમાંબરદારી કરે, ઈબાદત બજાવી લાવે, ગુનાહોથી દુર રહે અને હું માસુમીનો અઠમુંમે બતાવેલી દુઆ પડવામાં કદી કંજુસાઈ કરે નહીં અને પોતાની હાજત અલ્લાહ પાસે રજુ કરવાથી કદી કંટાળે નહીં.

ઉપરોક્ત સૂરાએ અલ બકરહ ની ૧૨૮ નંબરની આયતમાં આપણે વાંચી ચુક્યા કે હું ઈંછાહીમ અઠમે ખુદા પાસે દુઆ કરી કે મકાવાળાઓમાંથી એક એવો રસુલ મોકલે કે જે લોકોને તેની આયતો પડીને સંભળાવે, આસમાની કિતાબોનું ઈલ્મ અને હીકમતની વાતું શીખવે અને તેમના નફસને પાક કરે. દુઆ માંગવામાં આવી હતી ચાર હજાર વર્ષ પહેલે અને દુઆ કબુલ થઈ ચાર હજાર વર્ષ બાદ. એક નબીએ ખુદા, અલ્લાહના રસુલ અને દોસ્ત, ઉલુલ અઝમ પયગમ્બર, સાહેબે સહીઝા, માસુમ ઈમામની દુઆ હતી. આ બતાવે છે કે દુઆમાં અગર મોળું થાય તો, ન કાંઈ ગભરાવવાનું છે, ન કાંઈ નિરાશ થવાનું છે.

(મૌલાના મર્હુમ તાલીબ જવહરીની મજલિસમાંથી)

કેવા લોકોની દુઆ કબૂલ થતી નથી ?

૯૦ ૯૦ જાયદર સાદિક અઠમે ફરમાવ્યું: અલ્લાહ તખાલા બદ અખ્લાદ (ચારિત્ર વિલોક્યા) માણસની દુઆ કબૂલ કરવાને ઈન્કાર કરે છે. ત્યારે આપ અઠને પુછવામાં આવ્યું કે: તે કેવી રીતે? આપ અઠ મે ફરમાવ્યું: તે હજુ એક ગુનાહમાંથી નીકળે છે કે તરતજ તેનાથી મોટા ગુનાહમાં ફ્સાઈ જતો હોય છે. (શેખ સદૃક અ૧૨૦ની કિતાબ: એલલુશશરાઓએઆ).

ખુદાવંદે કરીમે દરેક ચીજનો એક તરીકો બતાવ્યો છે અને તેને હાંસીલ કરવા અથે'અમુક કાનુનો અથવા કંડીશનો નક્કી કર્યા છે. અગર તે શરતોથી ઉલટું ચાલવામાં આવે તો, તેમાં કોઈ શક નથી, કે તેનું મેળવવું અશક્ય બની જશે. એજ મુતાબીક, દુઆ અને તેના કબૂલ થવા ના કારણમાં પણ અમુક કંડીશનો અગત્યતા ધરાવે છે.

૯૦ રસૂલે અકરમ, મોહમ્મદે મુસ્તફા સ૦ ફરમાવે છે કે: અમુક તેના એવા બંદાઓ છે કે જેમની દુઆને ખાલિકે કાચેનાત કબૂલ કરતો નથી: -

- ❖ જે ઈન્સાન ખુદાથી પોતાના માં- બાપ માટે બુરાઈ-ખરાબીનો તલબગાર હોય છે તેની દુઆ કદી કબૂલ થતી નથી. એવી દુઆ તેના મોઢા ઉપર મારવામાં આવે છે. અગરચે આ લોકોએ તારી પરવરિશ કરી ન હતે તો તું કદી આનો લાયક બનતે નહીં.
- ❖ જે માણસ બીજાને પોતાનો માલ કરજ માં આપે અને તેનો ન કોઈ ગવાહ હોય, ન કોઈ લેખિત કાગળ કે સરટીફીક્ટ, અને પાછળથી જ્યારે કરજદાર તે માલને પાછો આપવાનો અથવા તેની કીમત ચુકવવાનો ઈનકાર કરી આપે, તેવી હાલતમાં અગર પોતે ખુદાથી તેનો માલ અથવા પૈસા પાછા મળી જાય તેની દુઆ કરે તો એવી દુઆ પણ કબૂલીયતના સ્થાને પહોંચતી નથી, કારણકે સહી - સિક્કા અને સાક્ષી વગરનું કરજ તે ખુદ પોતાના પગમાં કુહાડી મારવા બરાબર છે.
- ❖ જે શખ્શ પોતાની ઘરવાડીની પરેશાનીઓ અથવા ખરાબ આદતોથી છુટવા માટે થઈને ખુદા પાસે દુઆ માંગે છે તો તેની દુઆ પણ રદ થાય છે કારણકે શરીરાતે ઈસલામે તેનો ઈલાજ તેના હાથમાં સૌંઘ્યો છે. અગર તે હડીકતમાં પોતાની બીભીથી કંટાળી ગયો છે તો તેનાથી સમજૂતી કરી લીએ અથવા તેને તલાક આપી છુટકારો મેળવી લીએ.
- ❖ જે માણસ આખો દિવસ ઘરમાં બેસી અલ્લાહથી પોતાની રોજનો તલબગાર હોય તો એવા અજ્ઞાન-જાહીલ અને આળસુ ઈન્સાનના બારામાં ખુદા ફરમાવે છે કે: અય મારા બંદા! શું મેં તને કોશીશ અને મહેનત કરવા તાકત નથી આપી? શું તારા માટે કમાવવાના રસ્તા મેં ઉઘાડા નથી કર્યા? શું મેં તને સલામત શરીર નથી આખ્યું? શું મેં તને સારી અક્કલ નથી આપી? તારા શરીરના દરેક અવ્યવ - દરેક ભાગ માલિકની નેઅમત છે અને તેનો શુદ્ધ ત્યાં સુધી અદા થતો નથી જ્યાં સુધી કે તેનાથી કામ લેવામાં ન આવે તે છતાં, અગર તું કોશીશ અને મહેનત ન કરે, જે થડી તારી તરકી ન થઈ શકી તો તે તારી બદનસીબી છે કારણકે અલ્લાહે ઈન્સાનને બીજા ઉપર બોજ બનવાનું કહ્યું નથી. જો તારી મહેનત મારી મરજની મુતાબીક રહી તો હું તારી રોજમાં જરૂર વધારો કરીશ અને જો

- કોઈ કારણસર તેમાં મારી ભસલેહત ન રહી તો કદ્દી નિરાશ થજે નહીં અને શાંત રહી મારાપર તવક્કલ અને ભરોસો રાખજે. કોશીશ કરવી તારું કામ છે, આપવું મારું કામ છે.
- ❖ જે બંદો પોતાના સગાવ્હાલાઓ - કુટુંબીજનો માટે અલ્લાહથી બદદુઆ કરે છે અથવા એવા મોઅમીન ભાઈઓ કે જેનાથી તેનો વહેવાર સારો નથી અને તેમના માટે ખરાબ દુઆ માંગે છે તો તેની દુઆને પણ અલ્લાહ સાંભળતો નથી.
 - ❖ જે બંદાને પુષ્ટકળ માલ આપી ખુદા માલદાર બનાવે અને તે પોતાનો બધો માલ સખાવત કરી ખાલી થઈ જાય, તે પછી ફરી માઅબુદ્ધ પાસે સવાલ કરે કે તેને એવીજ તવંગરી પાછી ઈનાયત કરે તો તે વખતે બારગાહે ઈલાહીથી તેને જવાબ મળે છે કે: શું મેં તને સખાવતની અંદર ઈન્સાફ કરવાનું ફરમાવ્યું ન હતું? શું મેં તને સખાવતની અંદર ઈસરાફ કરવાની મના કરી ન હતી?

અલ્લાહ તબારક વ તઆલા પોતાના હબીબને, બક્ષીશ અને ખયરાતનો તરીકો, કુરાનની અંદર, સુરએ બની ઈસરાઈલની ૨૮ નંબરની આયતમાં, બતાવ્યો છે:

વલા તજ- અલ યદાક મગલુલતન એલા ઓનોકેકા વલાતબ - સુત-હા કુલ્લલ બસતે ફ તક- ઓદા મલુમમ મહસુરા: અને તું તારો હાથ ગરદન સાથે બાંધેલો ન રાખ (કે જેથી તું કોઈને કાંઈ આપી શકે નહીં) તેમજ તેને એકદમ ખોલી ન નાંખ (કે જેથી તું બધું આપી દે) કે આખીર તું ઠપકાને પાત્ર અને ઓશીયાળો બની જાય.

મર્હુમ અલ્લામા હાજ નાજ સાહેબ અઠમ૦ પોતાની તફસીરે કુરાનમાં લખે છે કે: હ૦૯૦ જાઝફરે સાદીક અ૦ મે ફરમાવ્યું છે કે: હ૦ રસુલે ખુદા સ૦ જરૂરતમંદને સવાલ કરવા પહેલાંજ આપી દેતા હતા. એક ઔરતે પોતાના દીકરાને હુજુર સ૦ પાસે મોકલી કે તું જઈને સવાલ કર. અગર આપ કહે કે મારી પાસે કાંઈ નથી તો કહેજે કે: અય અલ્લાહના રસુલ! મને આપનું પહેરણ ઉતારી આપો. જ્યારે તેણે હજરત પાસે એ પ્રમાણે સવાલ કર્યો તો આપે પહેરણ ઉતારીને આપી દીધું. તે વખતે આ આયત નાજીલ થઈ કે આવી રીતે લોકોને આપવું જોઈએ નહીં. આપણા છઢા ઈમામના જમાનામાં કોઈએ આ આયત વિશે સવાલ કર્યો તો હજરતે એક મુઢીમાં કાંકરા લઈને મુઢી બંધ કરી અને પછી ફરમાવ્યું કે ખુદા જે કહે છે કે હાથ બાંધી ન લો તેથી મુરાદ આ છે. પછી તે તમામ કાંકરા મુઢીમાંથી ફેરી દઈ ફરમાવ્યું કે ખુદા ફરમાવે છે કે તમારા હાથ ખોલી ન નાંખો તેથી મુરાદ આ છે. તે પછી ફરી હજરતે મુઢીમાં થોડાક કાંકરા લીધા અને તેમાંથી થોડા જમીન ઉપર નાખી દીધા અને કેટલાકને મુઢીમાં બાકી રાખ્યા અને ફરમાવ્યું કે આ વચ્ચે રસ્તો છે અને આ રીતે ખુદાએ માલ ખર્ચ વાનો હુકમ આપ્યો છે.

મર્હુમ અલ્લામા સાહેબ તે પછી એક બીજી રીવાયત ટાંકે છે કે ખુદાએ તાલા હદ્દીસે કુદસીમાં ફરમાવે છે કે કેટલાક બંદા એવા છે કે ગરીબી અને તંગદસ્તીથી તેમની હાલત સુધરે છે. જો તેઓને માલદાર બનાવું તો તેઓને તવંગરી બરબાદ કરી નાખે. કેટલાક બંદા એવા છે કે તેઓની હાલત માલદાર થવાથી સુધરે છે. જો તેઓને ફીરી અને મોહતાજ કરું તો ફીરી અને ગરીબી તેઓને તબાહ કરી નાખે, અને તેઓની ભલાઈ કેમાં છે તે હું સારી રીતે જાણું છું. અલબત્તા એ પણ ધ્યાનમાં રાખવાનું કે હયદરે કર્રાર, અમીરુલ મોઅમેનીન, ઈમામ અલી અ૦ ફરમાવે છે કે: ખુદા ગાફિલ દિલની દુઆ કબૂલ નથી કરતો.

એક બીજુ હદ્દીસમાં ઈમામ સાદિક અઠ થી આજ વિષય પર રિવાયત થએલ છે: ઈન્હીની અભિજ્ઞત વ જલ્દ લા યસતાનું હુઅાઅ બજહરે કલ્બે સાહ યાને કે: બેશક, અલ્લાહ મહાન, રજ્બુલ ઈઝત, તે દિલની હુઅા કબૂલ કરતો નથી કે જે ગાફિલ - બેપરવા છે, જે અલ્લાહની કશી પરવા કરતો નથી, જે હુઅા ફક્ત અભાનપર છે, દિલ તેનાથી બીલકુલ ખાલી છે.

હુઅાનું ઉંડુ રહેસ ય :

જ્યારે ઈન્સાનના દુખની કોઈ સીમા રહેતી નથી ત્યારે તે દુનિયાથી કંટાળે છે, તેનું મન ગભરાઈ છે, રહેદય બેડોળ બને છે, અંદરની બાફને બહાર કાઢવાની આવશયકતા રહે છે, છતાં તેની ઈજ્જત તેમ કરવાથી તેને રોકે છે, ત્યારે હુઅા થકી તે પોતાના માઅબુદ્ધી સંબંધ જોડે છે. એક બેગુનાહ બાળકની જેમ અલ્લાહના દરબારમાં ચોખા અને સાફ દિલથી ઈન્સાન હાજર થાય છે, રોકે છે, કાકલુદીની સાથ ફરીયાદ કરે છે, કરગરીને પોકારે છે, છતાં પોતાની નબળાઈને ખુદાની મહાનતા સામે પેશ કરવાથી શરમાતો નથી, જો કે દુનિયામાં પોતાને તાકતવાન લોકોની સામે કમજોર બતાવવાથી લજજાય છે. અહીં અલ્લાહની કુવ્યત સામે પોતાને તુચ્છ દેખાડવાથી ફ્રેણ્ઝ અનુભવે છે.

હુઅા ઈન્સાનને જીવવાની ઉમેદ આપે છે, તેની તાકતને સજીવન કરે છે, ગભરાટની બીમારીમાં ગર્ક થવાથી રોકે છે, પાતાની મુંજવણોના ભાર તડે દટાઈ જવાથી બચાવે છે, દુનિયાથી હાર ખાઈ અકળાઈ જવાથી સુરક્ષિત રાખે છે.

યસ-અલોહુ મન ફીસ્સમાવાતે વલ-અરો: : તેનાથી સવાલ કરે છે તમામ લાકો જે આસમાનો-ઝમીનમાં વસે છે. (સૂરાએ અરરહમાન; આયત: ૨૮).

રિવાયતમાં છેકે: લા યોરદહુલ કદર ઈલ્લદહુઅઃ હુઅા કયા 'વિના નસીબ બદલી શકતા નથી. હુઅા માંગતી વખતે નિયત સાફ હોય, પોતાનું બધુંજ મન અલ્લાહમાં પરોવાએલું હોય, શબ્દો ઝબાનને બદલે દિલમાંથી નીકળતા હોય, તો દિલનો દર્દબયો 'અવાજ ખુદાના દરબાર સુધી પહોંચે છે અને હુઅા કબૂલ થાય છે, કિસમતમાં લખાએલી પરેશાની દૂર થાય છે, એટલે કે હુઅાથી તકદીર બદલી શકે છે.

મૌલાએ મુત્તકેયાન, અમીરુલ મોઅમેનીન, હો અલી અઠ ફરમાવે છે કે: હાજત હોય કે ન હોય, પણ હુઅા તો કરવી લાજીમ છે.

હાજતવાળાઓ માટે તો હુઅા જરૂરી છેજ, પરંતુ હાજત ન હોય તેમણે પણ આવનારી બલાઓથી બચવા અથે ' હુઅા કરવી જોઈએ કારણકે એમ કરવાથી ભવિષ્યની બલા અટકે છે અને મળેલી નેઅમતો-બરકતો બાકી રહે છે.

ઈમામ સાદીક અઠથી એક રિવાયતમાં છે કે આપે ફરમાવ્યું: જ્યારે દુનિયાના ગમોમાંથી કોઈનો સામનો પડે તો વજુ કરો અને મસજીદમાં જઈ નમાઝ પડો અને પછી હુઅા કરો કેમકે ખુદાએ પોતેજ હુકમ કર્યો ' છે કે સબર અને નમાજથી મદદ માંગો.

(તફસીરે નમુના, આયતુલ્લાહીલ ઓઝમા સૈયદ નાસીર મકારમ શીરાજી)

મૌલાએ મુત્તકેયાન, હો અલી અમીરુલ મોઅમેનીન, અલી ઈઝે અભીતાલીબ અઠ ફરમાવે છે કે: હું તમને હુઅાની બલામજા કરું છું કારણકે હુઅા અલ્લાહ પાસે કરવામાં આવે છે, તેની સમજી

માંગળી રજુ થાય છે, તો અલ્લાહ તે મુસીબતને રદ કરી શકે છે જે તેના તરફથીજ મુક્રર થઈ રહી છે અને તેના બંદાપર ઉત્તરવાની છે. તો તે દરમીયાન, જ્યારે તેની પાસે યાચના કરવામાં આવે તો અલ્લાહ તે બલાને હઠાવી આપે છે.

ક્યારે આઇત આવવાની છે? તે આપણાને માઅલુમ નથી. એટલેજ તો હુકમ થઈ રહ્યો છે કે કોઈ ટાઈમ દુઆથી ખાલી ન રાખો કારણકે તેમાં પોતાનોજ લાભ સમાએલો છે.

હુઅા અંધારી રાતમાં સુષ્ણની વહેલી સવારના પ્રકાશ સમાન છે. કાળી રાતનો ગાભરાટ જરૂર દુર થવાનો છે અને સૂર્ય, બલે મોળું, પણ જરૂર ઉદ્ય થશે.

હો સાઈક આલે મોહમ્મદ, આપણા છિઠા ઈમામ અઠ નો એક કોલ છે કે: જેવી રીતે વાદળ વરસાદ લાવે છે એજ પ્રમાણે હુઅા હાજત પુરી કરે છે.

અને હો પયગમ્બરે ઈસલામ, રીસાલત માબસ સું નો ઈરશાદ છે કે: તમારી હુઅા જરૂર પુરી થશે એવી ખાતી રાખીને તમે માંગો.

કદી એવો વિચાર લાવો નહીં કે નસીબમાં જે લખાએલું છે તેમાં કાંઈ ફેર પડશે નહીં, લાખ તમે મહેનત કરો; જે થાવાનું છે તે થઈનેજ રહેશે. યાદ રહે કે અલ્લાહ તકદીરનો માલિક છે જેવી રીતે મૌલા અલી મુશકીલ કુશા અઠ દુઆએ કોમયલની અંદર એક જગ્યાએ ફરમાવે છે કે: અય તે કે જેના હાથમાં મારી તકદીર છે! અગર તેની પાસે તેનો બંદો કાકલુદીની સાથ, રોઈ-રોઈને કરગરે, કાલાવાલા કરે, તો શું તે રહમાન અને રહીમ, તેના નસીબની ખરાબીને સારાપણાથી બદલી ન આપે? અલ્લાહની રહેમતથી નિરાશ થવું તે ઈસલામની શરીઅતમાં બીજા નંબરનો ગુનોહ છે અને અલ્લાહને તે બીલકુલ નાપસંદ છે: લા તકન્તુ મીર રહેમતીલ્લાહ યાને કે તમે લોકો અલ્લાહની રહેમતથી નિરાશ થશો નહીં (સુરએ જુમર, આયત: ૫૩).

રાવી બયાન કરે છે કે એક વખત, હું સાર્મા કોઈ કામ માટે ગયા હતો. વિચાર કયો' કે ચાલો, હો ઈઠ અલી નકી અઠની ઝીયારત પણ સાથમાં કરી લઉં. મલઉન મોતવક્કીલે અભ્યાસીનો ઝમાના હતો. તે ઝાલીમની મુસીબતોથી ઈમામ બીમાર પડી ગયા હતા. ઈમામે મને સવાલ કયો' કે તમારો ક્યાંનો ઈરાદો છે? મેં જવાબ આય્યો કે: મૌલા! શું કોઈ ખાસ કામ છે? ઈમામે ફરમાવ્યું કે: તમે કરબલાએ મોઅલ્લા જાઓ અને ત્યાં મારા દાદાની કષ્ટ પાસે હાજર થઈ મારી શક્તિ ખાતર તમે દુઆ કરો. રાવી ઈમામને વાયદો આપી સાર્મા શહેરમાં આવે છે. અલી ઈજને હીલાલ નામના એક માણસથી મુલાકાત થઈ અને તેણે પુછ્યું કે: ક્યાંથી આવી રહ્યા છો? રાવી કહે છે કે મેં બધી વાત તેમને બયાન કરી. તેમણે જવાબમાં કહ્યું કે: આ વાત મારી સમજમાં આવતી નથી. તેમનું ખુન હુસયનનું ખુન છે, તેમનું ગોશેત હુસયનનું ગોશેત છે, તેમનું સ્થાન, તેમનો દરજો, કરબલાથી વધુ બુલંદ, આ વાત તો બીલકુલ ખોટી છે કે તેઓ કરબલાની માટીથી પોતાની દુઆ મંગાવે! રાવી બયાન કરે છે કે: મેં કહ્યું કે તમારી વાત તો બીલકુલ સાચી છે, એમ બોલી હું પાછો દસમા ઈમામની ખીદમતમાં હાજર થયો.

અય ફરઝંદે રસૂલ! હમણા મને સાર્માહની બજારમાં અલી બીન હીલાલ મળ્યા. તેમનાથી વાતચીત કરતાં મને ખયાલ આય્યો કે શું તમારી વાત સમજવામાં મારી કોઈ ભૂલ તો નથી થઈને? આ સાંભળવું હતું કે ઈમામને જલાલ આવી ગયો અને ફરમાવ્યું કે: મને બતાવો કે શું હજરે અસવદ વધારે અફ્જલ છે કે મારા દાદા રસુલુલ્લાહ? મેં કહ્યું કે: હો રસુલે ખુદા સું.

તે વખત મૌલાએ ફરમાવ્યું કે: તો પછી શું કારણ છે કે હો રસુલે ખુદા સું ખાનએ કાઅબા પર પોતાનો હાથ રાખી, હજરે અસવદ પર પોતાનો હાથ રાખી દુઆ માંગે છે? તે તો જ્યાં દુઆ માંગે ત્યાં રસુલ છે! ઈમામે સમજાવ્યું કે ખુદાનો મકસદ એવો છે કે તે ખાસ એવા મકામ, એવી જગ્યા બતાવે કે જ્યાં દુઆ માંગવામાં આવે અને તે કબૂલ થાય. કરબલાની માટીનો એવો દરજો છે કે ત્યાં મારા માટે પણ દુઆ માંગવામાં આવે, હું પણ તેમજ ચાહું છું.

આખીરમાં, મૌલા અને આડા, ઈમામુલ કલામ, અમીરુલ મોઅમેનીન, હો અલી અઠ ની હદીસને, આપની ખીદમતમાં, તોહફા રૂપે અર્પણ કરી, આ વિષયને ખત્મ કરું છું:
તમારી દુઆ થકી બલાઓના તોફાનોને હડસેલી મુકો.

(જનાબ શેખ મહેમુદ અલ બોસતાની સાહેબનું દુઆ વિષયમાં પુસ્તક અને આયતુલ્લાહીલ ઓઝમા, સચ્ચદ મોહમ્મદ મકારેમ શીરાજીની તફસીરે નમુના આ લેખ તૈયાર કરવામાં મને બેહદ મદદરૂપ થયાં છે).

કુરાનમાં થી અંબીયાઓની તેમજ અન્ય થોડી ચુંટેલી દુઆઓ:

૧ - રજ્બના જલમના અનફોસના વ ઈન્લમ તગફીર-લના વ તર-હમના લનાકુ -
નના મેનલ ખાસેરીન :

(સૂરતુલ અસરાફ; આયત: ૨૩)

જ્યારે હો આદમ અને જો હવ્યા, સઉથી પહેલા ઈન્સાનોને પૈદા કરી, અલ્લાહે તેમને જન્મતમાં રહેવાનો હુકમ આપ્યો, ત્યારે તેમને એમ પણ સમજાવ્યું હતું કે ફ્લાણા જાડની પાસે જાવું નહીં, કારણકે તમે નુકસાન પામશો. જેવી રીતે કોઈને એમ કહેવામાં આવે કે રસ્તાપર દોડીને ચાલશો નહીં, તેમાં તમારો નુકસાન છે. અબુલબશર, હો આદમ અઠ, માઅસુમ નબી હતા, અને અલ્લાહ તરફથી આવેલા સર્વે અંબીયાઓ-પયગમ્બરો-રસુલો માઅસુમ હોય છે, તેમનાથી કોઈ કાળે કોઈ ગુનોહ થતો નથી. જે વખતે હો આદમ અને જો હવ્યાએ આ મકરૂહ કામ બજાવી, તે જાડમાંથી ખાંધું, તે વખતે અલ્લાહે તેમને અવાજ આપ્યો કે: શું મેં તમને આ જાડની બાજુમાં જાવાની મના કરી ન હતી? અને શું મેં તમને એમ કહ્યું ન હતું કે શર્યતાન બીલકુલ તમારો ખુલ્લો દુશમન છે?

તે સમયે, તેઓ બન્નોએ અરજ કરી (ઉપરોક્ત દુઆનો તરજુમો) કે:

અય અમારા પાલણહાર! અમે પોતાએ અમારા નફ્સ પર જુલ્મ કર્યો છે (અમને પોતાને અમે હાનિ પહોંચાડી છે) અને અગર તું અમને માફ કરશે નહીં અને અમારાપર દ્યા કરશે નહીં તો અમે બીલકુલ નુકસાન પામનારાઓમાંથી હશું.

આગળ સૂરતુલ બકરહની આયત નંબર ૩૭ માં ખુદા ફરમાવે છે કે: પછી આદમે પોતાના રબથી થોડાક શાઢો શીખી લીધા ત્યારે અલ્લાહે (તેના લીધે) તેમની તૌબા કબૂલ કરી લીધી. બેશક, તે ઘણોજ માફ કરનાર મહેરબાન છે.

તે કલેમાહ જેની બરકતથી ખુદાએ હો આદમની તૌબા કબૂલ કરી તે અસ્માએ પંજેતન યાને હો મોહમ્મદ સું, હો અલી અઠ, જો ફાતેમાહ અઠ, હો હસન અઠ અને

હો હુસયન અંઠ હતા (મૌલાના સચ્ચદ ફરમાનઅલી સાહેબ મર્હુમની તફસીરે કુરઆન માંથી, દેખો તફસીરે દુર્ભ મન્સુર સયુતી જિ. અવ્યલ, સફા ૧૬ સતર ૧ મતબૂઝાએ મીસ્ર)

૨ - રજ્બે ઈન્ની અગ્નિઓબેડા અન અસ-અલકા મા લયસ-લી બેહી ઈલ્મ વ ઈલ્લા તગફીરલી વ તરહમની અકુમ્ભેનલ ખાસેરીન :

(સૂરાએ હુદ; આયત: ૪૭)

જ્યારે અજાબનું તોફાન આવ્યું ત્યારે હો નુહ નબીએ અલ્લાહ પાસે પોતાના દીકરા માટે ફરીયાદ કરી કે તેને બચાવવામાં આવે કારણે ખુદાએ તેમની અહલ (ઓલાદ) ને બચાવી લેવાનો વાયદો આય્યો હતો. પરવરદિગારની ત્યાંથી જવાબ આવ્યો કે તે નાફરમાન ઓલાદ હોય, તેના માટે સવાલ કરવામાં આવે નહીં. જેથી કરીને હજરત નબીઉલ્લાહે બીજી વખત હાથો ઉઠાવી આ મુજબ દુઆ કરી:

અય મારા પરવરદિગાર! બેશક હું તારાથી એ વાતની પનાહ માંગું છું કે તારાથી એવી વાતનો સવાલ ન કરું કે જેની મને જાણ ન હોય, અને અગર તું મને માફ નહીં કરે અને મારાપર દયા નહીં કરે તો હું નુકસાની ભોગવનારાઓમાંથી થઈ જઈશ.

૩ - રજ્બીગ-ફીરલી વલે વાલેદયા વલેમન દખલા બયતેય મોઅમેનંવ વલિલ મોઅમેનીના વલ મેઅમેનાત :

(સૂરાએ નૂહ; આયત: ૨૮)

જો નૂહ નબીનું નામ અબ્દુલ ગાફિલ યા અબ્દુલ મલિક યા અબ્દુલ અબલા હતું. આપ હજરત પચ્ચાસ વરસ સુધી ખુદાના ખોદ માં રડ્યા કર્યું જેથી આપનું નામ નૂહ યાને નવહા કરવાવાળા પડી ગયું. આપની વય અઢી હજર વરસ સુધી પહોંચી હતી, જેમાં સાડા નવસો વરસ હીદાયત કરવામાં પસાર કર્યા. તેમની કોમવાળા તેમના ઉપર એવી રીતે પથ્થરો ફેક્તા કે તેઓ ઝખી થઈ બેહોશ થઈ જતા, પથ્થરોના નીચે દબાઈ જતા અને હો જલ્દીએ આવી તેમના શરીર પર પોતાની પાંખો મસળી તેમનો ઈલાજ કરતા હતા. રાતના પાછા ઘરે આવતા અને સુભણા ફરી તબ્લીગ શરૂ કરી દેતા. તોફાને નુહ અને કિશતીએ નુહ તો બહુજ મશહૂર છે. કિશતીની અંદર

જો નૂહ અને તેમની એક બીબી સાથે તેમના જાણ દીકરા: સામ, હામ, યાફેસ અને તેમની જાણ બીબીઓ અને બાકીના બોંતેર મોઅમીનો મળી, કુલ એંસી માણસો ઉપરાંત દરેક જાનવરના એક એક જોડા સવાર થયા હતા. જ્યાં અત્યારે મરજીદે કુફા છે ત્યાં આ નાવ બની હતી, ત્યાંથી તુફાનની શરૂઆત થઈ અને જુદી નામના સઉથી નાનામાં નાના પહાડ ઉપર આ કિશતી તુફાન બાદ ઠહેરી. આદમે સાની અને શયખુલ અંબીયાઅ,

હો નૂહ નબીયુલ્લાહે બધા મોઅમીનો માટે નેક દુઆ કરી કે:

પરવરદિગારા! મને અને મારા માં-બાપને અને જે મોઅમીન મારા ઘરમાં આવે તેને અને તમામ ઈમાનદાર મર્દ અને ઓરતને તું બક્ષિ આપ!

૪ - રજ્બીન સુરની બેમા કાળબૂના:

અય મારા પાલણહાર! મારી મદદ કર કારણકે આ લોકોએ મને જુઠલાવ્યો છે.

(સૂરાએ અલ મોઅમેનુન; આયત: ૨૬)

જ્યારે હો નૂહ નબીની કોમના સરદારોએ એમ કહ્યું કે: આ તો આપણા જેવો માણસ છે, તે એક પાગલ-દિવાનો છે, આપણી મુર્તિઓને જુડી સમજે છે અને તમે તેના મરણ ની રાહ જુઓ, ત્યારે નાઉમેદ થઈ નબીએ ખુદાએ તે પ્રમાણે અલ્લાહથી દુઆ કરી.

આગળ જતાં મજુકુર સૂરાની આયત નંબર ૩૮ ઉપર આજ વાક્યો, વિના ફેરફારે, પાછા આપણને મળશે કે જે હો સાલેહ પયગમ્બર અઠ ની ઝબાન મુખારકે ઉચ્ચાર્યા હતા.

હો નૂહ નબીના દીકરા જો સામની અવલાદમાંથી આઠમી પેઢીએ હો હુદ પયગમ્બર પયદા થયા હતા. જો સામના પૌત્રા આદ બીન અવસની અવલાદને કોમે આદ કહેવામાં આવે છે જેમની તરફ જો હુદ અઠ હિદાયત વાસ્તે મોકલવામાં આવ્યા હતા. બહુજ માલદાર, એકદમ ઉચ્ચા કદના અને ઘણી લાંબી વય રાખનાર, બની આદ જેવા માણસો દુનિયામાં હતા નહીં. નબીએ ખુદાને જુઠલાવ્યા જેથી અલ્લાહ તરફથી સઉ પ્રથમ ન્ના વરસ સુધી આસમાનથી વરસાદ વરસાતો બંધ થયો અને, તે છતાં, ઈમાન ન લાવવાથી, તેઓપર આખીરકાર ખુદાનો અજાબ નાજિલ થયો, જેથી પૂરી કોમ હલાક થઈ ગઈ.

તેમની બાદ હો સાલેહ પયગમ્બર આવ્યા કે જે હો નૂહ નબીના દીકરા જો સામ ના બીજા ફરજિયાની અવલાદમાંથી નવમી પેઢીએ અવતાર્યા હતા. જો સામના પૌત્રા સમુદ બીન આમીરની અવલાદને કોમે સમુદથી ઓળખવામાં આવે છે, જેમની તરફ જો સાલેહને નબી બનાવીને મોકલવામાં આવ્યા હતા. આ લોકો પણ, કોમે આદની જેમ બેહદ નાણાવાળા હતા. હિદાયત શરૂ કરી તે વખતે આપ ફક્ત સોળ વરસના હતા અને આપની વય એકસો વીસ વરસ સુધી પહોંચી ચુકી, પણ આ કોમ ઈમાન લાવી નહીં. તેમની માંગણી મુજબ, જો સાલેહ અઠમે પહાડમાંથી એક ઉટારી, બચ્ચાની સાથ, કાઢી મોઅજીઝો બતાવ્યો, જેને લોકોએ મરાવી નાંખી અને તેનું ગોશેત ખાઈ ગયા. તે છતાં, અલ્લાહના નબીએ તેમને લાખ સમજાવ્યા, તૌબા કરવાનું કહ્યું, પરંતુ તેમના ઈનકારપર ખુદાએ અજાબ ઉતાર્યો અને પૂરી કોમ બરબાદ થઈ ગઈ.

૫ - રજ્બે અન્જીલની મુન્જાલન મોખારકંવ વ અન્ત ખયરૂલ મુન્જેલીન :

અય મારા પરવરદિગાર! તું મને બરકતવાળી જગ્યાપર ઉતારજે અને તુંજ સૌથી સારો ઉતારનાર છો. (સૂરાએ અલ મોઅમેનુન; આયત: ૨૮)

અહીં જો નૂહ પયગમ્બરનો કહેવાનો મતલબ તે હતો કે જે વખતે અમે તોફાન પદ્ધી કશ્તીમાંથી ઉત્તરશું ત્યારે હે અલ્લાહ! અમે તારા મહેમાન હશું: ઝમીન, ઝાડ, ખાવું-પીવું કપડા, સવે' તારુંજ હશે, તું તો સારી મહેમાનદારી કરનાર અને બરકતદેનાર છો.

હો રસુલે ખુદા સુંમે જો અમીરૂલ મોઅમેનીન અલી અઠને ફરમાવ્યું હતું કે: જ્યારે તમે કોઈ સ્થળે પહોંચો ત્યારે ઉપરોક્ત આયત પડશો કે જેથી ખુદા તમને બરકત આપશો.

૬ - રજ્બીન સુરની અલલ કવમીલ મુફ્ફ્સેદીન :

(સૂરાએ અનકબુત; આયત: ૩૦)

જો લુત પયગમ્બર, હો ઈશ્વરાહીમ નબીના માસીઆઈ ભાઈ થતા હતા, ઉપરાંત તેમની બહેન, જો સારાહની શાદી હો ઈશ્વરાહીમ ખલીલુલ્લાહ સાથે થઈ હતી. તેમની કોમ, ઓરતોને છોડી, મર્દો થી ખરાબ કામ કરતી હતી. લગભગ નીસ વરસ સુધી તેમણે પોતાની કોમને હીદાયત કરી, પણ તેમની એક વાત માની નહીં. એટલે ખુદાએ ફરીશતાને મોકલ્યો જે તે શહેરને ઉપાડી ઉંઘું જમીનપર ફેંક્યું અને તમામે તમામ હલાક થઈ ગયા. તે પહેલાં જ્યારે હો લુત નબીએ તેમને ઘણા સમજાવ્યા ત્યારે તેમની કોમ પાસે આ સિવાય બીજો કશો જવાબ ન હતો કે: જો તું સાચાઓમાંનો હોય તો અમારા પર અલ્લાહનો અજાબ લઈ આવ. જો લુત અઠમે અરજ કરી કે (ઉપરોક્ત દુઆનો તરજુમો): અય મારા પરવરદિગાર! આ ફસાદખોરો વિરુધ્ય મારી મદદ કર!

૭ - રખ્ખન-ગઝીરલી વલે વાલેદયા વલીલ મોઅમેનીના યબ યકુમુલ હીસાબ:

(સૂરાએ ઈશ્વરાહીમ; આયત: ૪૧). હો ઈશ્વરાહીમ નબીની દુઆ:

અય અમારા પરવરદિગાર! તું મને તેમજ મારા માં-બાપ અને મોઅમેનીનને ક્યામતના હીસાબના દિવસે બક્ષી આપજો.

૮ - રખ્ખના તકજ્બલ મિના, ઈન્નકા અન્તસ્સમીઉલ અલીમ:

અય અમારા પરવરદિગાર! અમારી (આ ખીદમતને) કબુલ ફરમાવ, ખરેખર તુંજ (દુઆનો) સાંભળનાર અને (નીયતનો) જાણનાર છો.

(સૂરતુલ બકરહ; આયત: ૧૨૭)

અલ્લાહના ખલીલ, હો ઈશ્વરાહીમ પયગમ્બર શામમાં રહેતા હતા. તેમની બીબી જો સારાહથી તેમને પહેલાં કોઈ ઓલાદ ન હતી અને જો હાજરાથી જ્યારે નબી ઈસમાઈલનો જન્મ થયો ત્યારે હો ઈશ્વરાહીમ, પોતાના બેટા જો ઈસમાઈલ અને તેમની માં ને લઈ, ખુદાના હુકમથી, મકાના મયદાનમાં આવ્યા જ્યાં રેતી અને તુંગારો સિવાય કાંઈ ન હતું. હો ઈશ્વરાહીમ, તેમને અકેલા છોડી પાછા વતનમાં આવી ગયા. જ્યારે બીજી વખત, નબીએ ખુદા ફરી પધાયા ' ત્યારે ઘણી અજાયબીઓ જોઈ અને જે વખતે, જો ઈસમાઈલ જવાન થયા તો બન્ને બાપ-બેટા મળી, બયતુલ્લાહ ને તે જગ્યાએ બનાવ્યા જ્યાં હો આદમ અઠ માટે શરૂઆતમાં એક કુલ્લો નાઝીલ થયો હતો.

જ્યારે હો ઈશ્વરાહીમ નબી અઠ અને તેમના ફરાંદ હો ઈસમાઈલ પયગમ્બર અઠ ખાનએ કાઅબાનો પાયો ચણી રહ્યા હતા ત્યારે ઉપરોક્ત દુઆ માંગતા હતા.

કહે છે કે હો ઈશ્વરાહીમની નવાણુ વરસની વયમાં જો ઈસમાઈલની વિલાદત થઈ અને એકસો બાર વરસની ઉભ્ર માં જો ઈસહાક નબીનો જન્મ જો સારાહથી થયો.

૯ - રખ્ખના આતેના ફિદ્દુન્યા હસનતંવ વ ફીલ આખેરતે હસનતંવ વકેના અજાબનાર:

પછી જ્યારે તમે પોતાની હજની ક્ષીયાઓ પુરી કરી ચુકો ત્યારે અલ્લાહને એવી રીતે
યાદ કરો જેવી રીતે તેના ધણા બંદાઓ તે મુજબ કરે છે (મજુર દુઆની માયના):
અય અમારા પરવરદિગાર! તું અમને દુનિયામાં નેકી (નેઅમત) આપ અને
આખેરતમાં પણ નેકી (સવાબ) અતા કર અને અમને દોઝખના અજાબથી બચાવ.
(સૂરતુલ બકરહ; આયત: ૨૦૧)

- રજીજ - અલ્લી મોકીમસ્સલાતે વ મીન જુરરીયતી, રજબના વ તકજ્બલ દોઆઃ
અય મારા પાલણહાર! મને અને મારી અવલાદને નમાજના પાબંદ બનાવી દે,
અય મારા રબ! અને મારી દુઆને કબુલ ફરમાવ!
(સૂરે ઈબ્રાહીમ; આયત: ૪૦)

૧૦ - રજે કદ આત્યતની મેનલ મુલકે વ અલ્લમ-તની મીન તાઅવીલીલ
અહાદીસે ફાતેરસ્સમાવાતે વલ અર્જે' અન્ત વલીથી ફીદુનિયા વલ
આખેરાહ, તવફ્ફની મુસલેમંવ વ અલ હીકની બીસ્સાલેહીન:
(સૂરએ યુસુફ; આયત: ૧૦૧)

જ્યારે હ૦ યાકુબ નબીના બેટા, હ૦ યુસુફ પયગમ્બર અ૦ ને, બધી મુસીબતો
બાદ, મીર્ર (અઞ્જપ્ત) ની બાદશાહત નસીબ થઈ અને અલ્લાહે તેમને તેમના માં-બાપ
અને ભાઈઓથી મીલાવી આપ્યા ત્યારે હાથ ઉઠાવી રજ્બુલ ઈજજતને પુકારવા લાગ્યા:
અય મારા પરવરદિગાર! તે મને તારા મુલ્કમાંથી કંઈ આપ્યું અને મને સ્વજ્ઞાની
તાઅબીરનું ઈલ્મ પણ શીખવ્યું, અય આસમાનો તથા જમીનનો સર્જનહાર! તુંજ
દુનિયા અને આખેરતમાં મારો સરપરસ્ત-હાકીમ છે, તું મને (દુનિયાથી) મુસલમાન
ઉઠાવ અને તારા નેક બંદાઓમાં શામીલ કરી આપ.

૧૧ - રજીશ-રહલી સદરી વ યસ્સીર-લી અમરી વહલુલ ઉક-દતમ મિન લેસાની
યફ-કહુ કવલી:

(સૂરએ તા - હા; આયત: ૨૫, ૨૬, ૨૭, ૨૮)

ઇસરાઈલ ૪૦ યાકુબ પયગમ્બરનું નામ હતું અને તેમની ઓલાદ બની ઇસરાઈલથી
ઓળખાઈ છે. ૪૦ યાકુબ પયગમ્બર, હ૦ ઇસહાક નબીના દીકરા અને હ૦ ઈબ્રાહીમ
નબીના પૌત્રા થતા હતા. તેમને બાર ફરજિંદ થયા હતા જેમાંથી એકનું નામ હતું યુસુફ.
તેમના ભાઈ બીનયામીન અને બહેન દુનિયા એકજ માંથી અવતર્યા હતા અને બાકીના
દસ બેટા નણ માંની ઓલાદ હતી.

હ૦ યુસુફ નબી જ્યારે મીસર (અઞ્જપ્તના) હાકીમ બન્યા ત્યારે બની ઇસરાઈલનો
વસવાટ ત્યાં ખાતે થયો. મીસરના બાદશાહો ફીરઓનથી મશહૂર હતા. ફીરઓન

બની ઈસરાઈલનો મોટો દુશમન હતો કારણકે તેને જાણ હતી કે તેમાંથી એક બાળક પયદા થનાર છે જે ફીરઓની સલતનતની બરબાદી લાવશે. છતાં ૪૦ મુસા નબીની પયદાઈશ થઈ અને ફીરઓનના ઘરમાંજ પરવરિશ પામ્યા.

જ્યારે ૪૦ મુસા પયગમ્બરને અલ્લાહ તરફથી જાલીમ બાદશાહ ફિરઓનને હિદાયત કરવાનો હુકમ મળ્યો ત્યારે માઅબુદ્ધને સઉ પ્રથમ પુકારે છે:

અય મારા પરવરદિગાર! મારી છાતીને વિશાળ કર અને મારા કાર્ય ને મારા માટે આસાન બનાવ અને મારી જ્ઞબમાંથી તોતડાપણાની ગાંઠ ખોલી આપ કે જેથી તેઓ મારી વાત સમજે.

૧૨ - રહ્યના અફરિગ અલયના સભન વ તવફ્ફના મુસલેમીન:

અય અમારા પાલણહાર! અમારાપર સષ્ટુ-ધીરજનો (વરસાદ) વરસાવ અને અમને તારી ફરમાંબરદારીની હાલતમાં આ દુનિયાથી ઉઠાવી લે! (અમારું મોત ઈસલામ ઉપર કરજે) - સૂરએ અલ અસરાઈ; આયત: ૧૨૬ -

સુષ્ણાનલ્લાહ! કેવી દુઅા અને કેવી અસર! ફીરઓનના જાહુગરો સુષ્ણના ટાઈમે કાફર હતા, ૪૦ મુસા પયગમ્બરનો મોઅજ્ઝો જોઈ જોહરના સમયે ઈસલામ લાવ્યા, અસરના વખતે તેમના હાથ-પગ કાપવામાં આવ્યા, મગરીબના તેમને સુણીએ ચડાવવામાં આવ્યા અને જન્નતમાં પહોંચ્યા.

૧૩ - રહ્યીગફીરલી વલે અખી વ અદ્ખીલના ફી રહેમતીકા વ અન્ત અરહમુર રાહેમીન:

અય મારા પરવરદિગાર! તું મને અને મારા ભાઈને બક્ષી આપ અને અમને તારી રહેમતની અંદર દાખીલ કરી આપ અને તુંજ ઉત્તમ રહેમ કરનાર છો.

(સૂરએ અલ અસરાઈ; આયત: ૧૫૧)

જે વખતે ૪૦ મુસા અ૦ કોહે તુર પરથી ચાલીસ રાતો પસાર કરી પાછા તેમની કોમ તરફ આવ્યા તો જોયું કે તેઓ એક વાઇરડાની પુજા કરી રહ્યા છે, જેથી તેમને બહુજગુસો આવ્યો. તેમના ભાઈ હારુન કે જે તેમના વજીર અને માઅસુમ હતા, તેમને તેઓ તેમની પાછળ છોડી ગયા હતા, પણ, આ કોમ તેમની એક વાત માની નહીં, તેમને મારી નાંખવાની ધમકી આપી. તે પછી, ૪૦ મુસાએ ઉપર મુજબ દુઅા કરી હતી.

૧૪ - રહ્યે ઈન્ની જલમ્બો નફસી ફગ-ફીરલી

અય મારા પરવરદિગાર! ખરેખર મેં મારા નફસ ઉપર જુલ્મ કયો છે માટે તું મને (દુશમનોથી) છુપાવી આપ.

રહ્યે બેમા અન્યાન્ય અલય ફીરન અકુના ઝહીરલ લીલ મુજરેમીન:

અય મારા પરવરદિગાર! જ્યારે કે તેં મારાપર એહસાન કયું છે તો હું કદી ગુનેહગારોનો મદદગાર નહીં બન્નું.

રહ્યે નજ્જેની મેનલ કબ્રીજગાલેમીન:

અય મારા પરવરદિગાર! જાલીમોંના પંજાથી મને નજીત અતા કર!

(સૂરાએ અલ કસસ; આયત: ૧૬-૧૭-૨૧)

એક દિવસ, ૪૦ મુસા નબી, કોઈ શહેરમાં પહોંચ્યા. શું જોયું કે બે માણસો ત્યાં આપસમાં ઝડપી રહ્યા છે. તેમાંથી એક આપનો શીઆહ-મોહીબ, જે બની ઈસરાઈલમાંથી હતો અને બીજો આપનો દુશમન જે કિંબતીઓમાંથી-એજાપનો હતો. શીઆહે આપની મદદ ચાહી, તેથી કણ્ણો ખત્મ કરવા માટે થઈને ૪૦ મુસાએ કિંબતીને એક ઠોંસો માયો' અને તે મરણ પામ્યો.

૪૦ મુસાએ કોઈ ગુનોહ કર્યો'ન હતો બલકે મોઅમીનની સહાયમાં કાફીરને ફક્ત એક ઘુસ્તો માયો' હતો. એક ઠોંસાના ઘાથી મરી જવું તે અચાનક હતું, જે આપનો કોઈ ઈરાદો ન હતો.

૪૦ મુસાનું એમ કહેવું કે મેં મારા નફ્સપર જુલ્મ કર્યો છે તે મજકુર કારણના લીધે ન હતું બલકે એવા ખયાલથી હતું કે તેઓ આ શહેરમાં આવ્યા અને તેમનાથી આ કામ થઈ ગયું જેના લીધે લોકો આપના દુશમન બની ગયા અને જાનનો જોખમ છે.

૪૦ ઈઞ્ચે અભ્યાસથી મનકુલ છે કે આ ૧૬ નંબરની આયતથી સાબીત થાય છે કે ગુનેહગારોની મદદ કરવી ગુનોહ છે અને મોઅમીનની મદદ કરવામાં સવાબ છે.

આગલા દિવસે જે શીઆહે આપની પાસે સહાય ચાહી હતી તે ફરી પાછો બીજા કિંબતી સાથે લડવા લાગ્યો અને આપને મદદ માટે પોકાર્યો. અલ્લાહના નબીએ તે વખતે તેમને જવાબ આપ્યો કે: ખરેખર, તારા સ્વભાવમાં-અખલાકમાં ધિરજ-સંભ્રન્થી, જેથી તું તારા નેક કાર્ય'થી ગુમરાહ છો.

જ્યારે ૪૦ મુસા અઠમે ઈરાદો કર્યો' કે તે કિંબતી ઉપર હાથ ઉપાડે તે વખતે તેણે કહ્યું કે: અય મુસા! ગઈ કાલે તેં એક માણસને મારી નાંખ્યો હતો, શું હવે તું મને પણ મારી નાંખવા ચાહે છ? શું આ ભૂમિપર તું એક મોટો જાલિમ બનવા ઈચ્છે છે, પરંતુ એક સુલેહ કરનાર ઈન્સાન નહીં?

તેની વાત સાંભળીને નબીએ ખુદા પોતાનો હાથ રોકી લીધો અને મજકુર કિંબતી દોડીને તરત આ બનાવ રાજ અમલદારોને બતાવ્યો, જેના લીધે હ૦મુસા અ૦ ને કંતલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ હકિકતથી વાકેફ થઈ, ૪૦ હિઝકીલ (મોઅમીને આલે ઝીરઓન) ૪૦ મુસા પાસે આવ્યા અને સંલાહ આપી કે આ ગામ દોડીને ચાલ્યા જાય. પયગમ્બરે ખુદાએ એમજ કયું' અને ૨૧ નંબરની દુઆ પડતાં આપ મદયન તરફ પહોંચ્યા.

૧૫ - રખ્બે હબલી મીલદુન્કા ઝુરરીયતન તથ્યેબાહ; ઈન્કા સમીઉદ્દુઆ:

અય મારા પરવરદિગાર! તું મને પોતાની પાસેથી કોઈ પવિત્ર અવલાદ આપ,
બેશક, તું દુઆનો સાંભળનાર છો.

(સૂરાએ આલે ઈમરાન; આયત: ૩૮)

૪૦ ઝકરીયા પયગમ્બર, ૪૦ મરીયમ ના બનેવી અને હ૦ ઈસા નબીના માસા થતા
હતા. તેઓ ૪૦ સુલયમાન નબીના વંશમાંથી હોય, બયતુલ મુકદ્દસની ઝીદમતો તેમને
સૌપવામાં આવી હતી. જ્યારે ૪૦ ઝકરીયા અફાણુ વરસના (૮૮), તેમની બીબીની

જેમ, ઘણા ઘરડા થઈ ગયા અને અવલાદ થવાની કોઈ આશા રહી નહી ત્યારે નબીએ ખુદાના હાથ અલ્લાહના દરબાર તરફ દુઆ માટે ઉઠ્યા, માલિકે તેમની પુઢાર સાંભળી અને ૪૦ યહ્યા નામનો એક દીકરો ઈનાયત કર્યો જે પણ અલ્લાહના નબી હતા.

૧૬ - રખ્ખના અન જીલ અલ્લાહના માએદતમ મેનસ્તમાએ તકુનો લના ઈદલ લે અવ્યલેના વ આખેરેના વ આયતમ મિન્ક, વરજુકના વ અન્ત ખ્યરુર રાઝેકીન :

(સૂરતુલ માએદાહ; આયત: ૧૧૪)

અય મારા પરવરદિગાર! અમારા પર આસમાનથી ખોરાક ઉતાર કે જે અમારા પહેલાં તથા પાછળનાઓ માટે ઈદ ઠરે તેમજ તારા તરફથી એક નિશાની રહે અને અમને રોજ આપ અને તું સર્વેથી ઉત્તમ રોજ પહોંચાડનાર છો.

આની અગાઉ કુરાને મજૂદની ૧૧૨ અને ૧૧૩ નંબરની આયતોમાં ખુદા ફરમાવે છે કે: જ્યારે હવારીઓએ કહ્યાયુઃ અય મરીયમના પુત્ર! શું તારા રથથી આ થઈ શકે છે કે અમારા માટે આસમાનથી માએદાહ (નેઅમતથી ભરેલો થાળ) ઉતારે? હું ઈસા નબીએ જવાબ આપ્યો કે અગર તમે સાચા મોઅમીન હો તો એવી માંગણી કરતાં અલ્લાહથી ડરો. તેમણે અરજ કરી કે અમે તો એ ચાહીએ છીએ કે તેમાંથી ખાઈએ અને તમારી રીસાલત માટે અમારા મનનું સમાધાન થઈ જાય અને અમે જાણીએ છીએ કે તમે અમને સાચું કહ્યાયું અને તેના અમે સાક્ષી બની જઈએ. તે વખતે ૪૦ મરીયમ બીજે ઈમરાનના દીકરા, હું ઈસા રૂહુલ્લાહે ઉપરોક્ત દુઆ કરી.

જે બાર વ્યક્તિઓ સઉ પ્રથમ હું ઈસા અઠ ઉપર ઈમાન લાવી તે હવારીયોથી ઓળખાઈ છે. તે શબ્દ « હુર » માંથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે: ચોખું સફેદ. એના ઘણા કારણો બતાવવામાં આવ્યા છે જેમાંથી વધુ સહીહ તે હોય શકે છે કે: તેઓ પોતાના આત્માને શુધ્ય-પવિત્ર રાખતા હતા અને લોકોને નસીહત કરીને ગુનાહોના મેલથી પાક કરતા હતા.

૧૭ - રખ્ખના આમના બેમા અન્જલતા વત્તબઅનર રસૂલા ફક-તુખના મઅશશાહેદીન:

(જ્યારે હું ઈસા નબી પોકાર્યા કે: કોણ એવો છે કે જે અલ્લાહના માર્ગ માં મારી મદદ કરે? તે વખતે હવારીયોએ તેમને ખુશી ભર્યો જવાબ આપી ખુદા પાસે અરજ કરી કે): અય અમારા પરવરદિગાર! જે તેની નાઝીલ કર્યું છે તેનાપર અમે ઈમાન લાવ્યા છીએ અને અમે (તારા) રસૂલ (ઈસા)ની તાબેદારી ઈખતેયાર કરી છે, બસ તું અમને (તારા રસૂલ) ના શાક્ષીઓના દફ્તરમાં લખી આપ.

(સૂરાએ આલે ઈમરાન; આયત: ૫૧થી૫૭)

હું ઈસા નબી, હું ઈશ્રાહીમના ફરજિંદ ૪૦ ઈસહાક પયગમ્બરના વંશમાંથી હતા.

હું મોહમ્મદ સ૦, હું ઈશ્રાહીમના મોટા દીકરા ૪૦ ઈસમાઈલની અવલાદથી હતા.

૧૮ - રખ્ખના આતેના મીલ-લદુન-કા રહમતંવ વહ્યયેઅ-લના મિન અમરેના રશદા:

(સૂરાએ કહછ; આયત: ૧૦)

અસહાબે કહછ, હો રસુલે ખુદા સ્તો અને હો ઈસા નબીના જમાના દરમીયાન હતા. તેઓ છ મોઅમીનો હતા. દક્યાનુસ નામનો જાલીમ અને કાફર બાદશાહથી છુટવા માટે થઈને ગામ બહાર જઈ, એક ગારની અંદર દાખલ થયા અને જબાનથી બેસાખા બોલી ઉઠ્યા: હસબોનલ્વાહો વ નેઅમલ વકીલ: અમારા વાસ્તે અલ્વાહ બસ છે અને તે અમારો મહાન ઝીમેદાર છે.

જંગલનો એક ગોવાળ હતો જે રસ્તામાં મળ્યો, તેમના પર ઈમાન લાવ્યો નહીં, પરંતુ કીતમીર નામનો તેનો કુતરો તે લોકો સાથે ભળી ગયો, એટલે સુધી કે આ ગારની બહાર તેમની ચોકી ખાતર બેસી ગયો. અલ્વાહે તે લોકોને બચાવી નીંદમાં સુવડાવી દીધા. બાશાહે તે જગ્યા ઉપર એક તખ્તી, તેમના નામની સાથે, લગાવી, જેથી તેઓ અસહાબે રકીમ (તખ્તીવાળા)થી અથવા અસહાબે કહછ (ગારવાળા)થી ઓળખાય છે.

જ્યારે ગારમાં પહોંચ્યા ત્યારે અલ્વાહ પાસે આ મુજબ યાચના કરી:

અય અમારા પરવરદિગાર! તું તારી બારગાહમાંથી અમને તારી રહેમત ફરમાવ

અને અમારા કામમાં અમને કામિયાબી ઈનાયત કર.

આ કુતરા માટે કહેવાય છે કે કોઈ ખત, ટપાલ અથવા ચીજ ઉપર તેનું નામ: કીતમીર લખી રવાના કરવામાં આવે તો ગુમ થવાથી ખુદા રક્ષણમાં રાખે છે.

૧૯ - વ અચ્યુબા ઈજ નાદા રબ્બહુ અન્ની મસ્સ-નેયજ-ગુરરો વ અન્ત
અરહતુર રાહેમીન :

(સૂરાએ અલ અભીયાઅ; આયત: ૮૩)

જો અચ્યુબ પયગમ્બરને ખુદાએ ઘણો માલ, ખેતી, બાગ, ગાય-બકરા, જાનવર,
નોકરો, અવલાદ અને જો રહેમત જેવી નેક બીબી અર્પણ કર્યો હતો કે જે જો યુસુફ
ની દીકરી ફરાહીમની બેટી રહીમા હતી. આ બધું નાશ થયું, ફક્ત બીબી રહી ગયા.
પોતે પણ ઘણા બીમાર પડ્યા. હવે અલ્વાહ ફરમાવે છે કે:

અને (અય રસુલ!) અચ્યુબ (નો ડિસ્સો યાદ કર કે) જે વખતે તેણે પોતાના
પરવરદિગારને પોકાર્યો કે બેશક મને ઘણી મુસીબતો પહોંચી ચુકી છે અને તું સવે
દ્યા કરનારાઓ કરતાં ઉત્તમ દ્યા કરનાર છો.
તેમની દુઅા કબૂલ થઈ અને ખુદાએ તેમને પહેલાં કરતાં પણ વધુ નેઅમતાં સૌંપી.

૨૦ - લાઅલાહ ઈલ્હા અન્ત સુભ્ષાનકા, ઈન્ની કુન્તો મેનજાલેમીન; ફસ્તજ્ઞના
લહુ વ નજજ્યનાહો મેનલ ગમ્મે, વ કાલેકા નુનજિલ મોઅમેનીન:

(સૂરાએ અંબીયાઅ; આયત: ૮૭/૮૮)

હો યુનુસ બીન મતા, જેમનું કુરઆનમાં જુન્નુન નામ આવ્યું છે, અલ્વાહ તરફથી રસુલ
બનીને, શ્રીસ વરસની ઉમ્ર માં, નયનવાની વસ્તીની હીદાયત અથે આવ્યા હતા અને
લગભગ પાંશ્રીસ વરસ સુધી તબલીગ કરી, પરંતુ બે માણસો સિવાય કોઈ ઈમાન લાવ્યું
નહીં.

અલ્લાહનો અજાબ નાજીલ થવા અગાઉ, બેમાંથી એક ઈમાન લઈ આવનાર જે આલિમ હતો, તે તમામ વસ્તીને, ગામ બહાર લઈ ગયો અને બચ્ચાઓને તેમની માંથી, બુઢાઓને જવાનોથી જુદા કરી, બધાને તૌબા કરવા, રડી રડીને દુઆ કરવા ભલામણ કરી. લોકોએ એમજ કર્યું અને અજાબ આવતાં બધાએ જોયું, પણ તે દુઆ ની સામે ટકી શક્યું નહીં.

૪૦ યુનુસ પયગમ્બરને જ્યારે દરીયાઈ માછલીએ પોતાના પેટની અંદર લઈ લીધી તે વખતે આપ ત્યાંના અંધકારમાં પોકારવા લાગ્યા કે (દુઆનો તરજુમો):

(અય મારા પરવરદિગાર!) તારા સિવાય કોઈ માઅબુદ નથી, તું પાક છો, બેશક હું પોતેજ જુલ્દ કરનારાઓમાંથી છું; આથી અમોએ તેની દુઆ કબુલ કરી લીધી અને તેને તે મુસીબતમાંથી છુટકારો આપ્યો અને અમે મોઅમેનીનોને એવીજ રીતે છુટકારો આપ્યા કરીએ છીએ.

કહે છે કે ૪૦ યુનુસ અ૦ જ્યારે માછલીના પેટની અંદરથી બહાર આવ્યા ત્યારે લગભગ ચાલીસ દિવસો બાદ પોતાની કોમ પાસે પહોંચ્યા. પૂરી કોમ તેમનાપર ઈમાન લાવી અને ૪૦ યુનુસ નબી અ૦ તેમની વચ્ચે આનંદથી રહેવા લાગ્યા.

આ જગ્યાએ બરાબર સમજવાનું છે કે જેમ ૪૦ યુનુસ નબીની દુઆ સ્વીકારવામાં આવી, એજ મુજબ, જ્યારે તેમની કોમ, સાચા અને સાફ દિલથી તૌબા માંગી, કાકલુદી કરી, આંસુ સારી, કરગરવા લાગી અને નબીએ ખુદા ઉપર ઈમાન લાવી તો, અલ્લાહ આદીલ અને ઈન્સાફી હોય, તેમની દુઆ પણ કબુલિયતના દરજે પહોંચ્યી.

૨૧ - રજબે લા તજરની ફરદંવ વ અન્ત ખયરુલ વારેસીન :

(સૂરાએ અંબીયાએ; આયત: ૮૮)

અલ્લાહ સુભાનહુ વ તથાલા પોતાના હબીબને કહી રહ્યો છે કે: (અય રસુલ!)

અને ઝકરીયાને (યાદ કરો જ્યારે ઝઈફીમાં, નિરાશ અને નાઉમેદ થઈ), તેણે પોતાના પાલણહારથી યાચના કરી કે:

અય મારા પરવરદિગાર! મને એકલો (બે અવલાદ) છોડ નહીં અને તું સરુથી બેહતર વારીસ છો.

તે સમયમાં અમે તેની દુઆ કબુલ કરી લીધી અને યહ્યા નામનો ફરજંદ તેમને અતા કર્યો કે જે પણ અલ્લાહના એક નબી હતા.

૨૨ - રજબના અફરિગ અલયના સભ્યન વ સભ્યિત અકદામના વન્સુરના અલલ કવમિલ કાફેરિન :

અય અમારા રબ! અમને મજબુત સભ્ય અતા કર અને (મયદાને જંગમાં) અમારા પગ જમાવી રાખ અને અમને કાફીરો ઉપર વિજયી બનાવ (ફેટ આપ).

(સૂરતુલ અલ બકરહ; આયત: ૨૫૦)

૪૦ મુસા નબીના ઈન્નેકાલ બાદ, જ્યારે બની ઈસરાઈલ ધર્મની ઠેકડી ઉડાવવા લાગ્યા અને ૪૦ શમૃઈલ પયગમ્બરની વાત માની નહીં તે વખતે ખુદાએ જાલુત નામના

બાદશાહને તેમનાપર હુકુમત આપી. તેણે ચડાઈ કરી કબજો લઈ લીધો, તેમને લુંટી લઈ કેટલાંકને કત્લ કર્યો અને કેટલાંકને શહેરથી બાહેર કાઢી મુક્યા અને તેમની ઓલાદને ગુલામ બનાવી. લોકો હયરાન થઈ ૪૦ શમૂઈલ નબીના દરવાજાપર આવ્યા અને અલ્લાહ પાસે દુઆ માંગવાની ફરિયાદ કરી. તેમની તમજ્જ્ઞા મુજબ, નબીએ ખુદાએ દુઆ કરી અને તાલુત નામના માણસને આ બાદશાહત મળી.

તાલુત, ૪૦ યુસુફના સગા ભાઈ, બુન્યામીનની ઓલાદમાંથી હતા. તેઓ બહાદુર, ઈમાનદાર અને આલિમ હતા, પણ તેમની પાસે દુનિયાનો માલ નહીં હતો, તેથી બની ઈસરાઈલ તેમને પસંદ કરતા નહીં.

જ્યારે જાલુત અને તાલુત વચ્ચે લડાઈ જામી ત્યારે ૩૧૩ માણસો સિવાય બધા ભાગી ગયા અને તેઓ ઉપરોક્ત દુઆ થકી અલ્લાહની મદદ માંગી. તાલુતે બની ઈસરાઈલને કહ્યું કે: જે માણસ જાલુતને કત્લ કરશે તેને હું મારી અધી 'બાદશાહત ઉપરાંત મારી દીકરી શાદીમાં આપીશ. ૪૦ શમૂઈલ નબીએ બતાવ્યું કે તે હી યાકુબ નબીની ઓલાદમાંથી હશે. હી દાઉદ અઠ રસ્તામાંથી માણ પથ્થરો ઉઠાવ્યા, તેમાંથી એક પથ્થર ગોફણમાં રાખી તેની તરફ ફેંક્યો, જે માથામાં લાગવાથી તે મરણ પામ્યો, સાથમાં બીજા ઘણા માણસો પણ ધાયલ થયા અને ઝોજ ભાગી છુટી. આ મહાન વિજયના બદલામાં ૪૦ દાઉદને સલતનત મળી અને તાલુતના જમાઈ પણ થયા.

૨૩ - રહ્બે અવગેઅની અન અશકોર નેઅમતેકલ્લતી અન અમ્તા અલય વ અલા વાલેદ્યા વ અન અઅમલા સાલેહન તરજાહો વ અદખીલની બેરહમતેક ઝી એબાદેકસાલેહીન :

(સૂરાએ નમ્ના; આયત: ૧૮)

હી દાઉદ પયગમ્બર કે જેમને ઝબુર નામની કીતાબ મળી હતી, તેમના દીકરા, ૪૦ સુલયમાન નબીને અલ્લાહે એવી મોટી બાદશાહતના માલિક બનાવ્યા હતા કે જેના જેવી ન કોઈને મળી છે, ન મળશે. આપ લગભગ સાતસો વરસ સુધી સલતનત ભોગવી હતી. ઈન્સાનો-જીનાતો-જાનવરો-પંખીઓ-જાડ-હવા-દુનિયાની દરેક ચીજ તેમની હુકુમતને તાબે હતી. એક દિવસ, જ્યારે તેઓ કીડીઓની ખીણમાં પહોંચ્યા ત્યારે તેના એક સરદારને તેની ઝોજને કહેતાં સાંભળ્યા:

અય કીડીઓ! તમે તમારા દરોમાં ઘુસી જાઓ, કયાંક એવું ન બને કે સુલયમાન તથા તેમનું લશકર તમને કચડી નાખે અને તમને તેની જાણ પણ ન થવા પામે.

જેથી ૪૦ સુલયમાન પયગમ્બરે તેની વાતપર થોડા મલકાઈને હસી પડ્યા અને અરજ કરવા લાગ્યા (ઉપરોક્ત દુઆના શબ્દો):

અય મારા પરવરદિગાર! જે નેઅમતો તેં મારા ઉપર તથા મારા માં - બાપ ઉપર ઉતારી છે તેનો આભાર (શુકુ) માનવાની મને પ્રેરણા આપ અને (એવું પણ કર કે) હું કોઈ એવું નેક કાય' કરું કે જે તું પસંદ કરે (કે જેનાથી તું રાજ રહે) અને તારી દયાથી (રહેમતથી) મને તારા સદાચારી-નેક બંદાઓમાં દાખલ કરી લે.

૨૪ - રજબનઈ-તહ બયન-ના વ બયના કવમેના બીલ હક્કે વ અન્ત ખ્યરૂલ
ફાતેહીન :

(સૂરતુલ અસરાદ્ધ; આયત: ૮૮)

જો શોઅયબ પયગાખર, હો ઈછાઈમ નબીની અવલાદમાંથી હતા, મદાયનની વસ્તી
તરફ આપને મોકલવામાં આવ્યા હતા અને હો મુસા નબીના સસરા થતા હતા. જો
મુસા આઈ વરસ સુધી જો શોઅયબની ત્યાં બકરા ચરાવવાનું કામ કર્યું અને તેમની
દીકરી જો સફુરા સાથે આપની શાદી થઈ. પોતાની બીબીને લઈ જો મુસા મીસર
(એજાપ) ચાલ્યા ગયા. હો મુસા કલીમુલ્લાહ જે લાકડીથી મોઅજ્જા બતાવતા હતા
તે જો શોઅયબની અર્પણ કરેલી હતી.

મદાયનવાળાઓમાં બે બુરી આદતો હતી: એક લુંટફાટ કરવી અને બીજી તોલમાપમાં
લોકોથી વધારે લેવું અને ઓછું આપવું. જો શોઅયબ અઠની કોમ ગણનીમાં ઓછી હતી,
પણ બહુજ માલદાર અને મગરૂર હતી. નબીએ ખુદાએ લાખ સમજાવ્યા, પરંતુ તે
લોકો ઈમાન લાવ્યા નહીં, બલકે જો શોઅયબને પણ ડરાવવા લાગ્યા જેથી તેમને
ધરતીકુંપે પકડી લીધા અને નાશ પામ્યા. તેમની કોમ ઉપર ખુદાનો અજાબ ઉત્તરે, તે
પહેલાં, જો શોઅયબે હાથો ઉઠાવી દરબારે ઈલાહીમાં પુકારવા લાગ્યા (પ્રસ્તુત દુઆનો
તરજુમો):

અય અમારા પરવરદિગાર! તુંજ અમારી અને અમારી કોમની દરમીયાન હકની સાથે સારો
ફેસલો કરી આપ અને તુંજ સર્વેથી ઉત્તમ ફેસલો કરનાર છો!

૨૫ - રજ્બીર હમ હોમા કમા રજ્બ્યાની સગીરા :

(સૂરાએ બની ઈસરાઈલ; આયત: ૨૪)

અય મારા પરવરદિગાર! આ બન્ને (મારા માં-બાપ) ઉપર એવીજ રીતે રહેમ કર
કે જેવી રીતે તેઓએ મને નાનપણમાં ઉછેરવામાં કરી હતી.

આ આયતમાં હો નબીએ કરીમ સ૦ ને સંબોધને થઈ રહ્યો છે, પણ તેથી મુરાદ
તેમની ઊભૂતના લોકો છે.

૨૬ - હસબે યલ્લાહો લાએલાહ ઈલ્લાહોવ, અલયહે તવક્કલતો વ હોવા રજ્બુલ

અરશિલ અજીમ:

(સૂરતુતતવબાહ; આયત: ૧૨૮)

(અય રસુલ! તું કહે કે) મારા માટે તો અલ્લાહ બસ છે, તેના સિવાય કોઈ માઅબુદ
નથી, મેં તેના ઉપરજ ભરોસો રાખ્યો છે અને એજ મહાન અર્શ નો માલિક છે.

૨૭- રજબના લા તોઆખીજના ઈન્નસીના અવ અખતઅના:

અય અમારા પરવરદિગાર! અગર ભૂલથી (ચૂકી જવાથી) અથવા અમારા વાંક થકી
અમે ગુનાહ કરીએ તો તું અમારી પકડ કરીશ નહીં.

(સૂરતુલ બકરહ; આયત: ૨૮૬ પહેલો ભાગ)

આની પહેલાં ખુદા ફરમાવે છે કે: રસુલ (તે ચીજના સત્ય હોવા ઉપર) ઈમાન રાખે છે જે કાંઈ તેના રબ તરફથી તેના ઉપર ઉતારવામાં આવ્યું છે અને મોઓમેનીન પણ. તે પછી, બધી સીફ્થો બયાન કરી, માઅબુદ આપણાને તેની પાસે દુઅા માંગતા શીખવે છે.

૨૮ - રજબના વલા તહમિલ અલયના ઈસરન કમા હમલાહુ અલલ લજીના મિન કળેના:
 અય અમારા પરવરદિગાર! તું અમારાપર એવો ભાર ન રાખ જેવો તેં અમારા પહેલાં લોકો ઉપર રાખ્યો હતો.
 (સૂરતુલ બકરહ; આયત: ૨૮૬ બીજો ભાગ)

૨૯ - રજબના વલા તોહમીલના માલા તા-ક-ત-લના બેહી વ અઝો અન્ના વગ-ફીર-લના વર-હભના અન્તા મવલાના ફન્સુરના અલલ કબીલ કાફીના:
 અય અમારા પરવરદિગાર! એવો ભાર અમારાથી ઉઠાવ નહી કે જેને ઉપાડવામાં અમારી પાસે શક્તિ ન હોય અને અમારી ભૂલોથી દરગુજર કર અને અમારા ગુનાહોને માફ કરી આપ અને અમારાપર રહેમ ફરમાવ, તુંજ અમારો માલિક-મૌલા છો, માટે તુંજ કાફીરોના મુકાબલામાં અમારી મદદ કર.
 (સૂરતુલ બકરહ; આયત: ૨૮૬ આખરી ભાગ)

૩૦ - વતો ઈજી મન તશાઓ વતો જીલ્લો મન તશાઓ, બે યદેકલ ખયરો, ઈન્નકા અલા કુલ્લે શયઈન કદીર :
 (સૂરએ આલે ઈમરાન; આયત: ૨૬).
 રસુલે ઈસલામને ખુદા વતિ હુકમ થઈ રહ્યો છે કે તું આ પ્રમાણે બોલ્યા કરાયા (અને ફક્ત આયતનો બીજો ભાગ અહી પેશ થયો છે).....
 (અય ખુદા! બધી દુનિયાઓનો માલિક!) તું ચાહે તેને ઈજીત આપે છે અને ચાહે તેને બેઇજીત-બેઆબરુ કરે છે, તારા હાથમાંજ તમામ ભલાઈ છે, બેશક તું દરેક વસ્તુ ઉપર પુરેપુરો શક્તિમાન છો.

૩૧ - રજબે અદ-ખીલની મુદ્ભલા સીદ્ધીંવ વ અખરીજની મુખર-જા સીદ્ધીંવ વજ-અલ્લી મિન લદુન્કા સુલતાનન નસીરા :
 (સૂરએ બની ઈસરાઈલ; આયત: ૮૦)
 અય મારા પરવરદિગાર! તું મને(જ્યાં) પહોંચાડે ત્યાં સારી રીતે પહોંચાડી આપ અને (જ્યાંથી) તું મને કાઢે ત્યાંથી સારી રીતે કાઢજે અને મને ખાસ તારા તરફથી એક એવી હુકુમત અતા કર કે (જેને હર કીસમની) મદદ પહોંચે.
 જો ઈજને અખાસથી રિવાયત છે કે જ્યારે હું રસુલે ખુદા સર્વમે મકાથી હીજરત કરી મદીના તરફ રવાના થયા તો ખુદાએ આ હુકમ પહોંચાડ્યો કે: (અય રસુલ!)

તું આ મુજબ દુઅા માંગ્યા કર અને આપ હજરત સુંમે આ દુઅા કરી જેને હક સુખાનહુ વ તાલાએ કબુલ કરી લીધી, તેમજ સાચી પણ કરી બતાવી કે જ્યારે હીજરી સન આઠમાં, મકા ફેદ થયું ત્યારે આપ ખાનએ કાબામાં તશરીફ લાવ્યા, તેના પર લાગેલી ઉદ્દો બુતો-મુતી'ઓને તોડી, તેને પાક કર્યું અને સઉથી મોટી મુતી' કે જેનું નામ હબલ હતું, તેને તોડી જમીનદોસ્ત કરવા અથે', આપણા મૌલા અને આકા, અમીરુલ મોઅમેનીન, હુ અલી અઠને પોતાના પવિત્ર ખભા ઉપર સવાર કરાવ્યા. તે વખતની હાલત બયાન કરતાં, મૌલા અલી અઠ ફરમાવે છે કે: મેં મને પોતાને એવો બલંદ પાખ્યો કે અગર ચાહતે તો આસમાનને પકડી લેત!

મકા શરીફ, આપના વતનમાં, અલ્લાહના ઘારા હબીબે, મુસીબતો વેઠી, તેર વરસ સુધી, હીદાયત કરી અને હીજરતની રાતના જ્યારે આપ મદીનએ મુનવ્વરાહ ભાણી રવાના થયા ત્યારે હુ અલીએ મુરતજા અઠને પોતાની પથારી પર સુવળાવી ગયા. આપણા મૌલાએ, તે વખતે જે શબ્દો ઉચાર્યા કે: યા રસુલીલ્હાહ! શું મારા સુવાથી આપની જાન બચ્યો જશે? તે માઅબુદ્ધને બહુજ પસંદ આવ્યા. અને પોતાની જાન વેચી અલ્લાહની મરજ ખરીદ કરી લીધી, તેના માટે અલ્લાહ પોતાની પાક કિતાબ કુરાને મજુદની અંદર, ફષ્ટ ની સાથે, સુરએ બકરહની ૨૦૭ નંબરની આયતમાં વખાણ કરે છે. તે રાતના આપ એવી રીતે પોઢી ગયા કે ઝીદગીમાં કદી પાછી એવી નીદ કરી નહીં.

૩૨ - રજબે ઝીદની ઈલમા :

(સૂરાએ તા - હા; આયત: ૧૧૪ની આખરી)

હુ રીસાલત માબાબ સું ને અલ્લાહ તરફથી ખીતાબ થઈ રહ્યો છે કે:

(અય રસુલ! અને તું કહે કે:) અય મારા રબ! તું મારા ઈલમાં વધારો કર!

૩૩ - રજબના લા તોઝિંગ કોલૂબના બાઅદા ઈજ હદ્યતના વ હજબના મિલલદુન્ડા

રહમાહ; ઈન્નકા અન્તાલ વહૃહાબ:

(તેઓ દુઅા માંગે છે) અય અમારા પરવરદિગાર! જ્યારે તેં અમને ખરો માર્ગ દેખાડ્યો (હીદાયત કરી) તો પછી અમારા દિલોને ફેરવીશ નહીં અને પોતાની પાસેથી અમને (ખાસ) રહેમત અર્પણ કર; બેશક તું સધળું આપનાર છો.

(સૂરાએ આલે ઈમરાન; આયત: ૮).

આની અગાઉ, અલ્લાહ ફરમાવે છે કે: કુરાનની ચોખા અર્થવાળી આયતો (મોહકમ)

અને છુપા તેમજ અનેક અર્થવાળી આયતો (મોતશાબેહ) ફક્ત અલ્લાહજ જાણે છે

અને તે લોકો કે જેઓ રાસેખુન ફીલ ઈલમ છે યાને ઈલમની અંદર ઉંડાણમાં પાકા

ઉત્તેલા છે કે જેઓ એમકહે છે કે: અમે આ આયતો ઉપર ઈમાન રાખીએ છીએ, જે

કાંઈ અમારા રબ તરફ થી છે અને તેજ લોકો બોધ ગ્રહણ કરે છે કે જેઓ અક્કલમંદ છે,

(તેઓ દુઅા માંગે છે.....).

અનસ બીન માલિક કહે છે કે અમે હુ રસુલ સુથી પુછ્યું કે રાસેખુન ફીલ ઈલમ કોણ છે?

આપે ફરમાવ્યું કે એ લોકો છે જેના હાથ થકી નેકી થતી હોય, જબાન સાચી હોય, દિલ

મજહબપર કાયમ હોય, જે હરામ પેટ અને છુપી જગ્યાથી બચેલ હોય. આ બધા ગુણો માસુમો સિવાય કોઈમાં જોવામાં આવતા નથી કારણકે આ ઉમ્મતમાં તેમના સિવાય કોઈ એવો નથી કે જેણે નેકી સિવાય કોઈ જુલ્ભ કર્યો ન હોય, કદી જુઠ બોલેલ ન હોય, દિલમાં કદી ખરાબ વિચાર ન આવ્યો હોય, હલાલ કોળીયા સિવાય હરામ ખાદેલ ન હોય.
અબુ બસીરથી વર્ણન છે કે ઈમામે જાઅફ્રે સાદીક અઠો ફરમાવ્યું કે અમે રાસેખુન ફીલ ઇલમ છીએ. પ્રત્યેક જમાનામાં ઈમામની જરૂરત હોય છે, જહેરમાં હોય યા ગાએબ હોય.

૩૪ - રખના આમના ફગ-ફીર-લના વર-હમના વ અના ખયરુરરાહેમીનઃ

(મારા બંદાઓમાંથી એક એવો પણ ફીરકો હતો કે જે બરાબર દુઆ કરતો હતો કે)
અય અમારા પરવરદિગાર! અમે ઈમાન લાવ્યા, તો તું અમને બક્ષી આપ અને અમારા ઉપર રહેમ કર અને તું તમામ રહેમકરનારાઓથી બહેતર છો.

(સૂરએ અલ મુઅમેનુન; આયત: ૧૦૮)

અહાદિસથી એમ માઅલુમ પડે છે કે અહીં અસહાબે સુફ્ફા, ૪૦ બિલાલ, ૪૦ અમારે યાસીર અને સોહૈબ, વગેરે તરફ ઈશારો છે.

૩૫ - રખના ઈન્નના આમના ફગ-ફીર-લના ઝોનુબના વ કેના અગાબનાર :

અલ્લાહ તેની અગાઉની આયતમાં પરહેજગારોને જન્નતની ખુશખબરી આપી કહે છે:
(તે એવા લોકો છે કે જે કહે છે) અય અમારા રબ! એમાં કોઈ શંકા નથી કે અમે ઈમાન લાવ્યા છીએ, માટે તું અમારા ગુનાહોને બક્ષી આપ અને અમને જહન્નમના અગાબથી બચાવી લે.

(સૂરએ આલે ઈમરાન; આયત: ૧૬)

૩૬ - રખનગ-ફીર-લના ઝોનુબના વ ઈસરાફના ફી અમરેના વ સાખ્બીત અકદામના વન-સુરના અલલ કવમીલ કાફીરીન :

(જેઓ સાચા દિલના મોઅમીન છે તેઓ દુઆ કરે છે કે) અય અમારા પરવરદિગાર!

અમારા ગુનાહોને તેમજ અમારા કામની અંદર અમે હદ્થી વધ્યા (ઇસરાફ કર્યું) તેને તું માફ કરી આપ અને દુશમનોની સામે અમારા પગ જમાવી આપ અને કાફીરોની કોમ ઉપર અમને કામીયાબ કર.

(સૂરએ આલે ઈમરાન; આયત: ૧૪૭)

૩૭ - રખના મા ખલક-તા હાજા બાતેલા સુબહા-નકા ફકેના અગાબનાર :

(જેઓ અક્કલમંદ-બુધીશાળી સાચા અને પાક મોઅમીન છે તેના વખાણ કરતાં ખુદા ફરમાવે છે કે તેઓ ઉભા રહીને અને બેસીને તેમજ પડખાપર સુઈને અલ્લાહને યાદ કરે છે અને આસમાનો તથા ઝમીનોની ઉત્પત્તી વિશે વિચાર કરે છે અને કહે છે કે):

અય અમારા રબ! તે આ ફોકટ-નકકામું બનાવ્યું નથી, તું બીલકુલ પાક છો, માટે તું અમને દોઝખના અગાબથી બચાવ.

(સૂરાએ આલે ઈમરાન; આયત: ૧૮૧)

૩૮ - રખ્બના ફુગ-ફીર-લના જોનૂભના વ કફ્ફીર અન્ના સથેઆતેના વ તવફક્ષના મઅલ અબરાર:

અય અમારા પાલણહાર! હવે અમારા ગુનાહો માઝ કરી આપ અને અમારી બુરાઈઓને અમારાથી દુર કર અને નેક લોકો સાથે અમને દુનિયાથી ઉઠાવી મોત આપ.
(સૂરાએ આલે ઈમરાન; આયત: ૧૮૩)

૩૯ - રખ્બ નસરિદ્ધ અન્ના અજાબ જહન્નમ ઈન્ન અજાબહા કાન ગરામા; ઈન્નહા સાચત મુસ્તકરરંવ વ મોકામા :

(સૂરાએ કુરકાન; આયત: ૬૫/૬૬)

ખુદાએ રહમાન પોતાના એવા ખાસ બંદાઓના વખાણ કરતાં ફરમાવે છે કે: (અને જેઓ આ કહે છે કે) અય અમારા પરવરદિગાર! અમારાપરથી જહન્નમનો અજાબ દુર કરી દે, બેશક તેનો અજાબ હમેશાં ટકી રહેનારો છે; બેશક તે થોડો (વખત) કે હમેશ માટે રહેવાની ઘણીજ બુરી જગ્યા છે.

૪૦ - રખ્બનગ-ફીર-લના વલે ઈખવાનેનલ્લઝીના સબકૂના બીલ ઈમાને વલા તજઅલ ફી કોલુબેના ગીલ્લલ લીલ્લઝીના આમનૂ રખ્બના ઈન્નકા રઉફુર રહીમઃ:

(સૂરાએ હશર; આયત: ૧૦)

હવે અલ્લાહ અસહાબો પછી કયામત સુધીના મોઅમીનોના હાલનું વર્ણન કરતાં ફરમાવે છે કે: અને (તેમનો પણ હક છે કે) જેઓ (મોહાજેરીન અને અનસારોની) પછી આવ્યા અને દુઓ કરે છે કે: અય અમારા પરવરદિગાર! તું અમારી અને અમારા તે ભાઈઓની કે જેઓ અમારી પહેલાં ઈમાન લાવી ચુક્યા છે મગફેરત કર અને અમારા અંતકરણોમાં ઈમાનદારો પ્રત્યે કોઈ પણ પ્રકારનો કીનો (બદલો લેવાનો ખ્યાલ) પયદા ન થવા દે, અય અમારા રબ! ખરેખર તું ઘણો મહેરબાની કરનાર અને મહાન દ્વાળું છે

(ઈતિહાસીક બનાવો અને કુરાનની આયતોનો તરજુમો મર્હુમ મૌલાના સથ્યદ ફરમાનઅલી સાહેબ કીબલા અ૦મ૦ અને મર્હુમ અલ્લામા હાજી ગુલામઅલી હાજી ઈસમાઈલ સાહેબ અ૦મ૦ ની તફસીરે કુરાનમાંથી લેવામાં આવ્યાં છે.)

હારત અઈમાએ તાહેરીન અ૦મ૦ ની દુઆઓ :

હલાલે મુશકીલાત, અમીરૂલ મોઅમેનીન, આપણા પહેલા ઈમામ, હ૦ અલી ઈબ્ને અબીતાલીબ અ૦ ની દુઆઓનો એક સંગ્રહ છે જે સહીફાએ અલવીયાહ થી ઓળખાઈ છે.

ઉપરાંત, આપની બહુજ જાણીતી અને બેહતરીન દુઆઓમાંથી એક દુઆએ કુમયલ છે કે આપ હારતે, કુમયલ ઈબ્ને જીયાદે નખરી, આપના ભરોસાપાત્ર ખાસ સહાબીને શીખવી હતી અને તે

દર શબે જુમ્બાની રોનક બને છે. દુશમનોની તકલીફથી બચવા, રોજીની વિશાળતા અને ગુનાહોની મગફેરત માટે, તે દુઆ બહુજ અસરકારક છે.

દુઆએ સબાહ કે જે સુભજની નમાજ બાદ પડવા વારિદ થઈ છે, દુઆએ મશલુલ કે જે અનેક ફાયદાઓથી ભરપુર છે, દુઆએ અદીલાહ કે જે નમાજે સુભજ પણી પડવા વિનંતી થઈ છે.

સેક્ટુલ ઈસ્લામ, આકાએ શેખ અબ્બાસે કુમ્મી તા.સ. મઝાતીહુલ જ્ઞાનમાં લખે છે કે: જાણવું જોઈએ કે બેહતરીન સમય, વહેલી સવારથી લઈને સૂરજ ઉગવાના સુધીનો દરમીયાની વખત છે. અમુક હદ્દીસોમાં આ વખતને ગફ્ફલતની ઘડી તરીકે ઓળખાવવામાં આવેલ છે.

જેમકે હ૦ ઈ૦ મોહમ્મદે બાકિર અઠથી મનકુલ છે કે શયતાન મલઉન પોતાના લશકરને બે સમયોમાં આલમના અતરાફમાં ફેલાવે છે: સૂર્ય દુબવાના અને ઉદ્ય થવાના વખતે. તો તમે આ બન્ને વખતોમાં અલ્લાહને ખુબ ખુબ યાદ કરતા રહો. તેમાં શયતાન અને તેના લશકરની બદીઓથી અલ્લાહ પાસે પનાહ માંગતા રહો. આવા વખતે પોતાના બચ્ચાઓને અલ્લાહની પનાહમાં સૌંઘ્યા કરો, કેમકે એ બન્ને વખત ગફ્ફલતના વખત છે.

જાણવું જોઈએ કે આ બન્ને વખતોમાં સુવું-ઉધવું મકરૂહ છે. આ પણ ઈ૦ મોહમ્મદે બાકિર અઠથી મરવી છે કે સવારના વખતે ઉધવું બદબાખ્તી અને અપશુકનિયાળ છે. એ માં રોજી ઓછી થાય છે. દુઆએ મશલુલના વિભાગમાં મહુમ અલ્લામા હાજ ગુલામઅલી હાજ ઈસમાઈલ અ૦મ૦ લખે છે કે: એક રાત્રીએ હ૦ અમીરુલ મોઅમેનીન અલી અ૦, હ૦ ઈ૦ હુસ્યન અ૦ની સાથે, મકકામાં કાઅબાનો તવાફ કરતા હતા. એટલામાં કોઈનો રડવાનો અવાજ હજરતના કાનમાં પહોંચ્યો, તે ફરિયાદ કરી રહ્યો છે. આ સાંભળી, બન્ને બુજરગવારો તે શાખા પાસે તશરીફ લઈ ગયા. જ૦ અમીરુલ મોઅમેનીન અ૦મે પુછ્યું કે: તારું શું નામ છે? તો અરજ કરી કે: મારું નામ મોનાજીલ બીન લાહેકે શયબાની છે. યા અમીરુલ મોઅમેનીન અ૦! હું ખુદાની નાફરમાની કરતો હતો, મારો બાપ મને અજાબે ઈલાહીથી ડરાવતો હતો, તે જ્યારે નસીહત કરતો હતો ત્યારે હું તેને મારતો હતો. પછી લાચાર થઈને તેણે રોજો રાખ્યો અને ખાનએ કાઅબામાં જઈને નમાજ પડી, તવાફ કરીને આસમાન તરફ હાથ ઉંચા કરીને બારગાહે ખુદામાં શીકાયત કરીને ખુદા પાસે બદદોઆ કરી તેથી મારું અધું' અંગ સુકાઈને લક્ષ્યો થયો, જે આપ જોઈ રહ્યા છો. પછી મેં મારા બાપ પાસે કસુરની માઝી ચાઢી અને અર્જ કરી કે આ જગ્યાએ મારા માટે નેક દુઆ કરો કે આ બલા દફે થાય. મારા બાપે કબુલ કરવાથી તેને ઉટ ઉપર બેસાડીને અહીયા લાવતો હતો, એટલામાં રસ્તામાં એક પક્ષીના ઉડવાના અવાજથી ઉંટ ભડકીને કુદ્યો. તેથી મારો બાપ ઉંટ ઉપરથી પડીને મરી ગયો. હવે તમામ જણ મને બાપનો આક કહે છે, તેથી મને મારી બીમારી કરતાં વધારે સદ્મો લાગે છે.

હ૦ અમીરુલ મોઅમેનીન અ૦મે તેને એક દુઆ લખી આપીને ફરમાવ્યું: આજ રાત્રીએ આ દુઆ વજુ કરીને પડ અને સવારે મારી પાસે આવજે. આ બલા તારા જ્ઞસમમાં બાકી નહીં રહે અને તારી તૌબા કબુલ થશે. તેણે આ દુઆ હજરત પાસેથી લીધી, રાત્રે પડી સુભજના વખતે હજરતની ખીદમતમાં ગયો. તો તે બીમારીથી તેને શાફ થઈ હતી અને તે દુઆ તેના હાથમાં હતી અને અરજ કરી કે: યા અમીરુલ મોઅમેનીન અ૦! ખુદાના સોગાંદ, કે આ દુઆ ઈસ્મે આઅઝમ છે કે રાતના જ્યારે તમામ લોકો સુઈ ગયા હોય અને મસજીદુલ હરામમાં લોકોનું આવવું-જવું ઓછું થયું તો આસમાન તરફ હાથ ઉપાડીને આ દુઆ પડીને હું સુઈ ગયો. સ્વખામાં હ૦ પયગમ્બરે

ખુદા સર્ટને જોયા, પોતાના હાથ મુબારક મારા બદન ઉપર ફેરવીને ફરમાવ્યું કે આ ઈસ્મે અસ્તુમની હીફાજત કર. મારી આંખ ખુલી ગઈ તો હું તંદુરસ્ત હતો. યા અમીરુલ મોઅમેનીન અ૦! હક્તાલા આપને જરૂરે ખ્યર આપે.

હું સચ્ચાદે સજજાદ, આપણા ચોથા ઈમામ, અલી જ્યનુલ આબેદીન અ૦ ની દુઆઓનો ખજાનો કે જે સહીફાએ સજજાદીયાહ, સહીફાએ કામેલા, જબુરે આલે મોહમ્મદ, ઈનજીલે એહ્લેબ્યત થી મશહૂર છે.

ઈમામ જે રીતે અલ્લાહની દરગાહમાં હાજર થતા હતા, તે આજે પણ માઅબુદ્ધના દરબારમાં પહોંચવા, જે તડપી રહ્યા હોય છે, એવાઓને સુંદર માર્ગદર્શન આપે છે.

આપણા બધા ઈમામો કે જે માઅસુમ - નિષપાપ - ગુનાહોથી બીલકુલ પવિત્ર હોવા છતાં, કેવી નમૃતા, અદબ, વિવેક અને આજેજીપૂર્વક અલ્લાહની સમક્ષ પેશ થતા હતા! તો પછી આપણા જેવા પાપી ઈન્સાનોને, કે જે સવાર-સાંજ ગુનાહોના હોજમાં પલદેલાં હોય, કેવી રીતે પરવરદિગારના દરબારમાં પહોંચવું જોઈએ!

હું ઈન્સાન અ૦ ની દુઆએ અરફા કે જે આપ હજરતે, નવ જીલહજના દિવસે, અસરના ટાઈમે, મયદાને અરફાતમાં, પહાડની જમણી બાજુ ઉભા રહી, કીઝલા સામે મોહું કરી, બન્ને હાથોને ચહેરાની સામે આસમાન તરફ બુલંદ કરી, અલ્લાહની બારગાહમાં આજેજી સાથ અને એક મીસકીન-માંગનારની હાલતમાં, જબાન મુબારકથી ઉચારી હતી.

માઅસુમીન અ૦મુઠી મનકુલ થયેલી માહે રજબની દુઆએ ઉમ્મે દાઉદ અને માહે મુબારક રમજાનમાં સેહરીના સમયે, ચોથા ઈમામ અ૦ની પડવામાં આવતી દુઆએ અબુ હમજાએ શિમાલી અથવા મુબારક રાસ્તીની ઈમામે જમાના અજ્ઞલલાહો તાલા ફરજહુની દુઆએ ઈફતેતાહ, વગેરે... દરેક ઈમામથી નકલ થયેલી દુઆઓ એક એવો અખુટ ભંડાર છે કે જે ગમે તેવી યાતના કે મુસીબતમાં મદદરૂપ બને છે.

એહ્લે સુન્નત વલ જમાઅતના ઈમામ અહમદ બિન હભલ પોતાના પુસ્તક મનાકેબ માં ઉમ્મુલ મુસ્લેમીન બીબી આયેશાથી રિવાયત કરે છે કે હું એક રાતના ખાબમાંથી જાગ્રત થઈ. તે રાસ્તીના જી રસ્સુલેખુદા સર્ટ મારા ઘરે હતા, પણ મેં આં હજરત સર્ટ ને મુસલ્લાપર જોયા નહીં, જ્યાં આપ રાતના ઈબાદત કરતા હતા. મેં દરેક સ્થળે આપની શોધ કરી. કોઈ જગ્યાએ નજર આવ્યા નહીં. ઘરની છત ઉપર શું જોઈ રહી છું કે હજરત સજ્દામાં છે અને દુઆ કરી રહ્યા છે કે: ઈલાહી બે હક્કે અલીથીન વલીએક ઈગફીર લે મોહમ્મદીન નભીથીક અલ્લાહમહ શુરની ફી જુમરતે મોહિબીહીમ : ખુદાવંદા! તને વાસ્તો આપું છું તારા વલી અલી ઈન્ને અબી તાલીબનો કે બક્ષી આપ મોહમ્મદ સર્ટને અને મહશુર કર મને તેમના દોસ્તોના ટોળામાં. (રાહેનજાત અંક નંબર: ૧૨, વખ' ૨૮(૮૭) માહે જીલહજ હિજરી ૧૪૦૬)

મુલ્લા નીસારહુસયન રાજપાર
સેં ધેની લા રેયુનિયન